

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગર



શ્રી વિજય રૂપાણી
માનનીય મુખ્યમંત્રી,
ગુજરાત રાજ્ય

શ્રી નીતિનભાઈ પટેલ
માનનીય નાયબ મુખ્યમંત્રી,
ગુજરાત રાજ્ય

શ્રી કુંવરજીભાઈ ડાવળીયા
માન. મંત્રી,
ગુજરાત રાજ્ય

વાર્ષિક
અહેવાલ
૨૦૧૯-૨૦

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના તા.૩૧.૦૩.૨૦૨૦ ના રોજ પૂરા થતા વર્ષ માટેનો કંપની ધારો, ૨૦૧૩ ની કલમ ૩૯૫ (૧) મુજબનો વાર્ષિક અહેવાલ.

વાર્ષિક અહેવાલ રજૂ કરનાર અધિકારીનું નામ

ધનંજય દ્વિવેદી (આઇ.એ.એસ.)

સચિવ (પાણી પુરવઠો)

નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ,

ગુજરાત સરકાર



(ધનંજય દ્વિવેદી) (આઇ.એ.એસ.)

અધિકારીની સહી

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ

વર્ષ ૨૦૧૯-૨૦ વાર્ષિક વહીવટી અહેવાલ રજૂ કરવા બાબત

- ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાણી પુરુ પાડવા માટેની બલ્ક પાણી પુરવઠા યોજનાઓનો અમલ કાર્ય સંચાલન અને નિભાવણી કરે છે. અને ગુજરાત પાણી પુરવઠા મારફત જન સમુદાયોને તથા મહાનગર પાલિકા, નગરપાલિકા અને કચ્છ, રાજકોટ, જામનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર, મહેસાણા, બોટાદ, મોરબી, દેવભુમી ધ્વારકા વગેરે જીલ્લાઓમાં ઉધોગોને પંપીંગ સ્ટેશન થકી પાણી પુરુ પાડે છે. આપાણી સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ/જળ સંપત્તિ વિભાગની મુખ્ય અને બ્રાન્ચ શાખા નહેરમાથી મેળવવામાં આવે છે. હાલ ૪૨ પંપીંગ સ્ટેશન અને ૨૯૬૦ કિ.મી થી વધુ બલ્ક પાઇપલાઇન મારફતે પાણી સપ્લાય કરવામાં આવે છે.
- તમામ પ્રોજેક્ટ જેવા કે એન.સી ૧ થી એન.સી ૧૮, એન.સી ૨૨ થી ૨૫ (એન.સી ૧૩ સિવાય) એસ.ઓઈ.પી ૩એ, કે નેટવર્ક અને સ્વર્ણિમ ગુજરાત વોટર ગ્રીડ કાર્યક્રમ (એન.સી ૨૬ થી એન.સી ૩૪) સહિતની પરીયોજનાઓમાં ૪૦૦ મીમી વ્યાસથી ૨૪૦૦ મીમી વ્યાસની આશરે ૨૯૬૦ કિ.મી લંબાઇની પાઇપલાઇન યોજનાઓ કાર્યાન્વિત છે.
- હાલ કુલ ૪૨ પંપીંગ સ્ટેશનોમાં કુલ ૨૩૯૦ એમ.એલ.ડી ક્ષમતાના પંપીંગ મશીનરી સ્થાપિત કરેલ છે.

પુર્ણ થયેલ / પ્રગતિ હેઠળના કામો

A. વર્ષ દરમિયાન કંપનીએ હાથ ધરેલ કામો (નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦)

(૧) ડી સેલીનેશન પ્લાન્ટ

1. રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સ ઉભો કરવા હેતુ ગુજરાતના ૧૬૦૦ કી.મી .લાંબા દરીયા કાંઠે આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને સ્થાનિક જળસલામતિ પ્રદાન કરવા હેતુ, વિવિધ સ્થળોએ સ્થાનિક જરૂરીયાત મુજબ દરિયાના પાણીને મીઠું પાણી બનાવવા માટેના "ડી-સેલીનેશન પ્લાન્ટ" સ્થાપવાનો અભૂતપૂર્વ નિર્ણય ગુજરાત સરકારશ્રીએ કરેલ છે.

2. સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારના દરિયા કિનારાના ૪ સ્થળોએ કુલ ૪ સી વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાનિક વસ્તીની જરૂરીયાતોને ધ્યાને લઈને સ્થાપવા નિર્ણય કરેલ છે તથા તેના અમલીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

I. દેવભુમી - ધ્વારકા જિલ્લાના ગાંધવી ગામ નજીક ૭૦ એમ.એલ.ડી (૭ કરોડ લીટર)

II. ભાવનગર જિલ્લાના ઘોઘા ગામ નજીક ૭૦ એમ.એલ.ડી (૭ કરોડ લીટર).

III. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાલી ગામ નજીક ૧૦૦ એમ.એલ.ડી (૧૦ કરોડ લીટર)

IV. ગીર - સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા - ઝાલા ગામ નજીક ૩૦ એમ.એલ.ડી (૩ કરોડ લીટર)

3. આ તમામ પ્લાન્ટો માટે તમામ એસ.પી.વી ધ્વારા જરૂરી પર્યાવરણીય મંજૂરીઓ તથા નાણાંકીય વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે મેળવ્યા બાદ તમામ પ્રોજેક્ટોની બાંધકામની કામગીરી પુર્ણ કરી તમામ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે અને દૈનિક કુલ ૨૭ કરોડ લિટર પાણી મીકું થશે. અને વિવિધ ડી સેલીનેશન પ્લાન્ટને રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ સાથે સાંકળી સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોને વધુ જળસલામતી પ્રાપ્ત થશે.

(૨) બ્રાહમણી ડેમ ૨ થી એન.સી ૭ મોરબી પંપીંગ સ્ટેશન પ્રોજેક્ટ

- બ્રાહમણી ડેમ ૨ થી નવા સાદુલકા ગામ પાસેના એન.સી ૭ મોરબી પંપીંગ સ્ટેશન સુધી ૩૦૦ એમ.એલ.ડી પાણી વહન કરવા માટે ઇન્ટેક વેલ, પંપ હાઉસ એપ્રોચ રોડ, સીવીલ તથા ઇલેક્ટ્રો મીકેનિકલ તથા પાઇપલાઇનના કામોને ત્રણ પેકેજમાં કામો સુપ્રત કરી કામો શરૂ કરવામાં આવેલા હતા
- હાલમાં આ ત્રણેય પેકેજના કામો પ્રગતિમાં છે.

આયોજન હેઠળના કામો

(૩) નાવડાથી ચાંવડ બલ્ક પાઇપલાઇન

- બોટાદ, અમરેલી, જુનાગઢ, રાજકોટ તથા પોરબંદર જિલ્લાની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખી કુલ ૨૮૦ એમ.એલ.ડી માટે નાવડાથી ચાંવડ બલ્ક પાઇપલાઇન અંદાજિત રકમ રા. ૬૪૪ કરોડના કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.

- હાલ આ કામો માટે સરકારશ્રી સ્તરેથી જરૂરી મેળવવામાં આવેલ છે તથા ટેન્ડરની કાર્યવાહી પુર્ણ કરી આ યોજનાના કામો સુપ્રત કરવામાં આવેલ છે અને હાલ આ કામો પ્રગતિમાં છે. જે જુન ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરવાનું આયોજન છે.
- આ યોજનાના કામો પૂર્ણ થયેથી તથા યોજના કાર્યાન્વિત થયેથી બોટાદ, અમરેલી, જુનાગઢ, રાજકોટ તથા પોરબંદર જીલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઓધોગિક વિસ્તારો મળી કુલ ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની ભવિષ્યની કુલ ૬૭ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.

(૪) બુઘેલથી બોરડાથી બલ્ક પાઇપલાઇન

- ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખી કુલ ૧૮૦ એમ.એલ.ડી માટે બુઘેલથી બોરડા બલ્ક પાઇપલાઇન અંદાજિત રકમ રા. ૩૭૬ કરોડના કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.
- હાલ આ કામો માટે સરકારશ્રી સ્તરેથી જરૂરી મંજૂરી મેળવવામાં આવેલ છે. તથા ટેન્ડરની કાર્યવાહી પુર્ણ કરી આ યોજનાના કામો સુપ્રત કરવામાં આવેલ છે અને હાલ આ કામો પ્રગતિમાં છે. જે જુન ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરવાનું આયોજન છે.
- આ યોજનાના કામો પૂર્ણ થયેથી તથા યોજના કાર્યાન્વિત થયેથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઓધોગિક વિસ્તારો મળી કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.

(૫) એન.સી ૩(વલભીપુર) પંપીંગ સ્ટેશન ખાતે જુની પંપીંગ મશીનરી તથા સંલગ્ન સાધન સામગ્રી બદલવાના કામો

સને ૨૦૦૨ માં એન.સી ૩ વલભીપુર પંપીંગ સ્ટેશન ખાતે પંપીંગ મશીનરી ગોઠવીને કાર્યરત કરવામાં આવેલ હતી ત્યારથી હાલ સતત કાર્યરત છે. જે બી નેટવર્કના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાઓના સમાવિષ્ટ ગ્રામીણ, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનું મહત્વનું પંપીંગ સ્ટેશન છે. જેને આશરે ૧૮ વર્ષ જેટલો સમય પુર્ણ થયેલ છે. સંપુર્ણ સીસ્ટમ સરળ અને સુગમ રીતે કાર્યરત રહે તે માટે હવે આ પંપીંગ મશીનરી તથા તથા સંલગ્ન સાધનસામગ્રી બદલવાની જરૂરીયાત જણાયેલ છે. જેથી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ ધ્વારા આ પંપીંગ મશીનરી તથા તથા સંલગ્ન સાધન સામગ્રી અંદાજિત

ખર્ચ રા. ૧૨ કરોડના ખર્ચે બદલવાનું નક્કી કરેલ છે. આ કામોના ટેન્ડરની કાર્યવાહી પુર્ણ કરી કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.

- (૬) એન.સી ૭ (મોરબી) પંપીંગ સ્ટેશન ખાતે જુની પંપીંગ મશીનરી તથા સંલગ્ન સાધન સામગ્રી બદલવાના કામો

સને ૨૦૦૨ માં એન.સી ૩ મોરબી પંપીંગ સ્ટેશન ખાતે પંપીંગ મશીનરી ગોઠવીને કાર્યરત કરવામાં આવેલ હતી ત્યારથી હાલ સતત કાર્યરત છે. જે સી નેટવર્કના જામનગર, મોરબી જીલ્લાઓના સમાવિષ્ટ ગ્રામીણ, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનું મહત્વનું પંપીંગ સ્ટેશન છે. જેને આશરે ૧૮ વર્ષ જેટલો સમય પુર્ણ થયેલ છે. સંપુર્ણ સીસ્ટમ સરળ અને સુગમ રીતે કાર્યરત રહે તે માટે હવે આ પંપીંગ મશીનરી તથા તથા સંલગ્ન સાધનસામગ્રી બદલવાની જરૂરીયાત જણાયેલ છે. જેથી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ ધ્વારા આ પંપીંગ મશીનરી તથા તથા સંલગ્ન સાધનસામગ્રી અંદાજીત ખર્ચ રા. ૧૪ કરોડના ખર્ચે બદલવાનું નક્કી કરેલ છે. આ કામોના ટેન્ડરની કાર્યવાહી પુર્ણ કરી કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.

- (૭) એસ.પી.પી ૨ (પીપળી) પંપીંગ સ્ટેશન ખાતે જુની પંપીંગ મશીનરી તથા સંલગ્ન સાધન સામગ્રી બદલવાના કામો

સને ૨૦૦૦ માં એસ.પી.પી ૨ પીપળી પંપીંગ સ્ટેશન ખાતે પંપીંગ મશીનરી ગોઠવીને કાર્યરત કરવામાં આવેલ હતી ત્યારથી હાલ સતત કાર્યરત છે. જે બી અને ડી નેટવર્કના જીલ્લાઓના સમાવિષ્ટ ગ્રામીણ, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનું મહત્વનું પંપીંગ સ્ટેશન છે. જેને આશરે ૨૦ વર્ષ જેટલો સમય પુર્ણ થયેલ છે. સંપુર્ણ સીસ્ટમ સરળ અને સુગમ રીતે કાર્યરત રહે તે માટે હવે આ પંપીંગ મશીનરી તથા તથા સંલગ્ન સાધનસામગ્રી બદલવાની જરૂરીયાત જણાયેલ છે. જેથી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ ધ્વારા આ પંપીંગ મશીનરી તથા તથા સંલગ્ન સાધનસામગ્રી અંદાજીત ખર્ચ રા. ૧૫ કરોડના ખર્ચે બદલવાનું નક્કી કરેલ છે. આ કામોના ટેન્ડરની કાર્યવાહી પુર્ણ કરી કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ



વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

(ગુજરાત સરકારનું સાહસ)

ડો. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૧, પહેલો માળ,
સેક્ટર-૧૦, ગાંધીનગર - ૩૮૨૦૧૦.

ફોન : (૦૭૯) ૨૩૨ ૩૯૫૩૭, ૯૯૭૮૪૪૧૧૪૭/૪૮, ફેક્સ : ૨૩૨૨૨૩૯૬

E-mail : gwilcompany1@gmail.com

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગર
૨૧મો વાર્ષિક અહેવાલ વર્ષ : ૨૦૧૯ - ૨૦

અનુક્રમણિકા

ક્રમ નં.	વિગત	પાન નંબર
૧.	નિયામક મંડળ	૦૨
૨.	૨૧મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ	૦૩
૩.	નિયામકોનો અહેવાલ	૧૧
૪.	૨૦૧૯-૨૦ ના હિસાબો પર ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલના કાર્યાલયની ટીકા-ટિપ્પણી	૨૨
૫.	સ્વતંત્ર ઓડિટર્સનો અહેવાલ	૪૪
૬.	સરવૈયું	૫૫
૭.	નફા-નુકસાન પત્રક	૫૬
૮.	રોકડ પ્રવાહ પત્રક	૬૪
૯.	મહત્વની હિસાબ નીતિઓ અને નાણાકીય પત્રકો ઉપરની નોંધ	૬૬
૧૦.	પ્રોક્સી ફોર્મ (એમ.જી.ટી.-૧૧)	૭૬
૧૧.	હાજરી સ્લીપ	૭૭
૧૨.	ટુંકા ગાળાની નોટીસ	૭૮



સંચાલક મંડળ	: (૧) શ્રી ધનંજય દ્વિવેદી, આઈ.એ.એસ. (૨) શ્રી રૂપવંત સિંઘ, આઈ.એ.એસ. (૩) શ્રી મયુર મહેતા, આઈ.એ.એસ. (૪) શ્રી એસ.બી. વસાવા (૫) શ્રી કે. એ. પટેલ (૬) શ્રી નિરવ સોલંકી (૭) શ્રી આર.ડી. સોની	અધ્યક્ષ નિયામક વહીવટી સંચાલકશ્રી નિયામક નિયામક નિયામક સ્વતંત્ર નિયામક
-------------	---	---

વૈધાનિક ઓડિટર્સ : મે. કિશન એમ. મહેતા એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ,
અમદાવાદ.

બેન્કર્સ	:	(૧) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (અગાઉની સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર) ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર. (૨) પંજાબ નેશનલ બેંક સેક્ટર-૧૬, ગાંધીનગર. (૩) એચ.ડી.એફ.સી. બેન્ક સેક્ટર-૧૬, ગાંધીનગર (૪) આઈ.સી.આઈ.સી.આઈ. બેંક સેક્ટર-૧૬, ગાંધીનગર
----------	---	--

નોંધાયેલ કચેરી : ડો. જીવરાજ મહેતા ભવન
બ્લોક નં.૧, ૧લો માળ,
સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦
ગુજરાત.



ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

(ગુજરાત સરકારનું સાહસ)

ડા. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૧, પ્રથમ માળ, સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૦૧૦

નોટિસ

પ્રતિ,
શેરહોલ્ડરશ્રીઓ,

આથી નોટિસ આપવામાં આવે છે કે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ની ૨૧મી વાર્ષિક સામાન્ય સભા તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ બોર્ડ રૂમ, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, પ્રથમ માળ, બ્લોક નં. ૧, ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે ૧:૪૫ કલાકે નીચેનું કામકાજ કરવા મળશે.

સામાન્ય કામકાજ

- તા. ૩૧મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે કંપનીના ઓડિટ કરેલા વાર્ષિક નાણાંકીય પત્રકો (સ્ટેન્ડઅલોન) અને એના પરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ઓડિટર્સ અને કોમ્પ્રોલર અને ઓડિટર જનરલનો અહેવાલ સહિત મેળવવા, સ્વીકારવા અને મંજૂર કરવા.
- વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે વૈધાનિક ઓડિટર્સના મહેનતાણાની વિચારણા કરવા અને તે નક્કી કરવા.

નિયામક મંડળ માટે અને એમના વતી
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

તારીખ: ૨૧/૧૨/૨૦૨૦

સ્થળ: ગાંધીનગર

સહી/-
મયુર મહેતા, આઈ.એ.એસ.
વહીવટી સંચાલક

નોંધ:

- (૧) ખાસ કાયવાહીને લગત કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૦૨(૧) ના સંદર્ભમાં સ્પષ્ટતા દર્શક નિવેદનો આ સાથે સામેલ છે. આ નિવેદનો નોટિસનો ભાગ બને છે.



- ૨) જે સભ્ય મીટિંગમાં હાજર રહેવા અને વોટ આપવા અધિકૃત છે તે પોતાનાં બદલે અને પોતાના વતી હાજર રહેવા અને મત આપવા માટે પ્રોક્ષી નીમી શકે છે જે કંપનીનાં સભ્યો હોવા જરૂરી નથી. પણ અસરકારક વ્યવસ્થા માટે આ પ્રોક્ષી અંગેની ભલામણ કંપનીને મિટિંગ ના અડતાલીસ (૪૮) કલાક પહેલા મળવી જોઈએ. લીમીટેડ કંપની, સોસાયટી વગેરે વતી નિમાયેલ પ્રોક્ષીના સમર્થનમાં ઠરાવો, અધિકૃતિ ફરજિયાત છે.
- (૩) સભ્યોને સંપૂર્ણ વિગતો યોગ્ય રીતે ભરેલી અને પોતાની સહી કરેલી પોતાની હાજરી સ્લીપ સાથે લાવવા વિનંતી કરવામાં આવે છે.
- (૪) સંયુક્ત ધારકોના કિસ્સામાં જે સંયુક્ત ધારકોનું નામ આગળ હશે તે મીટિંગ માં મતદાન કરવા હકદાર રહેશે.
- (૫) સામેલ નોટીસ તથા સ્પષ્ટતા દર્શક નિવેદનોમાં જેનો ઉલ્લેખ છે તે દસ્તાવેજો મિટિંગની તારીખ સુધી ચાલુ દિવસોમાં તેમજ કામકાજના સમય દરમ્યાન કંપનીની રજીસ્ટર્ડ ઓફિસે નિરિક્ષણ માટે ખુલ્લા મુકવામાં આવેલ છે.
- (૬) કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૧૩ મુજબ જે કોર્પોરેટ સભ્યો પોતાના અધિકૃત પ્રતિનિધિઓ ને કંપનીની મિટિંગમાં મોકલવા માંગે છે તેઓએ સંબંધિત બોર્ડના ઠરાવ તથા પ્રતિનિધિઓને હાજરી આપવા તથા તેમના વતી મતદાન કરવાની સત્તા આપતો સહી સાથેનો અધિકૃતિ પત્ર કંપનીને મોકલી આપવા વિનંતી છે.
- (૭) જે કોઈ હિસાબોને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો સભ્યોને અગાઉથી કંપનીને જાણ કરવા વિનંતી છે. જેથી સંચાલકો મિટિંગના દિવસે આ માહિતી તૈયાર રાખી શકે.
- (૮) નોટીસના ભાગરૂપે ઉપરની બાબત (૧ અને ૨) ની સ્પષ્ટતા જોડાણ -ક તરીકે નોટીસના ભાગરૂપે સામેલ છે.

કંપની અધિનિયમ -૨૦૧૩ ની કલમ ૧૦૨ને અનુલક્ષીને સ્પષ્ટીકરણાત્મક નિવેદન

જોડાણ : ક

સામાન્ય કામકાજ અંગે સ્પષ્ટીકરણ

બાબત નં. ૧

કંપનીના ૩૧, મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટેના કંપનીના ઓડિટ થયેલ નાણાંકીય પત્રક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ રીપોર્ટ, ઓડિટર્સ અને સી એન્ડ એ જી ના અહેવાલો સહિત મેળવવા, વિચારણામાં લેવા તથા સ્વીકારવા બાબત.

કંપની ધારો, ૨૦૧૩ની કલમ ૮૬ની જોગવાઈઓ અનુસાર દરેક કંપનીએ દર વર્ષે તેની સાધારણ સભા (જીએમ) વાર્ષિક સાધારણ સભા (એજીએમ) તરીકે યોજવાની રહે છે અને બે વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે ૧૫ માસથી વધારે સમય હોવો જોઈએ નહીં. આવી વાર્ષિક સાધારણ સભા નાણાંકીય વર્ષ પુરું થયાની તારીખ થી ૬ મહિનાની અંદર એટલે કે ૩૦ સપ્ટેમ્બર પહેલા યોજવાની હોય છે. જો કે “કોવિડ-૧૯” ને ધ્યાનમાં રાખીને રજીસ્ટ્રાર ઓફ કંપની દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેની વાર્ષિક સાધારણ સભા યોજવાની સમય મર્યાદા કે ત્રણ માસ એટલે કે તા. ૩૧-ડીસેમ્બર ૨૦૨૦ સુધી વધારી આપી છે.

આ વાર્ષિક સાધારણ સભામાં જી.ડબલ્યુ.આઈ.એલ. દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેની નાણાંકીય પત્રકો, વૈધાનિક ઓડિટર્સના અહેવાલ નિયામકોના અહેવાલ તથા સીએન્ડએજી અહેવાલ સાથે મુકવા જરૂરી છે. જીડબલ્યુઆઈએલના નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું ઓડિટ પૂર્ણ થયું છે. હવે બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલ ઓડિટ થયેલ હિસાબો વૈધાનિક ઓડિટર્સના અહેવાલ સાથે સીએન્ડ એજીને રજૂ કરવામાં આવશે. તેથી નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના નાણાંકીય પત્રકો ઉપરની સી એન્ડ એજીની આખરી ટિપ્પણી મેળવવાનું શક્ય બની શકશે નહીં.

તેથી જી.ડબલ્યુ.આઈ.એલ. ટૂંકાગાળાની નોટિસ આપી કંપનીની એ.જી.એમ. બોલાવી શકે અને તેને કંપનીના નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના હિસાબો પરની સીએન્ડ એજીની આખરી ટિપ્પણી મેળવતા સુધી મુલતવી રાખી શકે.

આ ઠરાવમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈપણ સંચાલક હિત ધરાવતા નથી.

નીચે દર્શાવેલ ઠરાવ સુધારા સાથે કે સુધારા વિના એક સામાન્ય ઠરાવ તરીકે પસાર કરવા સભ્યોને વિનંતી કરવામાં આવે છે.

સૂચિત ઠરાવ:

આથી ઠરાવવામાં આવે છે કે તા.૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપનીના ઓડિટ કરેલા પત્રકો (એકલા) એટલે કે ૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજનું સરવૈયું અને તા.૧/૪/૨૦૧૯ થી તા.૩૧/૩/૨૦૨૦ સુધીના સમયગાળાનું



નફાનુકસાન ખાતું તેના પત્રકો (શીડયુલો), ખાસ હિસાબી નીતિઓ અને હિસાબી નોંધો, બોર્ડનો અહેવાલ, વૈધાનિક ઓડિટર્સનો અહેવાલ અને સીએન્ડ એજનો અહેવાલ તથા વ્યવસ્થાપકોના જવાબની વિચારણા કરવામાં આવી છે અને તે સ્વીકારવામાં આવે છે.

બાબત નં. ૨:

વર્ષ ૨૦૨૦-૨૧ માટે વૈધાનિક ઓડિટર્સનાં મહેનતાણા વિચારણા કરી અને નકકી કરવું.

કંપની ધારો, ૨૦૧૩ ની કલમ ૧૩૯ (૫) ની જોગવાઈઓ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર્સ જનરલ દ્વારા નાણાકીય વર્ષની શરૂઆતથી ૧૮૦ દિવસમાં સરકારી કંપનીના વૈધાનિક ઓડિટર્સની નિમણૂક કરવી જોઈએ. કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૪૨ (૧) મુજબ વૈધાનિક ઓડિટરનું મહેનતાણું વાર્ષિક સાધારણ સભામાં સભ્યો દ્વારા નકકી કરવામાં આવે છે.

સીએન્ડ એજ એ તેઓના ક્રમાંક: સીએવી/સીઓવાય/ગુજરાત, જીજેડબલ્યુએટીઆર(૧)/૭૯૩ તા.૨૪.૦૮.૨૦૨૦ થી મેસર્સ કિશન એમ. મહેતા એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમદાવાદની વર્ષ ૨૦૨૦-૨૧ માટે કંપનીના વૈધાનિક ઓડિટર્સ તરીકે નિમણૂક કરેલ છે.

સંચાલક મંડળ દ્વારા ઠરાવ ક્રમાંક ૯૫/૮ તા. ૩૦.૦૮.૨૦૨૦ થી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે કંપનીના વૈધાનિક ઓડિટર્સનું મહેનતાણું રૂ. ૧,૫૦,૦૦૦/- પ્લસ જીએસટી અને ખરેખર મુસાફરી ખર્ચ અને અન્ય ખર્ચ તેમ નકકી કરવા ભલામણ કરેલ છે.

આ ઠરાવમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈપણ સંચાલક હિત ધરાવતા નથી.

નીચે દર્શાવેલ ઠરાવ સુધારા સાથે કે સુધારા વિના એક સામાન્ય ઠરાવ તરીકે પસાર કરવા સભ્યોને વિનંતી કરવામાં આવે છે.

સૂચિત ઠરાવ:

શેર ધારકો દ્વારા સીએન્ડએજના પત્ર ક્રમાંક સીએવી/સીઓવાય/ગુજરાત/જીજેડબલ્યુએટીઆર(૧)/૭૯૩ તા.૨૪.૦૮.૨૦૨૦ થી વૈધાનિક ઓડિટર્સ તરીકે કિશન એમ. મહેતા એન્ડ કું. (ડબલ્યુઆર ૦૩૭૦)અમદાવાદની કરેલ નિમણૂકની નોંધ લે છે અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ વર્ષ માટે વૈધાનિક ઓડિટર્સનું નકકી કરેલ મહેનતાણું રૂ. ૧,૫૦,૦૦૦/- પ્લસ જીએસટી અને ખરેખર મુસાફરી ખર્ચ તથા અન્ય ખર્ચ જેની બોર્ડ તથા ઓડિટ કમિટી દ્વારા ભલામણ કરાયેલ છે. તેને મંજૂર કરવા ઠરાવે છે.

નિયામક મંડળ માટે અને એમના વતી
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

તારીખ: ૨૧/૧૨/૨૦૨૦

સ્થળ: ગાંધીનગર

સહી/-

મયુર મહેતા, આઈ.એ.એસ.
વહીવટી સંચાલક



ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

(ગુજરાત સરકારનું સાહસ)

ડા. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૧, પ્રથમ માળ, સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૦૧૦

નોટિસ

પ્રતિ,
શેરહોલ્ડરશ્રીઓ,

આથી નોટિસ આપવામાં આવે છે કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ની ૨૧મી મુલત્વી વાર્ષિક સામાન્ય સભા તા.૬ઠ્ઠી માર્ચ, ૨૦૨૧ ના રોજ બોર્ડ રૂમ, જી.ડબલ્યુ.એસ.એસ.બી., પ્રથમ માળ, જલસેવા ભવન, સેક્ટર-૧૦ ગાંધીનગર ખાતે ૪:૩૦ કલાકે નીચેનું કામકાજ કરવા મળશે.

સામાન્ય કામકાજ

૧. તા. ૩૧મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે કંપનીના ઓડિટ કરેલા વાર્ષિક નાણાંકીય પત્રકો (સ્ટેન્ડઅલોન) અને એના પરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ઓડિટર્સ અને કોમ્પ્રોલર અને ઓડિટર જનરલનો અહેવાલ સહિત મેળવવા, સ્વીકારવા અને મંજૂર કરવા.

નિયામક મંડળ માટે અને એમના વતી
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

તારીખ : ૦૪/૦૩/૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

સહી/-
મયુર મહેતા, આઈ.એ.એસ.
વહીવટી સંચાલક

નોંધ :

(૧) ખાસ કાર્યવાહીને લગત કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૦૨(૧) ના સંદર્ભમાં સ્પષ્ટતા દર્શક નિવેદનો આ સાથે સામેલ છે. આ નિવેદનો નોટિસનો ભાગ બને છે.



- ૨) જે સભ્ય મીટિંગમાં હાજર રહેવા અને વોટ આપવા અધિકૃત છે તે પોતાનાં બદલે અને પોતાના વતી હાજર રહેવા અને મત આપવા માટે પ્રોક્ષી નીમી શકે છે જે કંપનીનાં સભ્યો હોવા જરૂરી નથી. પણ અસરકારક વ્યવસ્થા માટે આ પ્રોક્ષી અંગેની ભલામણ કંપનીને મિટિંગ ના અડતાલીસ (૪૮) કલાક પહેલા મળવી જોઈએ. લીમીટેડ કંપની, સોસાયટી વગેરે વતી નિમાયેલ પ્રોક્ષીના સમર્થનમાં ઠરાવો, અધિકૃતિ ફરજિયાત છે.
- (૩) સભ્યોને સંપૂર્ણ વિગતો યોગ્ય રીતે ભરેલી અને પોતાની સહી કરેલી પોતાની હાજરી સ્લીપ સાથે લાવવા વિનંતી કરવામાં આવે છે.
- (૪) સંયુક્ત ધારકોના કિસ્સામાં જે સંયુક્ત ધારકોનું નામ આગળ હશે તે મીટિંગ માં મતદાન કરવા હકદાર રહેશે.
- (૫) સામેલ નોટીસ તથા સ્પષ્ટતા દર્શક નિવેદનોમાં જેનો ઉલ્લેખ છે તે દસ્તાવેજો મિટિંગની તારીખ સુધી ચાલુ દિવસોમાં તેમજ કામકાજના સમય દરમ્યાન કંપનીની રજીસ્ટર્ડ ઓફિસે નિરિક્ષણ માટે ખુલ્લા મુકવામાં આવેલ છે.
- (૬) કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૧૩ મુજબ જે કોર્પોરેટ સભ્યો પોતાના અધિકૃત પ્રતિનિધિઓ ને કંપનીની મિટિંગમાં મોકલવા માંગે છે તેઓએ સંબંધિત બોર્ડના ઠરાવ તથા પ્રતિનિધિઓને હાજરી આપવા તથા તેમના વતી મતદાન કરવાની સત્તા આપતો સહી સાથેનો અધિકૃતિ પત્ર કંપનીને મોકલી આપવા વિનંતી છે.
- (૭) જે કોઈ હિસાબોને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો સભ્યોને અગાઉથી કંપનીને જાણ કરવા વિનંતી છે. જેથી સંચાલકો મિટિંગના દિવસે આ માહિતી તૈયાર રાખી શકે.
- (૮) નોટીસના ભાગરૂપે ઉપરની બાબત (૧) ની સ્પષ્ટતા જોડાણ -ક તરીકે નોટીસના ભાગરૂપે સામેલ છે.



કંપની અધિનિયમ -૨૦૧૩ ની કલમ ૧૦૨ને અનુલક્ષીને સ્પષ્ટીકરણાત્મક નિવેદન

જોડાણ : ક

સામાન્ય કામકાજ અંગે સ્પષ્ટીકરણ

બાબત નં. ૧

કંપનીના ૩૧, મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટેના કંપનીના ઓડિટ થયેલ નાણાંકીય પત્રક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ રીપોર્ટ, ઓડિટર્સ અને સી એન્ડ એ જી ના અહેવાલો સહિત મેળવવા, વિચારણામાં લેવા તથા સ્વીકારવા બાબત.

કંપની ધારો, ૨૦૧૩ની કલમ ૯૬ની જોગવાઈઓ અનુસાર દરેક કંપનીએ દર વર્ષે તેની સાધારણ સભા (જીએમ) વાર્ષિક સાધારણ સભા (એજીએમ) તરીકે યોજવાની રહે છે અને બે વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે ૧૫ માસથી વધારે સમય હોવો જોઈએ નહીં. આવી વાર્ષિક સાધારણ સભા નાણાંકીય વર્ષ પુરું થયાની તારીખ થી ૬ મહિનાની અંદર એટલે કે ૩૦ સપ્ટેમ્બર પહેલા યોજવાની હોય છે. જો કે “કોવિડ-૧૯” ને ધ્યાનમાં રાખીને રજીસ્ટ્રાર ઓફ કંપની દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેની વાર્ષિક સાધારણ સભા યોજવાની સમય મર્યાદા કે ત્રણ માસ એટલે કે તા. ૩૧-ડિસેમ્બર ૨૦૨૦ સુધી વધારી આપી છે. તે મુજબ ૨૧મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ બોલાવવામાં આવેલ હતી અને સીએન્ડ એજીના ૨૦૧૯-૨૦ ના આખરી ટિપ્પણી મળે ત્યાં સુધી મુલતવી રાખવામાં આવેલ હતી.

મેસર્સ કિશન એમ. મહેતા એન્ડ કંપની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદ દ્વારા કરેલા ઓડિટને ૯૬મી બોર્ડ મિટિંગ જે તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૦ માં મંજૂર કરવામાં આવેલ. ત્યાર બાદ નાણાંકીય પત્રકો અને તેના વૈધાનિક ઓડિટર્સના અહેવાલ સાથે સીએન્ડ એજીને રજૂ કરવામાં આવેલ હતાં. અને સીએન્ડ એજીએ તેમની પૂરક ઓડિટ પૂર્ણ કરી.

નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે સીએન્ડ એજીની આખરી ટિપ્પણી પત્ર ક ટેક એસ.સેલ/એસ-૨/ કમેન્ટસ/ જી.ડબલ્યુ.આઈ.એલ./૨૦૧૯-૨૦/ ઓડબલ્યુ નં. ૨૩૪ તા. ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ મળેલ. ત્યાર બાદ ૨૧મી મુલતવી વાર્ષિક સામાન્ય સભા ટૂંકાગાળાની નોટીસ દ્વારા બોલાવવામાં આવેલ છે.

આ ઠરાવમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈપણ સંચાલક હિત ધરાવતા નથી.

નીચે દર્શાવેલ ઠરાવ સુધારા સાથે કે સુધારા વિના એક સામાન્ય ઠરાવ તરીકે પસાર કરવા સભ્યોને વિનંતી કરવામાં આવે છે.



સૂચિત ઠરાવ :

આથી ઠરાવવામાં આવે છે કે તા.૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપનીના ઓડિટ કરેલા પત્રકો (એકલા) એટલે કે ૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજનું સરવૈયું અને વર્ષ૨૦૧૯-૨૦ નું નફાનુકસાન ખાતું તેના પત્રકો (શીડ્યુલો), ખાસ હિસાબી નીતિઓ અને હિસાબી નોંધો, બોર્ડનો અહેવાલ, વૈધાનિક ઓડિટર્સનો અહેવાલ અને સીએન્ડ એજનો અહેવાલ તથા વ્યવસ્થાપકોના જવાબની વિચારણા કરવામાં આવી છે અને તે સ્વીકારવામાં આવે છે.

તારીખ : ૦૪/૦૩/૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

નિયામક મંડળ માટે અને એમના વતી
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

સહી/-
મયુર મહેતા, આઈ.એ.એસ.
વહીવટી સંચાલક



ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

સીઆઈએન ચુકવણી નંબર ૧૯૯૯એસજીસી૦૩૬૭૭૭
નોંધણી કચેરી : ડો. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૧, પ્રથમ માળ,
સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૦૧૦

નિયામકોનો અહેવાલ

પ્રતિ,

સભ્યશ્રીઓ,

કંપનીના કામકાજ અને કાર્યો ઉપરનો ૨૧મો વાર્ષિક અહેવાલ તથા તા.૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષના હિસાબો પ્રસ્તુત કરતા આપના નિયામકો આનંદ અનુભવે છે.

૧. કંપનીનો નાણાકીય સારાંશ અથવા મહત્વની બાબતો/ કામગીરી (એકલા)
બોર્ડનો અહેવાલ કંપનીના નાણાકીય પત્રકો પર આધાર રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

(રૂ. કરોડ માં)

વિગતો	૨૦૧૯-૨૦	૨૦૧૮-૧૯
કામગીરીઓમાંથી આવક (અ)	૪૫૭.૧૧	૩૭૪.૧૩
અન્ય આવક		
• વ્યાજ અને અન્ય આવક	૮૭.૮૮	૭૪.૦૪
• વિલંબિત અનુદાન આવક	૨૭૬.૮૦	૨૫૪.૭૮
• મહેસૂલ અનુદાન આવક	૧.૦૦	૩.૭૫
કુલ અન્ય આવક (બ)	૩૬૫.૮૮	૩૩૨.૫૭
કુલ આવક (અ + બ)	૮૨૨.૯૯	૭૦૬.૭૦
વાપરેલ માલ-સામાનની કિંમત	૨૪૬.૩૬	૧૮૦.૮૨
વીજળી ખર્ચ	૩૫૮.૮૬	૩૩૪.૫૧
અન્ય અને વહીવટી ખર્ચ	૪૧.૮૩	૩૮.૪૮
ઘસારો	૨૭૭.૬૫	૨૫૫.૬૯
કુલ ખર્ચ	૯૨૪.૯૦	૮૦૯.૬૦
અપવાદરૂપ અને અસાધારણ બાબતો તથા કર પહેલાનો નફો	-૧૦૧.૯૧	-૧૦૨.૯૦
અપવાદરૂપ બાબતો	૫.૧૭	૦.૨૨
કર ખર્ચ		
(ક) ચાલુ કર		
(ખ) વિલંબિત કર	-૦.૦૩	-૦.૦૨
વર્ષની ખોટ (+/-)	-૯૬.૭૮	-૧૦૨.૭૧
શેર દીઠ કમાણી / ખોટ મૂળ / ઘટેલી (+/-)	-૬.૪૩	-૬.૮૭



૨. વર્ષ દરમિયાન કંપનીએ હાથ ધરેલ કામો (નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦)

(એ) સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં ડીસેલીનેશન પ્રાયોજનાનું અમલીકરણ :

નર્મદાના તથા રાજ્ય પાણી પુરવઠા પાઈપ લાઈન પરનું અવલંબન ઘટાડવા તથા પાણી પુરવઠાની બાંહેધરી આપવાના હેતુથી ગુજરાત સરકારે દરિયાના પાણીને પીવાલાયક પાણીમાં પરિવર્તિત કરવા માટે ૧૬૦૦ કિ.મી.ના દરિયા કિનારાનો ઉપયોગ કરીને ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ ક્ષાર નિવારણ એકમો સ્થાપવાનું નક્કી કરેલ છે.

ગુજરાત સરકારે દરિયા કિનારે સાત ક્ષાર નિવારણ એકમો ઊભા કરવાનું નક્કી કરેલ છે. જેમ કે (૧) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંધવી ગામ પાસે ૭૦ એમ.એલ.ડી. (૩) ભાવનગર જિલ્લામાં ઘોઘા ગામ પાસે ૭૦ એમ.એલ.ડી. (૩) ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વડોદરા ગામ પાસે ૩૦ એમ.એલ.ડી. (૪) કચ્છ જિલ્લા ના માંડવી તાલુકાના ગુંદીયાળી ગામ પાસે ૧૦૦ એમ.એલ.ડી.

ચારેય સ્થળોના કામના અધિકાર પત્રો શાપુરજી પાલુંજી એન્ડ કંપની પ્રા.લિ. મુંબઈ તથા એકવાટેક સિસ્ટમ પ્રા.લિ.ની તા.૧૮/૧૧/૨૦૧૯ના રોજ મોકલવામાં આવેલ છે. મે. શાપુરજી પાલુંજી એન્ડ કંપની પ્રા. લિ. તથા એકવાટેક સિસ્ટમ પ્રા.લિ. બન્ને મળીને આ ચાર સ્થળોના કામો માટે એક ખાસ પ્રકારની કાર્યવ્યવસ્થા તા.૨૬/૧૨/૨૦૧૯ના રોજ ઊભી કરી છે. દરેક પ્રાયોજના માટે ખાસ પ્રકારની કાર્યવ્યવસ્થા માટેના ચાર એકમો દ્વારા તા. ૨૬/૦૨/૨૦૨૦ ના રોજ સંમતિસૂચક કરાર કરેલ છે. ખાસ પ્રકારની વ્યવસ્થા માટેના બધા એકમોએ વર્ષ દરમિયાન પર્યાવરણ વિભાગ પાસેથી મંજૂરી મેળવવાની તથા દરેક પ્રાયોજના માટે નાણાકીય સહાય માટેની કાર્યવાહી હાથપર લીધી છે.

(બી) બ્રાહ્મણી બંધ -૨ થી એન.સી-૭ મોરબી પંપીંગ સ્ટેશન પ્રાયોજના

બ્રાહ્મણી બંધ -૨ થી નવા સાદુલકા ગામ પાસેના એન.સી-૭ મોરબી પંપીંગ સ્ટેશન સુધી ૩૦૦ એમ.એલ.ડી. પાણી લીફ્ટ કરવા માટે નીચે મુજબના કામો હાથ ધરવામાં આવ્યા હતા.

પેકેજ -૧	એપ્રોચ ચેનલ, ઈન્ટેકવેલ કમ પંપ, એપ્રોચ બ્રીજ, પેનલરૂમ, સ્વીચયાર્ડ, ડીઝાઈન, ઈજનેરી, પુરવઠો, સ્થાપન, પરીક્ષણ તથા પંપીંગ મશીનરી તૈયાર કરવાનું અને એમ.એસ. પાઈપ (૨૦૨૮ એમ.એમ. વ્યાસના ૫૦૦ મીટર તથા ૧૨૦૦ એમ.એમ. વ્યાસના ૩૫૦ મીટર) પુરા પાડવા, પાથરવા, જોડવા પરીક્ષણ કરવા તથા તૈયાર કરવાના કામો.
પેકેજ -૨	બ્રાહ્મણી ડેમ-૨ થી ચક્રમપર ગામના નહેર પરના રસ્તાથી નવા સાદુલકા પંપીંગ સ્ટેશન સુધીની ૨૦૨૮ એમ.એમ. વ્યાસની ૧૮.૪૦ કિ.મી. લાંબી એમ.એસ. પાઈપ નાખવાના કામો.
પેકેજ -૩	ચક્રમપર ગામના નહેર કોર્સીંગ રોડથી નવા સાદુલકા પંપીંગ સ્ટેશન સુધીની ૨૦૨૮ મી.મી વ્યાસની ૧૪.૬૦ કિ.મી. એમ.એસ. પાઈપલાઈન પાથરવાના કામો.

વર્ષ દરમ્યાન ઉપરના પેકેજની અમલીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ ત્રણેય પેકેજ અંતર્ગત કામો પ્રગતિમાં છે.

૨. આયોજન હેઠળની પ્રાયોજનાઓ

(એ) નાવડા-ગઢડા થી ચાંવડ મોટી પાઈપ લાઈન

- ભવિષ્યમાં નાવડામાંથી ચાંવડને પાણી પુરુ પાડવા માટે માંગણી આવે તેને પહોંચી વળવાના હેતુથી રૂ. ૬૪૪ કરોડના અંદાજીત ખર્ચે નાવડાથી ગઢડા સુધી ની ૫૨ કિ.મી.ની પાઈપ લાઈન અને ગઢડાથી ચાંવડ સુધીની ૩૩.૫ કિ.મી. મળી કુલ ૮૫.૫ કિ.મી.ની પાઈપલાઈન નાખવાનું આયોજન કરેલ છે. જે નાવડાથી ગઢડા તરફ ૨૮૦ એમ.એલ.ડી. અને ચાંવડ તરફ ૨૦૦ એમ.એલ.ડી. પાણી વહન કરશે.
- આ પ્રાયોજનામાં નીચે મુજબના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
 - (૧) નાવડા-ગઢડા થી ચાંવડ સુધીની ૮૫ કિ.મી.ની પાઈપલાઈન
 - (૨) નાવડા-ગઢડા ખાતે પંપ હાઉસનું બાંધકામ
 - (૩) નાવડા-ગઢડા ખાતે પંપીંગમાટે યંત્ર સામગ્રી
 - (૪) નાવડા-ગઢડા અને ચાંવડ ખાતે સીમેન્ટ કોંક્રીટ નો સંપ બનાવવો.
 - (૫) નાવડા-ગઢડા અને ચાંવડના પંપીંગ સ્ટેશન ઉપર આર.સી.સી.ના એપ્રોચ રોડ, કંપાઉન્ડ વોલ વગેરે જેવા પરચુરણ કામો.
 - (૬) ૧૦ વર્ષના યોજના ચાલુ રાખવા તથા તેની મરામત (ઓપરેશન એન્ડ મેન્ટનન્સ) ના કામો
- આ કામ માટેની ટેન્ડર (નિવિદા) માહે ઓક્ટોબર-૨૦૨૦માં એનાયત કરવામાં આવેલ અને ભૌતિક કામગીરી શરૂ કરવામાં આવી છે.
- આ યોજના પૂર્ણ થતાં બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર વિસ્તારના ગ્રામીણ તથા શહેરી અને ઔદ્યોગિક વિસ્તારના ૧૨૯૮ ગામો તથા ૩૬ શહેરોની ૬૭ લાખ લાભાર્થીઓને પાણી મળવા અંગે ખાતરી આપી શકાશે.

(બી) બુધેલથી બોરડા બલ્ક પાઈપલાઈન

- ભાવનગર અમરેલી અને ગીર સોમનાથની ભવિષ્યની ૧૮૦ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાતને પહોંચી વળવા હેતુથી રૂ. ૩૭૬ કરોડ ના અંદાજીત ખર્ચે બુધેલ થી બોરડા સુધી ૫૮.૦૦ કીમીની પાઈપલાઈન નાખવાનું આયોજન કરેલ છે.
- આ કામમાં નીચે મુજબના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
 - (૧) બુધેલ થી બોરડા સુધીની ૫૮ કિ.મી.ની પાઈપલાઈન
 - (૨) બુધેલ ખાતે પંપ હાઉસનું બાંધકામ
 - (૩) બુધેલ ખાતે પંપીંગમાટે યંત્ર સામગ્રી
 - (૪) બુધેલ ખાતે સીમેન્ટ કોંક્રીટ નો સંપ બનાવવો.

- (પ) બુધેલ પંપીંગ સ્ટેશન ઉપર આર.સી.સી.ના એપ્રોચ રોડ, કંપાઉન્ડ વોલ વગેરે જેવા પરચુરણ કામો.
- (દ) ૧૦ વર્ષના યોજના ચાલુ રાખવા તથા તેની મરામત (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) ના કામો
- આ કામ માટેની ટેન્ડર (નિવિદા) માહે ઓક્ટોબર-૨૦૨૦માં એનાયત કરવામાં આવેલ છે અને ભૌતિક કામગીરી શરૂ કરવામાં આવી છે.
 - આ યોજના પૂર્ણ થતાં ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ વિસ્તારના ગ્રામીણ તથા શહેરી અને ઔદ્યોગિક વિસ્તારના ૬૧૨ ગામો તથા ૨૦ શહેરોની ૪૩ લાખ લાભાર્થીઓને પાણી મળવા અંગે ખાતરી પુરી પાડી શકાશે.
- (સી) જુની પંપીંગ મશીનરીની જગ્યાએ નવી મશીનરી નાખવાની તથા એન.સી.-૭ પંપીંગ સ્ટેશન ખાતે સંકળાયેલા ઈલેક્ટ્રોમીકેનીકલ કામો.
- એન.સી.-૭ (મોરબી) પંપીંગ સ્ટેશન તથા હયાત ઈલેક્ટ્રો મીકેનીકલ સવલત (કામો) સને ૨૦૦૨માં તૈયાર કરવામાં આવ્યા હતા. જામનગર, રાજકોટ તથા મોરબી જિલ્લાને પાણી પુરૂ પાડવા માટે એન.સી.-૭ ખૂબ જ અગત્યનું પંપીંગ સ્ટેશન છે. ઈલેક્ટ્રો મીકેનીકલ સાધનો ૧૮ વર્ષ જુના છે. તેથી ઉર્જાની બચત તથા વ્યવસ્થા સરળ રીતે ચાલે તે માટે પંપસેટ તથા ઈલેક્ટ્રો મીકેનીકલ સાધનો બદલવા જરૂરી છે. જીડબલ્યુઆઈએલ દ્વારા રૂા. ૧૪ કરોડના અંદાજિત ખર્ચે પંપસેટ તથા અન્ય આનુષંગિક ઈલેક્ટ્રો મિકેનીકલ ઉપકરણો બદલવાનું નક્કી કરેલ છે.
- (ડી) એન.સી.-૩ વલ્લભીપુર પંપીંગ સ્ટેશન સ્થિત જુની પંપીંગ મશીનરી તથા તેની સાથે સંકળાયેલ ઈલેક્ટ્રોમીકેનીકલ કામો બદલવા.
- આ પંપીંગ સ્ટેશન તથા હયાત ઈલેક્ટ્રો મિકેનીકલ સવલત (કામો) અને ૨૦૦૨માં ઉભા કરવામાં આવ્યા હતા. એન.સી.-૩ પંપીંગ સ્ટેશન ભાવનગર, અમરેલી, અને ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સુધીના ગ્રામીણ, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોના લાભાર્થીઓને પાણી પુરૂ પાડવા માટે ખૂબ જ મહત્વનું પંપીંગ સ્ટેશન છે. ઈલેક્ટ્રો મિકેનીકલ ઉપકરણો ૧૮ વર્ષ જુના છે. ઉર્જાની બચત કરવા તથા કાર્યક્ષમતા વધારવા તથા કામગીરી સરળતાથી ચાલે તે માટે પંપસેટ તેના સંકળાયેલા ઈલેક્ટ્રો મીકેનીકલ કામો (ભાગ) સાથે બદલવી જરૂરી છે. આ અનુસંધાને જીડબલ્યુઆઈએલ દ્વારા રૂા. ૧૨ કરોડના અંદાજિત ખર્ચે પંપ તથા અન્ય ઈલેક્ટ્રો મીકેનીકલ ઉપકરણો બદલવાનું નક્કી કરેલ છે.
- (ઈ) પીપળી પંપીંગ સ્ટેશન સ્થિત જુની પંપીંગ મશીનરી તથા તેની સાથે સંકળાયેલ ઈલેક્ટ્રોમીકેનીકલ કામો બદલવા.
- આ પંપીંગ સ્ટેશન તથા હયાત ઈલેક્ટ્રો મિકેનીકલ સવલત (કામો) અને ૨૦૦૦માં તૈયાર કરવામાં આવ્યા હતા. પીપળી પંપીંગ સ્ટેશન બી એન્ડ ડી નેટવર્ક તરફ પાણી પુરૂ પાડવા માટે ખૂબ જ મહત્વનું પંપીંગ સ્ટેશન છે. ઈલેક્ટ્રો મિકેનીકલ ઉપકરણો ૨૦ વર્ષ જુના છે. ઉર્જાની બચત કરવા તથા કામગીરી સરળતાથી ચાલે તે માટે પંપસેટ તેના સંકળાયેલા ઈલેક્ટ્રો મીકેનીકલ કામો (ભાગ) સાથે બદલવી જરૂરી છે. આ અનુસંધાને જીડબલ્યુઆઈએલ દ્વારા રૂા. ૧૧ કરોડના અંદાજિત ખર્ચ પંપ તથા અન્ય ઈલેક્ટ્રો મીકેનીકલ ઉપકરણો બદલવાનું નક્કી કરેલ છે.

- (એફ) સુખપર પંપીંગ સ્ટેશન સ્થિત જુની પંપીંગ મશીનરી તથા તેની સાથે સંકળાયેલ ઈલેક્ટ્રોમીકેનીકલ કામો બદલવા. સુખપર પંપીંગ સ્ટેશન તથા હયાત ઈલેક્ટ્રો મિકેનીકલ સવલત (કામો) અને ૨૦૦૩માં તૈયાર કરવામાં આવ્યા હતા. સુખપર પંપીંગ સ્ટેશન માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાના ખીરસરા સુધી પાણી પુરું પાડવા માટે ખૂબ જ મહત્વનું પંપીંગ સ્ટેશન છે. ઈલેક્ટ્રો મિકેનીકલ ઉપકરણો ૧૭ વર્ષ જુના છે. ઉર્જાની બચત કરવા તથા કામગીરી સરળતાથી ચાલે તે માટે પંપસેટ તેના સંકળાયેલા ઈલેક્ટ્રો મીકેનીકલ કામો (ભાગ) સાથે બદલવી જરૂરી છે. આ અનુસંધાને જીડબલ્યુઆઈએલ દ્વારા રૂ. ૧૨ કરોડના અંદાજિત ખર્ચે પંપ તથા અન્ય ઈલેક્ટ્રો મીકેનીકલ ઉપકરણો બદલવાનું નક્કી કરેલ છે.
- (ઈ) મંગવાણા પંપીંગ સ્ટેશન સ્થિત જુની પંપીંગ મશીનરી તથા તેની સાથે સંકળાયેલ ઈલેક્ટ્રોમીકેનીકલ કામો બદલવા. મંગવાણા પંપીંગ સ્ટેશન તથા હયાત ઈલેક્ટ્રો મિકેનીકલ સવલત (કામો) અને ૨૦૦૩માં તૈયાર કરવામાં આવ્યા હતા. મંગવાણા પંપીંગ સ્ટેશન નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકા તથા ખીરસરા સુધી પાણી પુરું પાડવા માટે ખૂબ જ મહત્વનું પંપીંગ સ્ટેશન છે. ઈલેક્ટ્રો મિકેનીકલ ઉપકરણો ૧૭ વર્ષ જુના છે. ઉર્જાની બચત કરવા તથા કામગીરી સરળતાથી ચાલે તે માટે પંપસેટ તેના સંકળાયેલા ઈલેક્ટ્રો મીકેનીકલ કામો (ભાગ) સાથે બદલવી જરૂરી છે. આ અનુસંધાને જીડબલ્યુઆઈએલ દ્વારા રૂ. ૧૦ કરોડના અંદાજિત ખર્ચે પંપ તથા અન્ય ઈલેક્ટ્રો મીકેનીકલ ઉપકરણો બદલવાનું નક્કી કરેલ છે.
૩. કામગીરીમાં પ્રકારમાં ફેર, જો હોય તો :
કંપનીની કામગીરીના પ્રકારમાં કોઈ ફેરફાર નથી.
૪. રિવિઝન્ડ:
કંપનીએ નાણાંકીય વર્ષ દરમિયાન ખોટ કરી છે. આપના નિયામકો ૩૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થતા વર્ષ માટે રિવિઝન્ડ ભલામણ કરતા નથી.
૫. અનામતો
નાણાંકીય વર્ષ દરમિયાન તમારી કંપનીએ રૂ. ૮૬.૮૭ કરોડની ખોટ કરેલ છે. આ નુકસાનની પુરેપુરી રકમ અનામત અને વધારા ખાતે તબદીલ કરેલ છે.
૬. શેરમૂડી :
કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. ૧,૭૫,૦૦,૦૦,૦૦૦ (રૂપિયા એકસો પંચોતેર કરોડ પૂરા), જે દરેક રૂ. ૧૦ નો એવા ૧૭,૫૦,૦૦,૦૦૦ ઈક્વિટી શેરોમાં વિભાજિત છે. અને કંપનીની બહાર પાડેલી, નોંધાયેલી અને ભરાયેલી શેર મૂડી રૂ. ૧,૫૫,૦૨,૦૦,૭૦૦ (રૂપિયા એકસો પંચાવન કરોડ બે લાખ અને સાતસો પૂરા) છે, જે તા. ૩૧ મી માર્ચ ૨૦૨૦ ના રોજ મુજબ દરેક રૂ. ૧૦નો એક એવા ૧૫,૫૦,૨૦,૦૭૦ ઈક્વિટી શેરોમાં વિભાજિત છે.



૭. નિયામકો અને મહત્વના વ્યવસ્થાકીય કર્મચારીઓ :
તા. ૧લી એપ્રિલ, ૨૦૧૯ થી અહેવાલ ની તારીખ સુધી જોડાણ-અ અનુસાર નિયામક મંડળમાં કરવામાં આવેલાં ફેરફારો રાજ્ય સરકારના આદેશથી કરવામાં આવેલ છે.
૮. કર્મચારીઓની વિગતો :
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એ લીસ્ટેડ કંપની નથી તેથી કલમ ૧૯૭(૧૨) અને કંપની (વ્યવસ્થાપકીય કર્મચારીગણની નિમણૂક અને મહેનતાણું) નિયમો, ૨૦૧૪ મુજબ કર્મચારીઓની વિગતો રજૂ કરવાની બાબત આ કંપનીને લાગુ પડતી નથી.
૯. બોર્ડ બેઠકો
વર્ષ દરમિયાન બોર્ડની ત્રણ બેઠકો તા.૨૧/૦૬/૨૦૧૯, તા.૨૫/૧૦/૨૦૧૯ અને તા.૨૨/૦૧/૨૦૨૦ ના રોજ યોજવામાં આવી હતી.
૧૦. ઓડિટ કમિટીની બેઠકો
ઓડિટ કમિટીની બેઠકો વર્ષ દરમિયાન તા.૨૧/૦૬/૨૦૧૯ અને તા. ૨૨/૦૧/૨૦૨૦ ના રોજ યોજવામાં આવી હતી.
૧૧. ઓડિટ કમિટીનું માળખું
તા.૩૧/૦૩/૨૦૨૦ ના રોજ ઓડિટ કમિટીના સભ્યો નીચે મુજબ હતા.

અનુ.	નામ	હોદ્દો
૧.	શ્રી રૂપવંતસીંઘ, આઈ.એ.એસ. સચિવ (ખર્ચ) નાણાં વિભાગ, (ઓડિટ કમિટીના અધ્યક્ષ)	અધ્યક્ષ
૨.	શ્રી આર.ડી.સોની સ્વતંત્ર સંચાલક, જીડબલ્યુઆઈએલ (સભ્ય)	સભ્ય
૩.	ડૉ. ગાર્ગી રાજપરા, મહિલા તથા સ્વતંત્ર સંચાલક, જીડબલ્યુઆઈએલ (સભ્ય)	સભ્ય

ઓડિટ કમિટીએ વર્ષ દરમિયાન કરેલ તમામ ભલામણો સંચાલક મંડળે સ્વીકારેલ છે.

૧૨. બોર્ડનું મૂલ્યાંકન
નિયામક મંડળની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. બોર્ડની કામગીરીના મૂલ્યાંકન અંગેની કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૩૪(૩)ની જોગવાઈઓ થી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તા.૦૫/૦૬/૨૦૧૫ ના જાહેરનામા દ્વારા સરકારી કંપનીને મુક્તિ મળેલ છે. આપની કંપની સરકારી કંપની હોવાના કારણે બોર્ડના મૂલ્યાંકનની જોગવાઈ લાગુ પડતી નથી.

૧૩. વૈધાનિક ઓડિટરો નો અહેવાલ અને સીએન્ડ એજનો અહેવાલ :

(અ) ઓડિટરનો અહેવાલ

ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા તા.૨૩-૦૮-૨૦૧૯ના પત્ર નં. સીએ/વી/સીઓવાય/ગુજરાત/જીજે/વોટર (૧) /૧૫૩૭ અન્વયે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઓડિટર મે. કિશન એમ. મહેતા એન્ડ કંપની (ડબલ્યુઆર ૦૩૭૦) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદને વૈધાનિક ઓડિટર તરીકે નિમવામાં આવ્યા હતાં. વૈધાનિક ઓડિટરે નાણાકીય પત્રકો પર આધારિત તેઓનો સ્વતંત્ર અહેવાલ તા.૩૦/૧૨/૨૦૨૦ ના રોજ સુપ્રત/પ્રસ્તુત કરેલ છે.

(બ) નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો સીએન્ડ એજનો અહેવાલ.

સી. અને એ. જી. દ્વારા કંપનીનાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ નાં નાણાકીય પત્રકો ઉપરની આખરી ટીકા-ટિપ્પણો તેઓના તા. ૧૭/૦૨/૨૦૨૧ના પત્રથી મળેલ છે. જે જોડાણ-બી તરીકે મુકેલ છે. સીએન્ડ એજની આખરી ટીકા-ટિપ્પણીઓ ઉપર વ્યવસ્થાપનનો જવાબ જોડાણ-સી તરીકે મુકેલ છે.

૧૪. આંતરિક ઓડિટ અને અંકુશ :

આંતરિક ઓડિટર મે. એન. પી. કે. યુ. એન્ડ એસોસિએટ્સના અહેવાલનાં તારણોની ચર્ચા ઓડિટ સમિતિ સાથે કરવામાં આવી અને કાર્યક્ષમતા સુધારવા માટે કરેલ સૂચનો અનુસાર સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

૧૫. જોખમ વ્યવસ્થાપન નીતિ :

જોખમ વ્યવસ્થાપન નીતિ અમલમાં નથી.

૧૬. વાર્ષિક અહેવાલની તારીજ :

કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૯૨(૩) અને કંપની (વ્યવસ્થાપન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ના નિયમ ૧૨(૧) ની જોગવાઈને અનુલક્ષીને જરૂરી બનવા પ્રમાણે, આ વાર્ષિક પત્રકની તારીજ અહેવાલના ભાગ તરીકે એમજીટી ૯ માં જોડાણ (ડી) તરીકે સામેલ રાખેલ છે.

૧૭. કંપનીની નાણાકીય સ્થિતિને અસર કરતા મહત્વના ફેરફાર અને પ્રતિબંધતાઓ :

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કંપનીની નાણાકીય સ્થિતિને અસર કરતા કોઈ મહત્વના ફેરફાર અને પ્રતિબંધતાઓ નથી.

૧૮. નિયમનકાર અથવા કોર્ટ અથવા ટ્રિબ્યુનલ દ્વારા મહત્વના અને તાત્વિક આદેશો બહાર પાડવામાં આવ્યા હોય કે જે કંપનીના પ્રવર્તમાન સ્થિતિને અસરકર્તા હોય :

કંપનીના ચાલુ ઉપક્રમ તરીકેના દરજજાને અને ભવિષ્યમાં કંપનીની કામગીરીઓ પર અસર કરે તેવા મહત્વના અને તાત્વિક આદેશો નિયમનકાર અથવા કોર્ટ અથવા ટ્રિબ્યુનલ દ્વારા આદેશ કરવામાં આવ્યા ન હતાં.



૧૯. કલમ ૧૮૬ હેઠળ લોન, ગેરંટીઓ અથવા મૂડી રોકાણોની વિગત :
લોનની વિગતો : શૂન્ય
મૂડી રોકાણની વિગત : શૂન્ય
પૂરી પાડેલી ગેરંટી/ જામીનગીરીની વિગત : શૂન્ય
૨૦. કરારો અથવા સંબંધિત પક્ષકાર સાથેની કાર્ય વ્યવસ્થાની વિગતો :
કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૮૮ ની પેટા-કલમ (૧) મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સંબંધિત પક્ષકાર સાથેની વ્યવસ્થા કે કરારની વિગતો જોડાણ-ઈ થી મુકવામાં આવેલ છે.
૨૧. ઉર્જા સંરક્ષણ, ટેકનોલોજી અપનાવવા અને વિદેશી હુંડિયામણની કમાણી અને જાવક :
ઉર્જા સંરક્ષણ ટેકનોલોજી સમાવેશ અંગે કંપની (હિસાબ) નિયમો-૨૦૧૪ કંપનીને લાગુ પડે છે.
(ક) વિદેશી હુંડિયામણની કમાણી અને જાવક : શૂન્ય
૨૨. કોર્પોરેટ એકમની સામાજિક જવાબદારી : (સીએસઆર)
કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૩૫ અનુસાર કંપનીએ “સી.એસ. આર. સમિતિ”ની રચના કરેલ છે. આમ છતાં તરત આગળના ત્રણ નાણાકીય વર્ષ પૈકી છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ નફો કર્યો ન હોવાથી કંપનીના બે ટકા નફાની તબદીલી/ ખર્ચવાનો પ્રશ્ન ઊભો થતો નથી. તેથી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૫ અને તે હેઠળ કરેલા નિયમ અનુસાર કંપનીએ કોર્પોરેટ સામાજિક જવાબદારી માટે ખર્ચ કરવાનું જરૂરી નથી.
૨૩. સેક્ટેરીયલ ઓડિટ અહેવાલ :
કંપની ધારા, ૨૦૧૩ની જોગવાઈ પ્રમાણે મે. ગૌદાણા એન્ડ ગૌદાણા કંપની સેક્ટેરીયલ દ્વારા સાદર કરેલ સેક્ટેરીયલ ઓડિટ અહેવાલ બોર્ડના અહેવાલ સાથે જોડાણ-એફ તરીકે બિડેલ છે.
૨૪. નિયામકોની જવાબદારી અંગેનું નિવેદન:
નિયામકોની જવાબદારી અંગેના નિવેદન બાબતે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ-૧૩૪ ની પેટા-કલમ(૩) ના ખંડ (સી) માં સૂચવ્યા અનુસાર આથી પ્રમાણભૂત કરવામાં આવે છે કે.
(ક) વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં લાગુ પડતાં હિસાબી ધોરણોનું પાલન કરવામાં આવેલ છે, સાથોસાથ જ્યાં મહત્વપૂર્ણ બાબતે છૂટછાટ (લેવામાં આવી હોય) તેના સંબંધમાં યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે.
(ખ) સંચાલકોએ વ્યાજબી અને સમજી વિચારીને એવી હિસાબી નીતિઓ પસંદ કરી છે અને તેને સતત અમલમાં મુકી છે અને વ્યાજબી અને શાણપણભર્યા નિર્ણયો લીધા છે અને અંદાજો મુક્યા છે કે જેથી નાણાકીય વર્ષ અંતિત હિસાબો તથા તે સમયનું નફા નુકસાનનું પત્રક કંપનીની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે છે.

- (ગ) સંચાલકોએ અસ્ક્યામતોને સુરક્ષિત રાખવા માટે અને ઠગાઈ તથા અન્ય ગેરરીતિઓ અટકાવવા અને શોધી કાઢવા માટે કંપનીધારાની જોગવાઈઓ મુજબ પર્યાપ્ત હિસાબી રેકર્ડ જાળવવા માટે યોગ્ય અને પુરતી કાળજી લીધી છે.
- (ઘ) કાર્યરત સંસ્થા તરીકેના વાર્ષિક હિસાબો નિયામકોએ ચીવટ પૂર્વક તૈયાર કર્યા છે.
- (ચ) લાગુ પડતા કાયદાઓની જોગવાઈઓનું અનુપાલન સુનિશ્ચિત કરવા, નિયામકોએ યોગ્ય પદ્ધતિઓ ઘડી કાઢી હતી અને તે પદ્ધતિઓ પર્યાપ્ત અને અસરકારક રીતે અમલમાં હતી.

૨૫. રોકાણકારોના શિક્ષણ અને સુરક્ષા ભંડોળમાં રકમની તબદીલી :

આપની કંપનીએ કદી ડિવિડંડ જાહેર કર્યું નથી તેથી રોકાણકારો માટેના શિક્ષણ અને સુરક્ષા ભંડોળમાં રકમ તબદીલ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

૨૬. આભાર સ્વીકાર/ સ્વિકૃતિઓ :

આપના નિયામકો, કંપની રજીસ્ટ્રાર, ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ તથા વૈધાનિક ઓડિટરોએ આપેલ સહકાર બદલ આભાર માનીને રેકર્ડ પર મુકવા પોતાની અંતઃકરણ પૂર્વકની ઈચ્છા વ્યક્ત કરે છે. નિયામકો, ગુજરાત સરકાર, ગુ.પા.પુ. અને ગ.વ્ય બોર્ડ, બેંકર કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી મળેલ સહકાર બદલ એમના કૃતજ્ઞ છે અને તેમના નિરંતર સમર્થન માટે આશાન્વિત છે.

નિયામક મંડળ માટે અને એમના વતી
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

તારીખ : ૦૬/૦૩/૨૦૨૧
સ્થળ : ગાંધીનગર

મયુર મહેતા, આઈ.એ.એસ.
વહિવટી નિયામક
ડિન : ૦૮૮૪૨૧૫૫

નિરવ સોલંકી
નિયામક
ડિન : ૦૮૭૫૦૪૯૪



બોર્ડ રીપોર્ટ

જોડાણ અનુક્રમણિકા

<u>જોડાણ</u>	<u>વિષય-સુચિ</u>
અ.	તા.૧ લી એપ્રિલ ૨૦૧૯ થી અહેવાલની તારીખ સુધી મુખ્ય વહિવટી કર્મચારીઓ, નિયામક મંડળમાં થયેલ મહત્વના ફેરફારોની વિગત
બ.	નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાંકીય પત્રકો ઉપર સી. અને એ.જી.ની ટીપ્પણી
ક.	કોમ્પ્રોલર અને ઓડિટર જનરલની આખરી ટિપ્પણી ઉપર વ્યવસ્થાપનનો જવાબ
ડ.	એમજીટી-૯માં વાર્ષિક પત્રકની તારીખ
ઈ.	નમૂના એઓસી-૨માં સંબંધિત પાર્ટીઓ સાથેના કરારો અથવા વ્યવસ્થાઓની વિગતો
ફ.	સેક્ટરીનો ઓડિટ અહેવાલ

જોડાણ -અ

તા.૦૧ લી એપ્રિલ ૨૦૧૯ થી અહેવાલની તારીખ સુધી નિયામક મંડળમાં થયેલ ફેરફારો નીચે મુજબ છે.

ક્રમ નં.	નિયામકનું નામ	ડીન/ પાન	હોદ્દો	નિમણૂંકની તારીખ	રાજીનામાની તારીખ
૧.	શ્રી જે. પી. ગુપ્તા, આઈ.એ.એસ.	૦૧૯૫૨૮૨૧	અધ્યક્ષ	૧૪.૦૭.૨૦૧૭	૩૦.૦૯.૨૦૧૯
૨.	શ્રી ધનંજય દિવેદી, આઈ.એ.એસ.	૦૭૨૬૦૯૦૮	અધ્યક્ષ	૩૦.૦૯.૨૦૧૯	થી ચાલુ
૩.	શ્રી મિલિન્દ તોરવણે, આઈ.એ.એસ.	૦૩૬૩૨૩૯૪	નિયામક	૧૪.૦૭.૨૦૧૭	૩૦.૦૯.૨૦૧૯
૪.	શ્રી રૂપવંતસિંઘ, આઈ.એ.એસ.	૦૬૭૧૭૯૩૭	નિયામક	૩૦.૦૯.૨૦૧૯	થી ચાલુ
૫.	શ્રી એમ. કે. જાદવ	૦૧૧૯૩૧૪૩	નિયામક	૦૬.૦૮.૨૦૧૫	૩૦.૦૯.૨૦૧૯
૬.	શ્રી કે. એ. પટેલ	૦૭૬૧૯૭૪૩	નિયામક	૩૦.૦૯.૨૦૧૯	થી ચાલુ
૭.	શ્રી સંદીપ વસાવા	૦૨૦૩૭૯૧૮	નિયામક	૧૪.૧૨.૨૦૧૬	થી ચાલુ
૮.	શ્રી તુષાર ધોળકીય, આઈ.એ.એસ.	૦૭૬૦૦૦૪૪	વહીવટી સંચાલક	૨૨.૦૬.૨૦૧૬	૩૦.૦૯.૨૦૧૯
૯.	શ્રી કે. કે. નિરાલા, આઈ.એ.એસ.		વહીવટી સંચાલક	૧૧.૦૯.૨૦૧૯	૨૯.૧૧.૨૦૧૯
૧૦.	શ્રી આર. એસ. નિનામા, આઈ.એ.એસ.	૦૮૭૪૫૬૯૮	વહીવટી સંચાલક	૦૩.૦૨.૨૦૨૦	૦૫.૦૬.૨૦૨૦
૧૧.	શ્રી મયુર મહેતા, આઈ.એ.એસ.	૦૮૮૪૨૧૫૫	વહીવટી સંચાલક	૦૫.૦૬.૨૦૨૦	થી ચાલુ
૧૨.	શ્રી રવિ સોલંકી	૦૩૬૧૮૮૨૯	નિયામક	૨૫.૦૮.૨૦૧૧	૩૦.૦૯.૨૦૨૦
૧૩.	શ્રી નિરવ સોલંકી	૦૮૭૫૦૪૯૪	નિયામક	૩૦.૦૯.૨૦૧૯	થી ચાલુ
૧૪.	શ્રી આર. ડી. સોની	૦૦૫૫૯૯૭૩	સ્વતંત્ર નિયામક	૧૪.૧૦.૨૦૧૪	થી ચાલુ
૧૫.	ડૉ. ગાર્ગી રાજપરા	૦૭૦૧૧૦૭૬	મહિલા અને સ્વતંત્ર નિયામક	૧૪.૧૦.૨૦૧૪	૨૮.૦૯.૨૦૨૦
૧૬.	શ્રી એસ. જી. પટેલ	એએએડપીપી ૪૬૯૩ એફ	સી.એફ.ઓ.	૨૮.૦૩.૨૦૧૯	૦૩.૦૯.૨૦૧૯
૧૭.	શ્રી બી. જે. દવે	એએએડપીડી ૫૬૫૧ સી	સી.એફ.ઓ.	૨૫.૧૦.૨૦૧૯	૧૯.૦૫.૨૦૨૦
૧૮.	શ્રી જલદીપ દવે	એસીજીપીડી ૫૭૬૯ બી	સી.એફ.ઓ.	૧૯.૦૫.૨૦૨૦	થી ચાલુ

જોડાણ - બ

તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગરના હિસાબો પર કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩(દ) (બ) હેઠળ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણી

કંપની ધારા, ૨૦૧૩ હેઠળ નિર્દિષ્ટ કરેલ નાણાંકીય અહેવાલના માળખા અનુસાર તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનાં નાણાંકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી કંપનીના સંચાલકોની છે. કંપની ધારાની કલમ ૧૩૯ (પ) હેઠળ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલે નીમેલા વૈધાનિક ઓડિટરો, કલમ-૧૪૩ (૧૦) માં નિર્દેશ કરેલ ઓડિટના ધોરણોને અનુલક્ષીને હાથ ધરેલ સ્વતંત્ર ઓડિટના અધારે અધિનિયમની કલમ-૧૪૩ હેઠળ નાણાંકીય પત્રકો પર અભિપ્રાય આપવા જવાબદાર છે. એમના તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૦ ના ઓડિટ અહેવાલ અન્વયે એમણે આમ કર્યાનું જણાવ્યું છે.

મં. ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ વતી, કંપની ધારાની કલમ ૧૪૩ (દ) (ક) હેઠળ, તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનાં નાણાંકીય પત્રકોનું પૂરક ઓડિટ કર્યું છે. આ પૂરક ઓડિટ, વૈધાનિક ઓડિટરોનાં કામકાજના કાગળો જોયા તપાસ્યા વિના સ્વતંત્ર રીતે કર્યું છે અને તે વૈધાનિક ઓડિટરો અને કંપનીના કર્મચારીઓની પૂછપરછ તથા કેટલાક હિસાબી રેકર્ડની પસંદગીલક્ષી તપાસ પુરતું પ્રાથમિક રીતે મર્યાદિત છે. મારા પૂરક ઓડિટ ઉપર આધાર રાખી હું કાયદાની કલમ ૧૪૩ (દ)(બી) અંતર્ગત નીચેની મહત્વની બાબતો તરફ ધ્યાન દોરીશ જે મારી ધ્યાને આવી છે અને જે મારા મતે નાણાંકીય પત્રકો અને સંબંધિત ઓડિટ રીપોર્ટને વધુ સારી રીતે સમજવા માટે જરૂરી છે.

અ. નાણાકીય સ્થિતિ ઉપરની ટીપ્પણી - સરવૈયાના સંદર્ભમાં

૧. અન્ય ચાલુ જવાબદારીઓ (નોંધ ૮) રૂા. ૫૪.૬૩ કરોડ

ઉપર દર્શાવેલ (ચાલુ જવાબદારીઓની) સિલકમાં કંપનીના પાણી વિતરણની સામાન્ય કામગીરી માટે વપરાતાં લેવામાં આવેલ વિજળી બદલ વિજ કંપનીના ચુકવવા પાત્ર વિદ્યુત ચાર્જના રૂા. ૧૫.૧૪ કરોડનો સમાવેશ થાય છે. તેથી તે ચાલુ જવાબદારીઓમાં દર્શાવવાને બદલે વેપારને કારણે ચુકવવા પાત્ર રકમમાં દર્શાવવી જોઈએ (નોંધ-૭) આમ થવાને કારણે વેપારને કારણે ચુકવવા પાત્ર રકમ ઓછી દર્શાવાઈ છે. અન્ય ચાલુ જવાબદારીઓમાં રૂા. ૧૫.૧૪ કરોડની રકમ વધુ દર્શાવાઈ છે.

૨. બિન ચાલુ અસ્કયામતો-પ્રગતિ હેઠળના ચાલુ કામો રૂા. ૨૬૫.૫૨ કરોડ

જે કામોનું ચુકવણું વર્ષ ૨૦૨૦-૨૧માં કરવામાં આવશે તેવા વર્ષ ૨૦૧૯-૨૦માં પુરા કરેલા/ ૨૦૧૯-૨૦ને લગતા બે કામો જેની રકમ રૂા. ૮૫.૦૫ લાખ થાય છે. તેનો મૂડી ખર્ચમાં સમાવેશ થતો નથી. અને ૨૦૧૯-૨૦ના હિસાબોમાં તે બાબતે મૂડી ખર્ચ માટે જોવાોઈ ન કરવાને કારણે પ્રગતિ હેઠળના ચાલુ કામો/ મૂડી ખર્ચમાં ઓછી રકમ દર્શાવાઈ છે અને અન્ય ચાલુ જવાબદારીઓમાં (નોંધ-૮) રૂા. ૮૫.૦૫ લાખ ઓછી દર્શાવાઈ છે.

ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ માટે અને એમના વતી

સ્થળ : રાજકોટ
તારીખ : ૧૭/૦૨/૨૦૨૧

સહી/-
(યશવંત કુમાર)
પ્રિન્સીપાલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ -૧)
રાજકોટ, ગુજરાત.



જોડાણ -ક

ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલની ટીકા-ટિપ્પણનો જવાબ

તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થતા વર્ષ માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગરના હિસાબો પર કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩(દ)(બી) હેઠળ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણી

ક્રમ. નં.	નાણાંકીય સ્થિતિ ઉપર ટિપ્પણીઓ	સંચાલક મંડળનો જવાબ
અ. ૧.	<p>નાણાકીય સ્થિતિ ઉપરની ટિપ્પણી - સરવૈયાના સંદર્ભમાં</p> <p>૧. અન્ય ચાલુ જવાબદારીઓ (નોંધ ૮)</p> <p>રૂ. ૫૪.૬૩ કરોડ</p> <p>ઉપર દર્શાવેલ (ચાલુ જવાબદારીઓની) સિલકમાં કંપનીના પાણી વિતરણની સામાન્ય કામગીરી માટે વપરાતાં લેવામાં આવેલ વિજળી બદલ વિજ કંપનીના ચુકવવા પાત્ર વિદ્યુત ચાર્જના રૂ. ૧૫.૧૪ કરોડનો સમાવેશ થાય છે. તેથી તે ચાલુ જવાબદારીઓમાં દર્શાવવાને બદલે વેપારને કારણે ચુકવવા પાત્ર રકમમાં દર્શાવવી જોઈએ (નોંધ-૭) આમ થવાને કારણે વેપારને કારણે ચુકવવા પાત્ર રકમ ઓછી દર્શાવાઈ છે. અન્ય ચાલુ જવાબદારીઓમાં રૂ. ૧૫.૧૪ કરોડની રકમ વધુ દર્શાવાઈ છે.</p>	<p>ઓડિટના અવલોકનની નોંધ લેવામાં આવી છે. વર્ષ ૨૦૨૦-૨૧ તેમજ ત્યાર પછીના હિસાબોમાં જરૂરી સુધારા કરવામાં આવશે.</p>
બ ૨	<p>બિન ચાલુ અસ્કયામતો- પ્રગતિ હેઠળના ચાલુ કામો</p> <p>રૂ. ૨૬૫.૫૨ કરોડ</p> <p>જે કામોનું ચુકવણું વર્ષ ૨૦૨૦-૨૧માં કરવામાં આવશે તેવા વર્ષ ૨૦૧૯-૨૦માં પુરા કરેલા/ ૨૦૧૯-૨૦ને લગતા બે કામો જેની રકમ રૂ. ૮૫.૦૫ લાખ થાય છે. તેનો મૂડી ખર્ચમાં સમાવેશ થતો નથી. અને ૨૦૧૯-૨૦ના હિસાબોમાં તે બાબતે મૂડી ખર્ચ માટે જોવાઈ ન કરવાને કારણે પ્રગતિ હેઠળના ચાલુ કામો/ મૂડી ખર્ચમાં ઓછી રકમ દર્શાવાઈ છે અને અન્ય ચાલુ જવાબદારીઓમાં (નોંધ-૮) રૂ. ૮૫.૦૫ લાખ ઓછી દર્શાવાઈ છે.</p>	<p>ઓડિટ અવલોકનની નોંધ લેવામાં આવી છે. અને હવેથી આવા ખર્ચ માટેની જોગવાઈ કરવાની કાળજી લેવામાં આવશે.</p>

જોડાણ -5

ફોર્મ નં. એમજીટી-૯ વાર્ષિક વળતરની તારીખ

તા. ૩૧-૦૩-૨૦૨૦ના રોજ પૂરા થયેલા
નાણાંકીય વર્ષના રોજ મુજબ

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૯૨(૩) અને કંપની (વ્યવસ્થાપન અને વહીવટ)
નિયમો ૨૦૧૪ના નિયમ ૧૨-(૧) ને અનુલક્ષીને

૧. નોંધણી અને અન્ય વિગતો :

૧.	સીઆઈએન	યુ૪૧૦૦૦જી જે૧૯૯૯એસજીસી૦૩૬૭૭૭
૨.	નોંધણી તારીખ	૨૫/૧૦/૧૯૯૯
૩.	કંપનીનું નામ	ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ
૪.	કેટેગરી/ સબ કેટેગરી કંપની	શેર દ્વારા લીમીટેડ/ રાજ્ય સરકારની કંપની
૫.	કંપનીની નોંધાયેલ કચેરીનું સરનામું તથા સંપર્કની વિગતો.	બ્લોક નં. ૧, પ્રથમ માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૦૧૦
૬.	કંપની લીસ્ટેડ કરી હોય તો તેની વિગત	ના
૭.	રજીસ્ટાર અને ટ્રાન્સફર એજન્ટનું નામ સરનામું અને સંપર્કની વિગત જો હોય તો	લાગુ પડતું નથી.

૨. કંપનીની મુખ્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ: કંપનીના કુલ ટર્નઓવરમાં ૧૦ ટક અથવા વધુ ફાળો આપતી તમામ વ્યવસાય પ્રવૃત્તિઓ જણાવવી.

ક્રમ	મુખ્ય ઉત્પાદન/ સેવાઓના નામ અને વર્ણન	ઉત્પાદન/ સેવાઓ એન.આઈ.સી. કોડ	કંપનીના કુલ ટર્નઓવર સામે ટકાવારી
૧.	પાણીનું એકત્રીકરણ શુદ્ધિકરણ અને વિતરણ	૪૧	૧૦૦%

૩. હોલ્ડિંગ, પેટા કંપની અને સાથી કંપનીઓની વિગતો (જે કંપનીઓ માટે માહિતી ભરવામાં આવી રહી હોય તે કંપનીઓની સંખ્યા)

ક્રમ નં.	કંપનીનું નામ અને સરનામું.	સીઆઈએન/ જીએલએન	હોલ્ડિંગ/ નિયંત્રિત / સાથી
	શૂન્ય	શૂન્ય	શૂન્ય



૪. કંપનીની શેરમૂડી, ડિબેન્યર અને અન્ય જામીનગીરીઓ

- ૧) શેર મુડી
- ૨) અધિકૃત શેર મુડી

શેરનો વર્ગ	શેરોની સંખ્યા	શેરદીઠ અંકિત મૂલ્ય (રૂ.)	શેરનું કુલ અંકિત મૂલ્ય (રૂ.)
ઈક્વિટી શેર			
વર્ષની શરૂઆત માં	૧૫,૦૦,૦૦,૦૦૦	૧૦	૧૫૦,૦૦,૦૦,૦૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	૨,૫૦,૦૦,૦૦૦	૧૦	૨૫,૦૦,૦૦,૦૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	૧૭,૫૦,૦૦,૦૦૦	૧૦	૧૭૫,૦૦,૦૦,૦૦૦
પ્રેફરન્સ શેર			
વર્ષની શરૂઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
બિન-વર્ગીકૃત શેર			
વર્ષની શરૂઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરૂઆતમાં કુલ અધિકૃત મુડી	૧૫,૦૦,૦૦,૦૦૦	૧૦	૧૫૦,૦૦,૦૦,૦૦૦
વર્ષના અંતે કુલ અધિકૃત મુડી	૧૭,૫૦,૦૦,૦૦૦	૧૦	૧૭૫,૦૦,૦૦,૦૦૦

ખ) બહાર પાડેલી શેર મુડી

શેરના વર્ગ	શેરની સંખ્યા	શેરદીઠ અંકિત મૂલ્ય (રૂ.)	શેરનું કુલ અંકિત મૂલ્ય (રૂ. લાખમાં)
ઈક્વિટી શેર			
વર્ષની શરૂઆતમાં	૧૪,૮૬,૦૩,૩૭૦	૧૦	૧,૪૮,૬૦,૩૩,૭૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	૫૪,૧૬,૭૦૦	૧૦	૫,૪૧,૬૭,૦૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે કુલ બહાર પાડેલી શેર મુડી	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦	૧,૫૫,૦૨,૦૦,૭૦૦

પ્રેક્ટરન્સ શેર :			
વર્ષની શરુઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરુઆતમાં કુલ બહાર પાડેલી શેર મૂડી	૧૪,૮૬,૦૩,૩૭૦	૧૦	૧,૪૮,૬૦,૩૩,૭૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	૫૪,૧૬,૭૦૦	૧૦	૫,૪૧,૬૭,૦૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે કુલ બહાર પડેલી શેર મૂડી	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦	૧,૫૫,૦૨,૦૦,૭૦૦

ગ) નોંધાયેલી શેર મુડી

શેરોના વર્ગ	શેરની સંખ્યા	શેર દીઠ અંકિત મૂલ્ય	શેરનું કુલ અંકિત મૂલ્ય (રૂ.)
શેરનો વર્ગ			
વર્ષની શરુઆતમાં	૧૪,૮૬,૦૩,૩૭૦	૧૦	૧,૪૮,૬૦,૩૩,૭૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	૫૪,૧૬,૭૦૦	૧૦	૫,૪૧,૬૭,૦૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦	૧,૫૫,૦૨,૦૦,૭૦૦
પ્રેક્ટરન્સ શેર			
વર્ષની શરુઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષદરમિયાન ફેરફાર (વધારો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરુઆતમાં કુલ નોંધાયેલ શેર મુડી	૧૪,૮૬,૦૩,૩૭૦	૧૦	૧,૪૮,૬૦,૩૩,૭૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	૫૪,૧૬,૭૦૦	૧૦	૫,૪૧,૬૭,૦૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે કુલ નોંધાયેલી શેર મુડી	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦	૧,૫૫,૦૨,૦૦,૭૦૦



ગ) ભરાયેલી શેર મુડી

શેરોના વર્ગ	શેરની સંખ્યા	શેર દીઠ અંકિત મૂલ્ય	શેરનું કુલ અંકિત મૂલ્ય (રૂ.)
શેરનો વર્ગ			
વર્ષની શરૂઆતમાં	૧૪,૮૬,૦૩,૩૭૦	૧૦	૧,૪૮,૬૦,૩૩,૭૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	૫૪,૧૬,૭૦૦	૧૦	૫,૪૧,૬૭,૦૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦	૧,૫૫,૦૨,૦૦,૭૦૦
પ્રેફરન્સ શેર			
વર્ષની શરૂઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષદરમિયાન ફેરફાર (વધારો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરૂઆતમાં કુલ નોંધાયેલ શેર મુડી	૧૪,૮૬,૦૩,૩૭૦	૧૦	૧,૪૮,૬૦,૩૩,૭૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો)	૫૪,૧૬,૭૦૦	૧૦	૫,૪૧,૬૭,૦૦૦
વર્ષ દરમિયાન ફેરફાર (ઘટાડો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે કુલ ભરાયેલી શેર મુડી	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦	૧,૫૫,૦૨,૦૦,૭૦૦

ઘ (૧) વર્ષ દરમિયાન સ્ટોક વિભાજન / એકત્રીકરણ (શેરના દરેક પ્રકારના શેર માટે)

શેરનો વર્ગ	વિભાજન / એકત્રીકરણ પહેલા	વિભાજન / એકત્રીકરણ પછી
શેરની સંખ્યા	શૂન્ય	શૂન્ય
શેરદીઠ અંકિત મૂલ્ય	શૂન્ય	શૂન્ય

૨) ડિબેન્ચર

ડિબેન્ચરના પ્રકાર	ડિબેન્ચરની સંખ્યા	ડિબેન્ચર દીઠ અંકિત મુલ્ય	ડિબેન્ચર કુલ અંકિત મુલ્ય (રૂ.)
બિન- રૂપાંતરશ્રમ (દરેક પ્રકાર માટે)			
વર્ષની શરુઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો/ પરત ચૂકવણી)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
અંશત: રૂપાંતરક્ષમ (દરેક પ્રકાર માટે)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરુઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો/ પરત ચૂકવણી)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
સંપૂર્ણ રૂપાંતર પાત્ર (દરેક પ્રકાર માટે)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરુઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો/ રૂપાંતરીત)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ડિબેન્ચરોની કુલ રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરુઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર (વધારો/ પરત ચૂકવણી/ રૂપાંતરિત)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય

(૩) અન્ય જામીનગીરીઓ

જામીનગીરીનો પ્રકાર	જામીનગીરીની સંખ્યા	દરેક યુનિટનું અંકિત મુલ્ય (રૂ.)	કુલ અંકિત મુલ્ય (રૂ.)	દરેક યુનિટનું ભરાયેલું મુલ્ય (રૂ.)	કુલ ભરાયેલ મુલ્ય (રૂ.)
શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

૪. સિક્યોરિટી પ્રીમિયમ હિસાબ

જેના પર પ્રીમિયમ મળેલ હોય તે જામીનગીરીઓનો વર્ગ	જામીનગીરીઓની સંખ્યા (રૂ.)	યુનિટ દીઠ પ્રીમિયમ (રૂ.)	કુલ પ્રીમિયમ (રૂ.)
ઈક્વિટી પર પ્રીમિયમ (દરેક પ્રકાર માટે નિર્દાષ્ટ કરો)			
વર્ષની શરુઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર			
૧ વધારો	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩ જાહેર ભરણું	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨. ખાનગી પ્લેસમેન્ટ/ પસંદગીલક્ષી ફાળવણી	શૂન્ય	શૂન્ય	શૂન્ય



૩. ઈએસઓએસ	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૪. રૂપાંતર પ્રેક્ટરન્સ શેર/ડિબેન્ચરનું રૂપાંતર	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૫. ઈકિવટી માં રૂપાંતર	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૬. જીડીઆર/ એડીઆર	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૭. અન્ય રીતે કરેલ ઉપયોગ (સ્પષ્ટ વિગતો દર્શાવવી)	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨. ઘટાડો	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૧. બોનસ શેર બહાર પાડવા માટે ઉપયોગ	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨.	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩.	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
અન્ય જામીનગીરી પર મળેલ પ્રિમિયમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરૂઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૧) વધારો -ફેશ ઈશ્યુ	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨) ઘટાડો- પરત ચુકવણી પ્રીમિયમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષની શરૂઆતમાં કુલ જામીનગીરી પર મળેલ પ્રિમિયમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષ દરમિયાન ફેરફાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વધારો	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ઘટાડો	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે કુલ જામીનગીરી પર મળેલ પ્રિમિયમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય

૫. કંપનીનું ટર્નઓવર અને ચોખ્ખું મૂલ્ય (અધિનિયમમાં નિર્ધારિત કર્યા પ્રમાણે)

(૧) ટર્નઓવર

- નાણાંકીય વર્ષના અંતે ટર્નઓવર : રૂ. ૪૫૭.૧૧ કરોડ

(૨) કંપનીનું ચોખ્ખું મૂલ્ય :

- નાણાંકીય વર્ષના અંતે ચોખ્ખું મૂલ્ય : રૂ. ૪૭૬૧.૬૫ કરોડ

પ) શેર હોલ્ડિંગ પેટર્ન કુલ ઈક્વિટીની ટકાવારી તરીકે ઈક્વિટી શેર મૂડી વિભાજન :

૧) કેટેગરી પ્રમાણે શેર હોલ્ડિંગ

શેર હોલ્ડરનો પ્રકાર	વર્ષની શરુઆતમાં ધારણ કરેલા શેરની સંખ્યા (૩૧મી માર્ચ ૨૦૧૯ના રોજ મુજબ)				બોર્ડના અંતે ધારણ કરેલા શેરની સંખ્યા (૩૧ મી માર્ચ ૨૦૨૦ના રોજ મુજબ)				વર્ષ દરમિયાન ટકાવારી ફેરફાર
	ડી મેટ	ભૌતિક	કુલ	કુલ શેરની ટકાવારી	ડી મેટ	ભૌતિક	કુલ	કુલ શેરની ટકાવારી	
ક. સ્થાપકો									
(૧) ભારતીય									
(ક) વ્યક્તિગત / હિં.અ.કુ.	શૂન્ય	૭૦	૭૦	શૂન્ય	શૂન્ય	૭૦	૭૦	શૂન્ય	શૂન્ય
(ખ) કેન્દ્ર સરકાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ગ) રાજ્ય સરકાર	શૂન્ય	૧૪,૯૬,૦૩,૩૦૦	૧૪,૯૬,૦૩,૩૦૦	૧૦૦	શૂન્ય	૧૫,૫૦,૨૦,૦૦૦	૧૫,૫૦,૨૦,૦૦૦	૧૦૦	શૂન્ય
(ઘ) નિગમિત સંસ્થા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ચ) બેંક/ ના.સં.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(છ) અન્ય કોઈ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
સ્થાપકોનું કુલ શેરહોલ્ડિંગ (ક)	શૂન્ય	૧૪,૯૬,૦૩,૩૭૦	૧૪,૯૬,૦૩,૩૭૦	૧૦૦	શૂન્ય	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦૦	શૂન્ય
ખ જાહેર શેરહોલ્ડિંગ									
૧. સંસ્થાઓ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ક) મ્યુચ્યુલ ફંડ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ખ) બેંક/ના. સં.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ગ) કેન્દ્ર સરકાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ઘ) રાજ્ય સરકાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ચ) સાહસ મૂડી ભંડોળ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
છ) વિમા કંપનીઓ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
જ) ફિલસ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ઝ) વિદેશી સાહસનું મૂડી ભંડોળ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય



(૧) અન્ય (નિર્દિષ્ટ કરો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
પેટા સરવાળો- કુલ ખ (૧)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨. બિન- સંસ્થાકીય									
ક) નિગમિત સંસ્થા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ખ) ભારતીય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨) દરિયાપાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ખ) વ્યક્તિઓ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૧) રૂ. ૧ લાખસુધીની અંકિત શેરમૂડી ધારણ કરનાર વ્યક્તિગત શેર હોલ્ડરો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨) રૂ. ૧ લાખથી વધુ અંકિત શેર મૂડી ધારણ કરનાર વ્યક્તિગત શેર હોલ્ડરો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ખ) અન્ય (નિર્દિષ્ટ કરો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
બિન- નિવાસી ભારતીય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
દરિયાપારની કોર્પોરેટ સંસ્થા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વિદેશી નાગરિક	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
કલીયરિંગ સભ્યો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ટ્રસ્ટો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વિદેશી સંસ્થાઓ -ડીઆર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
પેટા સરવાળો કુલ ખ (૨)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
કુલ જાહેર શેર હોલ્ડિંગ (ખ)=(ખ)(૧)+ (ખ)(૨)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ગ. જીડીઆરએસ અને એડીઆરએસ કસ્ટોડિયને ધારણ કરેલા શેર એકંદર કુલ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
એકંદર કુલ (ક + ખ + ગ)	શૂન્ય	૧૪,૮૬,૦૩,૩૭૦	૧૪,૮૬,૦૩,૩૭૦	૧૦૦	શૂન્ય	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦૦	શૂન્ય

ખ) સ્થાપકોનું શેર હોલ્ડિંગ

ક્રમ નં.	શેર હોલ્ડરનું નામ	વર્ષની શરુઆતમાં શેર હોલ્ડિંગ (તા. ૦૧-૦૪-૨૦૧૯ના રોજ મુજબ)			વર્ષની અંતે શેર હોલ્ડિંગ (તા. ૩૧-૦૩-૨૦૨૦ના રોજ મુજબ)			વર્ષ દરમિયાન હોલ્ડિંગ માં ટકાવારી ફેરફાર
		શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	કુલ શેર સામે ગીરો મુકેલા / બોજો કરેલા શેરની ટકાવારી	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	કુલ શેર સામે ગીરો મુકેલા / બોજો કરેલા શેરની ટકાવારી	
૧.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી ધનંજય દિવેદી આઈએએસ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી કે.કે. નિરાલા આઈએએસ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી નિરવ સોલંકી આઈએએસ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૪.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી જે.પી. ગુપ્તા આઈએએસ	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૫.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી એચ.જી. રાજ	૧૦	શૂન્ય	શૂન્ય	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૬.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી તુષાર ધોળકીયા આઈએએસ	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૭.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી રવિ સોલંકી	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૮.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી ડી.બી. વ્યાસ	૧૦	શૂન્ય	શૂન્ય	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૯.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી એસ.જે. મહેતા	૧૦	શૂન્ય	શૂન્ય	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૧૦.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી જે.એલ. ગોહીલ	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૧૧.	નામદાર ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે શ્રી જી.બી. ત્રિવેદી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	૧૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૧૨.	નામદાર ગુજરાતનાં રાજ્યપાલશ્રી	૧૪,૯૬,૦૩,૩૦૦	૯૯.૯૯	શૂન્ય	૧૫,૫૦,૨૦,૦૦૦	૯૯.૯૯	શૂન્ય	શૂન્ય
	કુલ	૧૪,૯૬,૦૩,૩૭૦	૧૦૦	શૂન્ય	૧૫,૫૦,૨૦,૦૭૦	૧૦૦	શૂન્ય	શૂન્ય

નોંધ : દરેક વ્યક્તિ સરકારના અધિકારીઓ છે અને સરકારના નિમેલા વ્યક્તિ તરીકે શેર ધરાવે છે.



ગ) પ્રોમોટરના શેર હોલ્ડિંગમાં ફેરફાર (ફેરફાર ન હોય તો તે દર્શાવવા વિનંતી છે.)

વિગત	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડિંગ		વર્ષ દરમિયાન સંચિત શેર હોલ્ડર	
	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી
વર્ષની શરૂઆતમાં				
સ્થાપકોમાં તારીખવાર વધારા/ ઘટાડા (દા.ત. ફાળવણી/ તબદીલી/ બોનસ/ સ્વેટ ઈક્વિટી વગેરે માટેનાં કારણો.	વરસ દરમિયાન સ્થાપકોના શેરધારણમાં કોઈ ફેરફાર થયો નથી.			
વર્ષના અંતે				

ઘ) ટોચના દસ શેર હોલ્ડરોની શેર હોલ્ડિંગ પેટર્ન નિયામકો, સ્થાપકો અને જી.ડી.આર.એસ. અને એ.ડી.આ.ર.એસ.ના હોલ્ડરો સિવાય

દરેક ડાયરેક્ટર અને દરેક મુખ્ય વહીવટી કર્મચારીનું શેરધારણ	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડિંગ		વર્ષ દરમિયાન સંચિત શેર હોલ્ડિંગ	
	શેરોની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	શેરોની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી
વર્ષની શરૂઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
સ્થાપકોમાં તારીખવારવધારા/ ઘટાડા માટેનાં કારણો નિર્દિષ્ટ કરી (દા.ત. ફાળવણી/ તબદીલી/ બોનસ/ સ્વેટ ઈક્વિટી વગેરે માટેનાં કારણો.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

ચ) નિયામકો અને મહત્વના વ્યવસ્થાકીય કર્મચારીઓનું શેર હોલ્ડિંગ

ક્રમ	દરેક ડાયરેક્ટર અને દરેક મુખ્ય વહીવટી કર્મચારીનું શેરધારણ	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડિંગ		વર્ષ દરમિયાન સંચિત શેર હોલ્ડિંગ	
		શેરોની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	શેરોની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી
૧	શ્રી જી.પી. ગુપ્તા, આઈએએસ વર્ષની શરૂઆતમાં	૧૦	-	-	-
	ઘટાડો / વધારો	૧૦	-	-	-
	વર્ષના અંતે	-	-	-	-
૨	શ્રી ધનંજય દિવેદી, આઈએએસ વર્ષની શરૂઆતમાં	-	-	-	-
	ઘટાડો / વધારો	૧૦	-	-	-
	વર્ષના અંતે	૧૦	-	-	-

૩	શ્રી તુષાર ધોળકીયા, આઈએએસ વર્ષની શરુઆતમાં	૧૦	-	-	-
	ઘટાડો / વધારો	૧૦	-	-	-
	વર્ષના અંતે	-	-	-	-
૪	શ્રી નિરવ સોલંકી વર્ષની શરુઆતમાં	-	-	-	-
	ઘટાડો / વધારો	૧૦	-	-	-
	વર્ષના અંતે	૧૦	-	-	-
૫	શ્રી રવી સોલંકી વર્ષની શરુઆતમાં	૧૦	-	-	-
	ઘટાડો / વધારો	૧૦	-	-	-
	વર્ષના અંતે	-	-	-	-

છ) દેવાની સ્થિતિ : વ્યાજ બાકી / ઉપાર્જિત થયું પરંતુ ચૂકવણી માટે પાત્ર ન થયું

નાણાકીય વર્ષની શરુઆતમાં દેવાની સ્થિતિ	થાપણો સિવાય તારણવાળી લોનો	તારણ વિનાની લોનો	થાપણો	કુલ દેવાદારી
૧) મુદ્દલ રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨) વ્યાજ લેણું થયું પરંતુ ચૂકવ્યું નહીં.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩) દેવાની સ્થિતિ વ્યાજ બાકી/ ઉપાર્જિત થયું પરંતુ ચૂકવણી માટે પાત્ર થયું નથી તેવા વ્યાજનું દેવું.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
કુલ (૧ + ૨+૩)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
નાણાકીય વર્ષ દરમિયાન દેવાની સ્થિતિમાં ફેરફાર				
* ઉમેરો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
* ઘટાડો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ચોખ્ખો ફેરફાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
નાણાકીય વર્ષના અંતે દેવાની સ્થિતિ				
૧) મુદ્દલ રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨) વ્યાજ લેણું થયું પરંતુ ચૂકવ્યું નહીં.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩) દેવાની સ્થિતિ વ્યાજ બાકી/ ઉપાર્જિત થયું પરંતુ ચૂકવણી માટે પાત્ર થયું નથી તેવા વ્યાજનું દેવું.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
કુલ (૧ + ૨ + ૩)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય



૧૧. નિયામકો અને મહત્વના વ્યવસ્થાપકીય કર્મચારીઓનું મહેનતાણું :

ક્રમ	મહેનતાણાની વિગતો	વ.નિ/ડબલ્યુટીડી/મેનેજરનું નામ			કુલ રકમ
		એમ. ડી	શ્રી નિરવ સોલંકી સીજીએમ(પી) અને નિયામક તા.૩૦/૦૮/૨૦૧૯	શ્રી રવી સોલંકી સીજીએમ(પી) અને નિયામક તા.૩૦/૦૬/૨૦૧૯	
	એકંદર પગાર	શૂન્ય	૮,૫૫,૮૨૮	૫,૮૮,૦૫૭	૧૪,૪૩,૮૮૬
૧	(ક) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ, ૧૭(૧) માંની જોગવાઈઓ પ્રમાણે પગાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	(ખ) આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ, ૧૭(૨) હેઠળ અનુલાભનુ મૂલ્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	(ગ) આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ, ૧૭(૩) હેઠળ પગારને બદલે નફો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨	સ્ટોક વિકલ્પ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩	સ્વીટ ઈક્વિટી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૪	કમીશન - નફાની ટકાવારી તરીકે - અન્ય, નિર્દિષ્ટ કરો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૫	અન્ય નિર્દિષ્ટ કરો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કુલ (ક)	શૂન્ય	૮,૫૫,૮૨૮	૫,૮૮,૦૫૭	૧૪,૪૩,૮૮૬
	અધિનિયમ પ્રમાણે ટોચ-મર્યાદા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

ખ. અન્ય નિયામકોને મહેનતાણું

ક્રમ નં.	મહેનતાણાની વિગતો	નિયામકોનાં નામ				કુલ રકમ
૧	સ્વતંત્ર નિયામકો	--	--	--	--	
	બોર્ડ, સમિતિની બેઠકોમાં હાજરી આપવા માટેની ફી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કમીશન	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	અન્ય, નિર્દિષ્ટ કરવા વિ. છે.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કુલ (૧)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨	અન્ય, બિન-કારોબારી નિયામકો/ અધ્યક્ષ, ચેરમેન, અને વાઈસ ચેરમેન	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	બોર્ડ સમિતિની બેઠકોમાં હાજરી આપવા માટેની ફી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કમીશન	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	અન્ય, નિર્દિષ્ટ કરવા વિનંતી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કુલ (૨)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કુલ (ખ) = (૧ + ૨)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કુલ વ્યવસ્થાકીય મહેનતાણું	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	અધિનિયમ મુજબ એકંદર ટોચ-મર્યાદા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

ગ. મહત્વના વ્યવસ્થાપકીય કર્મચારીઓને મહેનતાણું
વ.નિ/ મેનેજર/ ડબલ્યુટીડી સિવાયના

ક્રમ	વિગત	મહત્વના વ્યવસ્થાપકીય કર્મચારીઓ			
		સી.ઈ.ઓ.	સી.એસ.	સી.એફ.ઓ	કુલ
૧	કુલ પગાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	(ક) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૧) માંની જોગવાઈ પ્રમાણે પગાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	(ખ) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૨) હેઠળ અનુલાભનું મૂલ્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	(ગ) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭ (૩) હેઠળ પગારને બદલે નફો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨	સ્ટોક વિકલ્પ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩	સ્વીટ ઈક્વિટી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૪	કમિશન	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	-નફાની ટકાવારી તરીકે	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	અન્ય નિર્દિષ્ટ કરો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૫	અન્ય નિર્દિષ્ટ કરવા વિ.છે.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કુલ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

૧૨. દંડ/ શિક્ષા/ ગુનાની માંડવાળ : શૂન્ય

પ્રકાર	કંપની અધિનિયમની કલમ	ટુંકું વર્ણન	દંડ / શિક્ષા / માંડવાળ કરેલ ફીની વિગતો	સત્તાધિકારી (આરડી/ એનસીએલટી કોર્ટ	અપીલ કોઈ કરી હોય તો (વિગતો આપો)
ક. કંપની					
દંડ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
શિક્ષા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
માંડવાળ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ખ. નિયામકો					
દંડ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
શિક્ષા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
માંડવાળ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ગ. કસૂરવાર અન્ય અધિકારીઓ					
દંડ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
શિક્ષા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
માંડવાળ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

નિયામક મંડળ માટે અને એમના વતી
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

તારીખ : ૦૬/૦૩/૨૦૨૧
સ્થળ : ગાંધીનગર

મયુર મહેતા, આઈ.એ.એસ.
વહિવટી નિયામક
ડિન : ૦૮૮૪૨૧૫૫

નિરવ સોલંકી
નિયામક
ડિન : ૦૮૭૫૦૪૯૪



અનુસૂચિ-ઈ

ફોર્મ નં. એઓસી-૨

(કંપની ધારાની કલમ ૧૩૪ નીકલમ ના પેટા વિભાગ (ક)ના કલોઝ (એચ) અને કંપની (હિસાબો) નિયમો-૨૦૧૪ ના નિયમ ૮(૨) ના અનુસંધાનમાં)

કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૮૮ ની પેટા કલમ (૧) હેઠળ દર્શાવેલા પક્ષકારોસાથે કંપનીએ કરેલા કરાર ગોઠવણી જેમાં ત્રીજા ક્રમાંકની જોગવાઈ મુજબના, આર્મ્સ લેન્થ ભાવપરની લેવડ દેવનો સમાવેશ થાય છે તે સહિતની વિગતો/સ્પષ્ટતાઓનું ફોર્મ

૧. આર્મ્સ લેન્થ ભાવની ન હોય તેવી લેવડ-દેવડ કે ગોઠવણો કે કરારોની વિગતો :

- (ક) સંબંધિત પક્ષકારોના નામો અને સંબંધનો પ્રકાર
- (ખ) કરારો/ગોઠવણો/લેવડ-દેવડનો પ્રકાર
- (ગ) કરારો/ ગોઠવણો/ લેવડ-દેવડનો સમયગાળો
- (ઘ) કરારો /ગોઠવણો/ લેવડ-દેવડની મહત્વની શરતો તેની કિંમત/મૂલ્ય હોય તે સહિત
- (ચ) આવા કરારો/ ગોઠવણો કરવા માટેની યથાર્થના યોગ્ય કારણો
- (છ) બોર્ડની મંજૂરીની તારીખ
- (જ) જો કોઈ રોકડ પેશગી ચૂકવ્યા હોય તો તેની વિગત
- (ઝ) કલમ ૧૮૮ ની પ્રથમ શરત અન્વયે સામાન્ય સભામાં વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય તો તેની તારીખ.

૨ આર્મ્સ લેન્થના ધોરણે કરેલા કરારો અથવા ગોઠવણ અથવા લેવડ-દેવડની વિગતો :

- (ક) સંબંધિત પક્ષકારનું નામ અને સંબંધનો પ્રકાર : મુખ્ય વ્યવસ્થાપન કર્મચારીઓનો પગાર.
- (ખ) કરારો/ગોઠવણો/લેવડ-દેવડના પ્રકાર
- (ગ) કરારો/ ગોઠવણો/ લેવડ-દેવડનો સમયગાળો
- (ઘ) કરારો/ગોઠવણો/ લેવડ-દેવડની મહત્વની શરતો તેની કિંમત/મૂલ્ય હોય તે સહિત

ક્રમાંક	વ્યવહારોની વિગતો	રકમ રૂ.
૧	મહત્વના સંચાલકીય કર્મચારી શ્રી રવિ સોલંકી, સીજીએમ (પ્રો.) એન્ડ ડાયરેક્ટરને તા.૩૦/૦૬/૨૦૧૯ સુધી ચુકવાયેલ પગાર	૫,૮૮,૦૫૭
૨	મહત્વના સંચાલકીય કર્મચારી શ્રી રવિ સોલંકી, સીજીએમ (પ્રો.) એન્ડ ડાયરેક્ટરને તા.૩૦/૦૮/૨૦૧૯ થી ચુકવાયેલ પગાર	૮,૫૫,૮૨૯
	કુલ	૧૪,૪૩,૮૮૬

બોર્ડના અહેવાલમાં જેમણે સહીઓ કરી છે તેવા લોકોઆ ફોર્મમાં સહીઓ કરવાની રહેશે.

નિયામક મંડળ માટે અને એમના વતી
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

તારીખ : ૦૬/૦૩/૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

મયુર મહેતા, આઈ.એ.એસ.

વહિવટી નિયામક

ડિન : ૦૮૮૪૨૧૫૫

નિરવ સોલંકી

નિયામક

ડિન : ૦૮૭૫૦૪૯૪



અનુસૂચિ-ફ

ગૌદાણા એન્ડ ગૌદાણા

(કંપની સેક્રેટરી) (અગાઉ અરવિંદ ગોદાણા એન્ડ કંપની તરીકે)
૩૦૭, આશિર્વાદ પારસ, પ્રહલાદનગર ગાર્ડન પાસે, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન : +૯૧ ૭૯ - ૪૦૩૨૪૫૬૭/ ૪૦૩૨૪૫૬૮ E-mail : arvindg_cs@yahoo.com

ફોર્મ નં. એમ.આર. ૩
સચિવશ્રીનો ઓડીટ અહેવાલ
તા. ૩૧/૦૩/૨૦૨૦ નાણાંકીય વર્ષ માટે
(કંપની કાયદાની કલમ ૨૦૪(૧) અને કંપની (કર્મચારીગણની નિમણૂક અને મહેનતાણું)
નિયમો, ૨૦૧૪ અન્વયે)

સચિવશ્રીનો ઓડીટ અહેવાલ

તા. ૩૧/૦૩/૨૦૨૦ અંતિત નાણાંકીય વર્ષ માટે

પ્રતિ,
સભ્યશ્રીઓ,
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
(સી.આઈ.એન : યુ ૪૧૦૦૦ જીજે ૧૯૯૯એસજીસી૦૩૬૭૭૭)
ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૧, પહેલો માળ,
સેક્ટર-૧૦, ગાંધીનગર,
ગુજરાત-૩૮૨૦૧૦. ભારત

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (હવેથી જેને કંપની તરીકે ઉલ્લેખવામાં આવશે.) તેના દ્વારા ગુડ કોર્પોરેટ પ્રેક્ટીસનું અમલ અને લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓના અમલનું સેક્રેટરીઅલ ઓડિટ અમે કર્યું છે. સેક્રેટરીઅલ ઓડિટ એવી રીતે કરવામાં આવ્યું હતું કે, જેના ઉપરથી અમને કોર્પોરેટ કન્ડક્ટ/કાયદાકીય જોગવાઈઓનું પાલનનું મૂલ્યાંકન કરવા માટે વ્યાજબી આધાર પુરો પાડે અને અમે તેની ઉપર અમારો અભિપ્રાય આપી શકીએ.

અમારી ચકાસણી કંપનીના ચોપડા, કાગળો, કાર્યવાહી નોંધ, બુકો, પત્રકો રજૂ થયેલા અહેવાલો અને કંપની દ્વારા નિભાવવામાં આવતા અન્ય રેકર્ડ તેમજ કંપની દ્વારા, તેના અધિકારીઓ દ્વારા, એજન્ટો દ્વારા અને અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા સેક્રેટરીઅલ ઓડિટ કરતી વખતે આપવામાં આવેલી માહિતી ઉપર આધારીત છે.

અમે જણાવીએ છીએ કે, અમારા અભિપ્રાય મુજબ, કંપનીએ ૩૧મી માર્ચ, ૨૦૨૦ (ઓડિટ સમયગાળો) અંતિત નાણાંકીય વર્ષને આવરી લેતાં સમયગાળા દરમ્યાન નીચે દર્શાવેલી જોગવાઈઓનું પાલન કર્યું છે અને કંપની, બોર્ડ પ્રક્રિયાઓ અને અમલી કરણ પદ્ધતિઓ યોગ્ય રીતે ધરાવે છે અને તેને આધિન અહેવાલ આપવામાં આવે છે.

કંપની દ્વારા ૩૧મી માર્ચ, ૨૦૨૦ અંતિત નાણાંકીય વર્ષ માટેના ચોપડા કાગળીયા, કાર્યવાહી નોંધ, પત્રકો, અને તૈયાર કરેલા અહેવાલો અને અન્ય રેકર્ડ જે કંપની દ્વારા નિભાવવામાં આવે છે. તેમની ચકાસણી નીચેની કાયદાકીય જોગવાઈઓ અનુસાર કરી છે.



- (૧) કંપની કાયદો ૨૦૧૩ (કાયદો) અને તેની નીચે બનાવવામાં આવેલા નિયમો.
- (૨) ધ સિક્યોરિટીઝ કોન્ટ્રેક્સ (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૬ (એસસીઆરએ) અને તેની અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો (ઓડિટ ગાળા દરમ્યાન કંપનીને લાગુ પડતા નથી)
- (૩) ધ ડિપોઝીટરીઝ એક્ટ, ૧૯૯૬ અને તેની નીચે બનાવેલા રેગ્યુલેશન્સ અને બાયલોઝ (ઓડિટ ગાળા દરમ્યાન કંપનીને લાગુ પડતા નથી.)
- (૪) ફોરેન એક્ષચેન્જ મેનેજમેન્ટ એક્ટ ૧૯૯૯ અને તેની નીચે ઘડવામાં આવેલા નિયમો અને વિનિયમો હેઠળ વિદેશનું સીધું રોકાણ અને દરિયા પારના સીધા રોકાણ તથા બહારથી વ્યાપારી લોન લેવા બાબત (ઓડિટ ગાળા દરમ્યાન કંપનીને લાગુ પડતા નથી.)
- (૫) ધ સિક્યોરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ૧૯૯૨ (સેબી એક્ટ) હેઠળ નિયેના વિનિયમો અને ગાઈડલાઈન (ઓડિટ ગાળા દરમ્યાન કંપનીને લાગુ પડતા નથી.)
 - (૧) ધ સિક્યોરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (પૂરતા પ્રમાણમાં શેર સંપાદન અને હસ્તગત કરવા) રેગ્યુલેશન્સ, ૨૦૧૧.
 - (૨) ધ સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (પ્રોહિબિશન ઓફ ઈન્સાઈડર ટ્રેડિંગ) રેગ્યુલેશન એક્ટ ૨૦૧૫.
 - (૩) ધ સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (મૂડી બહાર પાડવી અને તેને લગતી વિગતો જાહેર કરવાની જરૂરીયાત) વિનિયમો-૨૦૧૮
 - (૪) ધ સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (એમ્પ્લોઈઝ સ્ટોક ઓપશન્સ સ્કીમ એન્ડ એમ્પ્લોઈઝ સ્ટોક પરચેઝ સ્કીમ) ગાઈડ લાઈન ૧૯૯૯ એન્ડ ધ સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (શેર બેઝડ એમ્પ્લોઈઝ બેનીફીટ્સ) રેગ્યુલેશન-૨૦૧૪
 - (૫) ધ સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈસ્યુ એન્ડ લીસ્ટીંગ ઓફ ડેટ સિક્યોરિટીઝ) રેગ્યુલેશન ૨૦૦૮.
 - (૬) ધ સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (રજિસ્ટ્રાર ટુ એન ઈસ્યુ એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ્સ) રેગ્યુલેશન ૧૯૯૩ કંપની કાયદો અને કલાયન્ટ ને લગતી બાબતો.
 - (૭) ધ સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (શેરના ડિલીસ્ટીંગ) રેગ્યુલેશન ૨૦૦૯.
 - (૮) ધ સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (શેરના પરત ખરીદી) રેગ્યુલેશન ૨૦૧૮.
 - (૯) ધ સિક્યોરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લીસ્ટીંગ ઓબ્લીગેશન અને ડિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ) રેગ્યુલેશન ૨૦૧૫.
- (૬) કંપની માટેના કેટલાક નીચે મુજબના કાયદાઓ
 - (એ) ધ ઈન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ૧૮૭૨
 - (બી) ધ વર્કસ કોન્ટ્રાક્ટ એક્ટ, ૧૯૮૯
 - (સી) ધ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ એન્ડ મિસેલેનીયસ પ્રોવિઝન એક્ટ, ૧૯૫૨

- (ડી) ધ મીનીમમ વેજીસ એક્ટ, ૧૯૪૮
- (ઈ) ધ કોન્ટ્રાક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલીશન) એક્ટ ૧૯૭૦
- (એફ) ધ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ સ્કીમ, ૧૯૫૨
- (જી) ધ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ એક્ટ ૧૯૪૮

અમે નીચેની લાગુ પડતી જોવાઈઓના અમલીકરણની પણ ચકાસણી કરી છે.

- (૧) ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા સેક્ટરીયલ સ્ટાન્ડર્ડ
- (૨) કંપની દ્વારા સ્ટોક એક્ષચેન્જ સાથે નોંધણી કરાર કરેલ છે. (આ જોગવાઈ ઓડિટ સમય દરમ્યાન કંપનીને લાગુ પડતી નથી.)

સામાન્ય રીતે અવલોકનના સમયગાળા દરમ્યાન કંપનીએ ઉપર દર્શાવેલા કાયદા, નિયમો, વિનિયમો, માર્ગદર્શિકા, ધોરણો વગેરેની જોગવાઈઓનું પાલન કર્યું છે.

વધુમાં અમે નોંધીએ છીએ કે

કંપનીમાં પ્રચલિત અમલીકરણની પદ્ધતિને જોતાં અને તે અન્વયે ચકાસણીના ધોરણે પરિક્ષણ કરતી વખતે અમને પુરા પાડવામાં આવેલ અથવા બતાવવામાં આવેલા સંબંધિત દસ્તાવેજો અને જાળવણી કંપનીએ સામાન્ય રીતે લાગુ પડતી નીચે જણાવેલી કાયદાઓની જોગવાઈઓ મુજબ તેનું પાલન કરેલ છે.

- ૧. શ્રમ કલ્યાણ નીધિ ધારો, ૧૯૫૩.
- ૨. જમીન સંપાદન ધારો, ૧૯૮૪ જમીન સંપાદન ધારા ૨૦૧૩માં વ્યાજબી વળતરના હકક તથા પારદર્શિતા બાબત.
- ૩. ધ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (રેગ્યુલેશન ઓફ એપ્લોયમેન્ટ ઓફ સર્વિસીઝ) એક્ટ, ૧૯૮૬
- ૪. રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ૨૦૦૬.
- ૫. પર્યાવરણ (પ્રદુષણ નિવારણ તથા નિયંત્રણ) ધારો ૧૯૮૬, વિસ્ફોટક પદાર્થધારો ૧૯૦૮
- ૬. પર્યાવરણ (રક્ષણ) ધારો ૧૯૮૬ તથા તે અંતર્ગત બનાવેલા નિયમો.
- ૭. પાણી (પ્રદુષણ નિવારણ તથા નિયંત્રણ) ધારો ૧૯૭૪

વધુમાં અમે સૂચવીએ છીએ કે

કંપનીએ ધ એપ્રેન્ટીસ એક્ટ, ૧૯૬૧ની જોગવાઈ અંતર્ગત એપ્રેન્ટીસ રાખવા જોઈએ.

અવલોકન હેઠળના ગાળા દરમ્યાન, કંપનીએ નીચેના નીરિક્ષણોને આધિન ઉપરોક્ત કાયદાઓ, નિયમો, વિનિયમો, માર્ગદર્શિકા ધોરણો વગેરે જોગવાઈઓનું પાલન કર્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની વાર્ષિક સાધારણ સભા તા.૨૫/૧૦/૨૦૧૯ના રોજ રાખવામાં આવેલ હતી જે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના કંપનીના નાણાકીય પત્રકો ઉપર સીએન્ડએજી તરફથી ટીપ્પણી ન મળવાને કારણે મુલત્વી રાખવામાં આવેલ. તેથી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના કંપનીના નાણાકીય પત્રકો ઉપર સીએન્ડએજી તરફથી ટીપ્પણી મળતા અગાઉ મુલત્વી રાખેલ બેઠક તા. ૧૯/૦૫/૨૦૨૦ના રોજ યોજવામાં આવી હતી.



વધુમાં અમે અહેવાલ આપીએ છીએ કે

અવલોકન હેઠળના ગાળા દરમ્યાન કંપનીએ સામાન્ય રીતે લાગુ પડતા કાયદા, નિયમો, વિનિયમો, માર્ગદર્શિકા ધોરણો વિગેરેને લાગુ પડતી જોગવાઈઓનું સામાન્ય રીતે પાલન કર્યું છે, જો કે અમારૂં નીરિક્ષણ નીચે મુજબ છે.

શેર ધારકો દ્વારા તા.૨૧/૦૬/૨૦૧૯ ના રોજ યોજાયેલ અને મુલત્વી રહેલ ૧૯મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીની અધિકૃત મૂડી વધારવામાં આવેલ. ત્યાર બાદ કંપનીએ જે અંગે ફાળવણી બાકી છે તેવા અરજીના નાણાં સામે ઈકવીટી શેર ફાળવેલ છે.

વધુમાં કોર્પોરેટ બાબતમાં મંત્રાલય દ્વારા કંપનીને પૂર્તતા (જોગવાઈઓનું પાલન) ન કરનાર ચાલુ કંપની તરીકે નોંધેલ છે. જો કે, હાલના તબક્કે જરૂરી પૂર્તતા કરવાને કારણે કંપની આઈ.એન.સી. ૨૨-એ ભરી શકી છે. ત્યાર બાદ કંપનીએ સંચાલકોની નિમણૂક તથા અધિકૃત મૂડી વધારવા અંગેના પત્રકો ભરેલ છે.

ઉપર જણાવેલ વિગતો ઉપરાંત અમે વધુમાં અહેવાલ આપીએ છીએ કે

કંપનીના સંચાલક મંડળની રચના એકઝીક્યુટીવ ડાયરેક્ટર્સ, નોન એકઝીક્યુટીવ ડાયરેક્ટર્સ અને સ્વતંત્ર ડાયરેક્ટર્સના યોગ્ય પ્રમાણ સાથે કરવામાં આવી છે. અવલોકન હેઠળના વર્ષ દરમ્યાન સંચાલક મંડળના માળખામાં કરેલો ફેરફાર કાયદાની જોગવાઈઓ ના પાલન સાથે કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે કાયદાની જોગવાઈ મુજબ બોર્ડ મીટિંગના કાર્યક્રમ માટે તમામ ડાયરેક્ટરોને પૂરતા સમયની નોટીસ આપવામાં આવે છે, એજન્ડા અને એજન્ડા ઉપરની વિગતવાર નોંધો ઓછામાં ઓછા સાત દિવસ પહેલા મોકલવામાં આવી હતી અને એજન્ડા મીટિંગ પહેલા આઈટમો અંગે વધારાની માહિતી અને સ્પષ્ટતાઓ મેળવવા માટેની અને મીટિંગોમાં અર્થસભર ભાગ લેવા માટેની પદ્ધતિ અસ્તિત્વમાં છે.

બોર્ડના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવે છે. કંપનીએ દ્વારા રજૂ કરવામાં આવેલ રેકર્ડ મુજબ બેઠકમાં પસાર કરવામાં આવેલા કોઈપણ ઠરાવ ઉપર બોર્ડના કોઈ સભ્ય દ્વારા અસંમતિ દર્શાવી નથી.

કંપનીધારા, ૨૦૧૩ની કલમ ૧૭૩ (૧) ની જોગવાઈ પ્રમાણે કંપનીએ દર વર્ષે સંચાલક મંડળની ઓછામાં ઓછી ચાર બેઠકો અને એ બોર્ડની બે સળંગ બેઠકો વચ્ચે ૧૨૦ દિવસથી વધારે સમય ન હોય તેવી રીતે બોલાવવાની હોય છે. વર્ષ દરમ્યાન સંચાલક મંડળની તા.૨૧/૦૬/૨૦૧૯ તા.૨૫/૧૦/૨૦૧૯ અને તા.૨૨/૦૧/૨૦૨૦ના રોજ એમ માત્ર ત્રણ બેઠકો બોલાવાઈ હતી તેવું અમારા અવલોકનમાં જણાયું છે.

અમે વધુ જણાવીએ છીએ

કંપનીના કદ અને કામોને અનુરૂપ કંપનીમાં પૂરતી પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ છે જેથી લાગુ પડતા કાયદાઓ, નિયમો, વિનિયમો અને ગાઈડલાઈન્સ ઉપર અમલ અને મોનીટરીંગ કરી શકાય.

વતી, ગૌદાણા એન્ડ ગૌદાણા
(કંપની સેક્રેટરીઝ)

સ્થળ: અમદાવાદ

તારીખ: ૧૮/૦૨/૨૦૨૧

સી.એસ. અરવિંદ ગૌદાણા
પાર્ટનર

એફ.સી.એસ.: ૨૮૩૮, સી.પી. નં.: ૨૧૮૩
યુ.ડી.આઈ.એન. એફ૦૦૨૮૩૮બી૦૦૩૦૨૪૩૬૨

નોંધ : આ અહેવાલ અમારા સરખાં તારીખના પત્ર સાથે આ રીપોર્ટના એક ભાગ તરીકે છે જે એનેક્ષર એ તરીકે બીડવામાં આવેલ છે અને આ રીપોર્ટના એક ભાગ તરીકે છે.



ગૌદાણા એન્ડ ગૌદાણા

(કંપની સેક્ટરી) (અગાઉ અરવિંદ ગોદાણા એન્ડ કંપની તરીકે)
૩૦૭, આશિર્વાદ પારસ, પ્રહલાદનગર ગાર્ડન પાસે, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન : +૯૧ ૭૯ - ૪૦૩૨૪૫૬૭/૪૦૩૨૪૫૬૮ E-mail : arvindg_cs@yahoo.com

અનુસૂચિ-એ

પ્રતિ,
મેમ્બર્સ

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.
(સીઆઈએન : યુ૪૧૦૦૦ જીજે ૧૯૯૯એસજીસી ૦૩૬૭૭૭)
ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૧, પાહેલો માળ,
સેક્ટર- ૧૦, ગાંધીનગર,
ગુજરાત, ૩૮૨૦૧૦ ભારત

અમારા સમાન તારીખનો અહેવાલ આ પત્ર સાથે વંચાણે લેવા વિનંતી છે.

૧. સેક્ટરીઅલ રેકર્ડ જળવવાની જવાબદારી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.સ ના વ્યવસ્થાપનની છે. અમારી જવાબદારી સેક્ટરીઅલ રેકર્ડ ઉપર ઓડિટ આધારિત અભિપ્રાય આપવાની છે.
૨. સેક્ટરીઅલ રેકર્ડની માહિતી અને સાચાપણા બાબતે વ્યાજબી ખાત્રી મેળવવા ઓડિટ પ્રક્રિયા અને પ્રથાઓનો અમે અનુસરણ કર્યું છે. અને સેક્ટરીના રેકર્ડમાં સાચી વિગતો દર્શાવી છે તેની ખરાઈ કરવા માટે અમે પરિક્ષણ આધારિત ચકાસણીની જે પદ્ધતિ અનુસરી છે તે અમારા મંતવ્ય માટે વ્યાજબી આધાર પુરો પાડે છે.
૩. અત્રે નાણાંકીય રેકર્ડના સાચાપણા અને વ્યાજબીપણા ખાત્રી માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબી ચોપડાની ચકાસણી કરી નથી.
૪. જ્યાં જરૂરી પડી ત્યાં મને વ્યવસ્થાપન પાસેથી કાયદાઓ, નિયમો અને વિનિયમો અને ઘટનાઓ વિગેરે બાબતે નિવેદન મેળવેલ છે.
૫. કોર્પોરેટ જોગવાઈઓ અને અન્ય લાગુ થતા કાયદાઓ, નિયમો, વિનિયમો, ધોરણોના પાલનની જવાબદારી વ્યવસ્થાપનની છે. અમારી ચકાસણી પરિક્ષણ આધારિત ખાત્રી પૂરતી મર્યાદિત હતી.
૬. સેક્ટરીઅલ ઓડિટર રીપોર્ટ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. ની ભાવિ શક્યતા અંગે ન કોઈ ખાત્રી આપે છે કે ન તો વ્યવસ્થાપન દ્વારા ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીના વ્યપાર/ કામકાજ સંભાળવામાં ફાળવેલ સામર્થ્ય કે અસરકારતા બાબતે ઉલ્લેખ કરેલ છે.

વતી, ગૌદાણા એન્ડ ગૌદાણા
(કંપની સેક્ટરીઝ)

સ્થળ: અમદાવાદ
તારીખ: ૧૮/૦૨/૨૦૨૧

સી.એસ. અરવિંદ ગૌદાણા
પાર્ટનર
એફ.સી.એસ.: ૨૮૩૮, સી.પી. નં. : ૨૧૮૩
યુ.ડી.આઈ.એન. એફ૦૦૨૮૩૮બી૦૦૩૦૨૪૩૬૨



ટાંકી પંપીંગ સ્ટેશન
એન.સી.-૩૦ પ્રોજેક્ટ, સુરેન્દ્રનગર



અંજાર પંપીંગ સ્ટેશન



નાવડા એસ.પી.પી. ૩૦મી પંપીંગ સ્ટેશન



બ્રાહ્મણી ૨ ડેમ ઈન્ટેક

માંડવી ખાતે ૧૦૦ એમ.એલ.ડી. ડી-સેલીનેશન પ્લાન્ટ ખાતમૂર્દત





કિશન એમ. મહેતા એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

મુખ્ય કાર્યાલય : દહો માળ, પ્રેમચંદ હાઉસ એનેક્ષી, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ (ભારત)
ફોન : + ૯૧-૭૯-૨૬૫૮૧૫૭૦, ૬૬૦૫૫૫૭૦, ૬૬૩૧૧૫૭૦ ઈ-મેઇલ : kishanmmehtaco@gmail.com

સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ

પ્રતિ
સભ્યશ્રીઓ,
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.
ગાંધીનગર

નાણાંકીય પત્રકો ઉપર અહેવાલ

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનાં (કંપની) નું તા.૩૧ મી માર્ચ ૨૦૨૦ ના રોજનું સરવૈયું તથા તે દિવસે પૂરા થતા વર્ષનું નફા નુકશાનનું પત્રક તથા રોકડ પ્રવાહનું પત્રક તથા નાણાંકીય પત્રકો, જેમાં મહત્વની હિસાબી નીતિઓ તથા અન્ય વિવરણાત્મક માહિતીના સારાંશ તથા તેના ઉપરની નોંધોનો સમાવેશ થાય છે. તેનું અમોએ ઓડિટ કરેલ છે.

અમારા મતે તથા અમોને પૂરી પાડવામાં આવેલ માહિતી અને રજૂ કરવામાં આવેલ ખુલાસાઓ મુજબ ઉપર જણાવેલ નાણાંકીય પત્રકો કંપની ધારા ૨૦૧૩ (કાયદા) મુજબની જરૂરી માહિતી પૂરી પાડે છે અને કાયદાની કલમ-૧૩૩ હેઠળ સૂચવવામાં આવેલ હિસાબી ધોરણો તથા ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત અન્ય નાણાંકીય સિદ્ધાંતો અનુસાર તા.૩૧.૩.૨૦૨૦ના રોજની સ્થિતિ, ખોટ અને તે તારીખના રોજ પુરા થતા વર્ષના રોકડ પ્રવાહ (કેશ ફ્લો)નું સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરે છે.

અભિપ્રાય માટેના આધાર :

કાયદાની કલમ ૧૪૩ (૧૦) મુજબ નક્કી કરવામાં આવેલ હિસાબી ધોરણો મુજબ અમોએ ઓડિટ હાથ ધરેલ છે. અમારા અહેવાલના નાણાંકીય પત્રકોના ઓડિટ માટે ઓડિટર્સની જવાબદારીના અનુભાગમાં આ ધોરણો મુજબની અમારી જવાબદારીઓનું વિશેષ વિવરણ કરવામાં આવેલ છે. કાયદાને જોગવાઈઓ તથા તેને અંતર્ગત નિયમોને અનુલક્ષીને અમારા દ્વારા કરવામાં આવેલ નાણાકીય પત્રકોના ઓડિટના સંદર્ભમાં નૈતિક ધોરણો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલી આચારસંહિતા અનુસાર અમે કંપનીથી સ્વતંત્ર છીએ અને અમોએ આ ધોરણો, આઈ.સી.એ.આઈ.ની આચારસંહિતા તથા અન્ય નૈતિક જવાબદારીઓનું પાલન કરેલ છે. અમે માનીએ છીએ કે નાણાકીય પત્રકો ઉપરના અમારા અભિપ્રાય માટે આધાર પૂરો પાડવા માટે અમે પ્રાપ્ત કરેલ ઓડિટને લગતા પુરાવાઓ પૂરતા અને યોગ્ય છે.

નાણાંકીયપત્રકો તથા ઓડિટર્સ સિવાયની અન્ય માહિતી :

નાણાકીય પત્રકો અને ઓડિટર્સના અહેવાલ સિવાયની અન્ય માહિતી તૈયાર કરવા માટે કંપનીનું નિયાક મંડળ જવાબદાર છે. અન્ય માહિતીમાં બોર્ડના અહેવાલ તથા બોર્ડના અહેવાલ સાથેના જોડાણમાં સમાવિષ્ટ માહિતીનો સમાવેશ થાય છે. પણ તેમાં નાણાંકીય પત્રકો તથા તે ઉપરના અમારા ઓડિટર્સના અહેવાલનો સમાવેશ થતો નથી.

નાણાકીય પત્રકો પરનો અમારો અભિપ્રાય અન્ય માહિતીને આવરી લેતો નથી. અને તેના નિષ્કર્ષ માટે અમે કોઈ પ્રકારે ખાતરી આપતા નથી.

નાણાકીય પત્રકોના ઓડિટ સંદર્ભે અમારી જવાબદારી અન્ય માહિતી વંચાણમાં લેવી અને તેમ કરતાં આ માહિતી નાણાકીય પત્રકોની માહિતી કે ઓડિટ દરમ્યાન અમે મેળવેલી જાણકારી કરતા તાત્વિક રીતે ભિન્ન નથી કે તાત્વિક રીતે ખોટી નથી તે જોવાની છે.

અમે કરેલ કામગીરી બાદ અમોને એમ લાગે કે અન્ય માહિતીમાં ખોટી રજૂઆત છે તો આ બાબત અમારે ધ્યાને મૂકવી જોઈએ. આવી ધ્યાને મૂકવા લાયક કોઈ બાબત નથી.

નાણાકીય પત્રકો અંગે સંચાલક મંડળની જવાબદારી :

ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી ધોરણો તથા કલમ ૧૩૩માં નિર્દિષ્ટ હિસાબી ધોરણો પ્રમાણે તૈયાર કરવામાં આવતા નાણાંકીય પત્રકો કંપનીની નાણાકીય સ્થિતિ, નાણાકીય કામગીરી તથા રોકડ પ્રવાહને લગતું સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરે તે જોવાની જવાબદારી કાયદાની કલમ ૧૩૪ (૫) હેઠળ કંપનીના સંચાલક મંડળની છે.

આ જવાબદારીમાં કંપનીની સંપત્તિના રક્ષણ માટે અને છેતરપિંડીઓ અને અન્ય ગેરરીતિઓ અટકાવવા અને શોધી કાઢવા, યોગ્ય હિસાબી નીતિઓની પસંદગી અને તેના ઉપયોગ, કપટ અથવા ભૂલને કારણે કે ઉભા થતા તાત્વિક ખોટા કથનોથી મુક્ત તથા સાચું અને વ્યાજબી નાણાકીય ચિત્ર રજૂ કરે તેવા ચોકસાઈ તથા પૂર્ણતા ધરાવતા હિસાબી રેકર્ડ ઉપલબ્ધ થઈ શકે તે માટે આંતરિક નાણાકીય અંકુશના અમલીકરણ તથા જાળવણી માટે માળખું તૈયાર કરવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.

નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે, કંપની તરીકે ચાલુ રહેવાની ચાલુ કંપનીની ક્ષમતાની ચકાસણી કરવા માટે, જ્યાં જરૂર જણાય ત્યાં કંપનીની હિસાબી બાબતો ચાલુ કંપની તરીકે દર્શાવવા અથવા કંપનીને ફરજિયાત ગયેલી જાહેર કરવાનો ઈરાદો હોય તેવી કંપની કામ કરતી બંધ હોય અથવા વાસ્તવિક વિકલ્પ તરીકે તેમ કરવું પડે તેમ જણાય તો તેમ જાહેર કરવા માટે વ્યવસ્થાપન જવાબદાર છે.

કંપનીની નાણાકીય અહેવાલની પ્રક્રિયાની દેખરેખ રાખવાની જવાબદારી સંચાલક મંડળની છે.



નાણાકીય પત્રકોના ઓડિટ માટે ઓડિટરની જવાબદારી :

અમારા ઉદ્દેશો સમગ્રપણે નાણાકીય પત્રકો છેતરપિંડી અથવા ભૂલને લીધે ઉભી થતાં તાત્વિક ખોટા કથનોથી મુક્ત છે તેની વ્યાજબી ખાત્રી કરવા માટેનો છે અને તે માટે અમારા અભિપ્રાય સાથેનો ઓડિટરનો અહેવાલ રજૂ કરવાનો છે. વ્યાજબી ખાત્રી એ ઉચ્ચ કક્ષાની છે, પરંતુ હિસાબી ધોરણો અનુસાર હાથ ધરવામાં આવેલ ઓડિટ હંમેશા અસ્તિત્વમાં હોય તેવી તાત્વિક ખોટા કથનો શોધી શકશે જ તેની ખાત્રી નથી. ખોટા કથનો છેતરપિંડી અથવા ભૂલને કારણે ઉપસ્થિત થઈ શકે છે અને નાણાકીય પત્રકોનો આધાર લઈ આર્થિક નિર્ણય લેનાર વપરાશકર્તાઓના નિર્ણયને વ્યક્તિગત કે સર્વગ્રાહી રીતે અસરકર્તા હોય તેવા કથનોને તાત્વિક ગણવામાં આવે છે.

ઓડિટના ધોરણો અનુસાર હાથ ધરવામાં આવેલ ઓડિટના ભાગરૂપ અમે સમગ્ર ઓડિટ દરમ્યાન વ્યવસાયને અનુરૂપ નિર્ણય લઈએ છીએ અને (રેકર્ડને) બારીકાઈથી જોઈએ છીએ.

અમે છેતરપિંડી અથવા ભૂલને લીધે ઉભા થતા નાણાકીય પત્રકોની તાત્વિક ભૂલના જોખમોને શોધી કાઢવા અને તે જોખમોને અનુલક્ષીને ઓડિટ પદ્ધતિ નક્કી કરીએ છીએ તથા અમારો અભિપ્રાય આપવા માટે પૂરતા અને યોગ્ય હોય તેવા ઓડિટ આધારો મેળવવાની કામગીરી કરીએ છીએ. સંબંધિત ભૂલના પરિણામ સ્વરૂપ ઉપસ્થિત થયેલ તાત્વિક ખોટા કથન ન શોધી શકાય તેના જોખમ કરતાં, છેતરપિંડીના કારણે ઉપસ્થિત થતાં તાત્વિક ખોટા કથનો ન શોધી શકાય તેનું જોખમ વધુ છે કારણ કે છેતરપિંડીમાં મેળાપીપણું, બનાવટી રજૂઆત, ઈરાદાપૂર્વકની ખોટી રજૂઆત અથવા આંતરિક અંકુશની ખામી હોઈ શકે છે. આંતરિક અંકુશની સમજ મેળવવા માટે સંજોગોને અનુરૂપ ઓડિટ પદ્ધતિ નક્કી કરવા અને કાયદાની કલમ ૧૪૩ (૩) (૧) મુજબ કંપનીમાં નાણાકીય નિયંત્રણની વ્યવસ્થા હયાત છે અને આ નિયંત્રણની વ્યવસ્થા અમલી અને અસરકારક છે તે માટે અભિપ્રાય આપવા માટે અમે જવાબદાર છીએ.

ઉપયોગમાં લેવામાં આવતી હિસાબી નીતિઓની યોગ્યતા અને વ્યવસ્થાપન દ્વારા કરેલ નાણાકીય અંદાજોના વ્યાજબી પણા તથા તેને અનુરૂપ જાહેર કરવાની બાબતોની સમીક્ષા કરવી.

વ્યવસ્થાપન દ્વારા ચાલુ કંપની તરીકેના હિસાબોની પદ્ધતિના ઉપયોગના વ્યાજબીપણા તથા ઓડિટ દરમ્યાન મેળવેલા પુરાવાઓના આધારે નિષ્કર્ષ ઉપર આવવું કે કોઈ ઘટના કે પરિસ્થિતિને લગતી કોઈ મહત્વની અનિશ્ચિતતા પ્રવર્તે છે જે કંપનીના ચાલુ રહેવાની ક્ષમતા માટે શંકા ઉભી કરે છે. જો આવી કોઈ મહત્વની અનિશ્ચિતતા હોવા બાબતે તારણ આપીએ તો અમારે નાણાકીય નિવેદનોમાં જાહેર કરેલ સંબંધિત બાબત ઉપર ધ્યાન દોરવું જરૂરી બને છે અથવા અમારો અભિપ્રાય બદલવો જરૂરી બને છે. અમારા તારણો ઓડિટ રીપોર્ટની તારીખ સુધી મેળવેલા ઓડિટ પુરાવા પર આધારિત હોય છે જો કે ભાવિ ઘટનાઓ કે પરિસ્થિતિ કંપનીના ચાલુ રહેવાની બાબત માટે કારણભૂત બની શકે છે.

નાણાકીય પત્રકો તથા જાહેર કરેલી બાબતોની એકદર રજૂઆત, તેનું માળખું તથા તેમાં સમાવિષ્ટ બાબતોનું મૂલ્યાંકન કરવું અને જોવું કે નાણાકીય નિવેદનો થયેલ વ્યવહારો અને ઘટનાઓનું યોગ્ય નિરૂપણ કરે છે.

અમે સંચાલકોને અન્ય બાબત સાથે ઓડિટરનું નકકી કરેલ કાર્યક્ષેત્ર તથા સમય અને ઓડિટ દરમ્યાન શોધી કાઢેલ મહત્વની ખામીઓ તથા ધ્યાને આવેલી આંતરિક અંકુશની પદ્ધતિમાં જણાયેલ મહત્વની ખામીઓની જાણ કરીએ છીએ.

અમે સંચાલકોને અમોને મળેલ સ્વતંત્રતા સંબંધિત નૈતિક જરૂરિયાતનું પાલન કર્યું છે અને તેમની સાથે તમામ સંબંધો અને જેમા અમારી સ્વતંત્રતા સંકળાયેલી હોય અને જ્યાં તેના બચાવવાના પગલા જરૂરી હોય તેવી અન્ય બાબતોની જાણ કરીએ છીએ. તેઓ સાથેના સંબંધો તથા સ્વતંત્રતા સાથે સંકળાયેલ જણાતી અન્ય બાબતો બચાવ/ અગમચેતી તરીકે અમે જાણીએ છીએ.

ભાર મુકવા જેવી બાબતો :

અમે નાણાકીય નિવેદનો ઉપરની નીચે મુજબની નોંધ તરફ ધ્યાન આકર્ષિત કરીએ છીએ.

અગાઉના વર્ષોમાં કાર્યરત થયેલી અને અગાઉના વર્ષોમાં મૂડીકૃત કરવામાં આવેલી ન હોતી તેવી રૂા. ૨૫.૩૭ કરોડની અસ્કયામતો, પ્રગતિ હેઠળના ચાલુ કામો તરીકે દર્શાવવામાં આવી હતી, ચાલુ વર્ષમાં મૂડીકૃત કરવામાં આવેલી છે. આમ કરવાને કારણે અગાઉના વર્ષોમાં નોંધ ૨૪માં દર્શાવ્યા મુજબના કારણોસર, જેની જોગવાઈ થઈ શકી નહોતી તેવા રૂા. ૫.૫૬ કરોડના ધસારાની જોગવાઈ ચાલુ વર્ષમાં કરવામાં આવી છે. આ અસ્કયામતો અનુદાનમાંથી મળેલી હોઈ, અગાઉના વર્ષનો ધસારો વિલંબિત અનુદાન સામે સમાયોજીત/ સરભર કરવામાં આવેલ છે અને તેની કંપનીની નફાકારકતા ઉપર કોઈ અસર પડતી નથી.

કેટલીક પાર્ટીઓને મૂડી ખર્ચ સામે આપવામાં આવેલ રૂા. ૩.૮૬ કરોડનું ધિરાણ “લાંબા ગાળાની લોન તથા ધિરાણ” નીચે દર્શાવવામાં આવેલ છે તે અંશતઃ વસૂલાતપાત્ર અને બાકીની રકમ આખરીકરણ થયેથી મૂડીકૃત કરી સ્થાયી અસ્કયામતો નીચે દર્શાવવામાં આવશે અને નાણાકીય પત્રકો ઉપરની નોંધ ૨૫ માં વિગતવાર સમજૂત કર્યા મુજબ ધસારાની જોગવાઈ કરવામાં આવશે.

નાણાકીય પત્રકો ઉપરની નોંધ ૨૭માં સમજૂત કર્યા મુજબ કંપનીની કામગીરી સંબંધિત મળવાપાત્ર રકમ, ચૂકવવાપાત્ર રકમ, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ તથા લાંબાગાળાની લોન અને ધિરાણોની રકમ જરૂર જણાય ત્યાં સમર્થન મેળવણા તથા સરભર થવાને પાત્ર છે.

નાણાકીય પત્રકો ઉપરની નોંધ ૧૩માં સમજૂત કર્યા મુજબ પ્રાયોજના કચેરીઓની રૂા. ૩૫,૩૦૯ (કુલ ઉધારબાકી રૂા. ૨૪,૨૨,૯૭૦.૦૦ અને કુલ જમા બાકી રા. ૨૩,૮૭,૬૬૦.૩૨) કરોડની સિલકો નોંધ ૨૮માં ટુંકાગાળાની લોન તથા પેશગીઓ (ચાલુ) તરીકે દર્શાવેલ છે અને તે મેળવણીને અને જો હોય તો સરભર કરવાને પાત્ર છે.



રૂ. ૦.૩૬ કરોડ (ગત વર્ષની રૂ. ૧.૮૨ કરોડ) ની જમા બાકી જે બેંકને મળેલ છે અને દેવાદારોના ખાતા સામે સરભર તરીકે દર્શાવવામાં આવેલ છે તે નાણાંકીય પત્રકો ઉપરની નોંધ ૩૦માં સમજૂત કર્યા મંજૂબ જે તે તે પાર્ટીઓના નામની જાણકારી માહિતી મળ્યેથી સંબંધિત પાર્ટીના નામે જમા કરવામાં આવશે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી પૂરા પાડવામા આવતા પાણીના બીલોમાં દર્શાવવામાં આવતી વ્યાજ તથા પેનલ્ટીની રકમ માટે ઘણા વર્ષોથી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. નાણાકીય પત્રકો ઉપરની નોંધ ૩૮માં સમજૂત કર્યા પ્રમાણે આ બાબતનું આખરીકરણ થયેથી આ રકમ નક્કી કરી શકાશે.

નીચે મુજબની બાબતે અમારો અભિપ્રાય સુધારવામાં આવેલ નથી.

૧. અમારી અન્ય ન્યાયિક તથા નિયમનકારી જરૂરિયાતો પરકાયદાની કલમ ૧૪૩ ની પેટા કલમ (૧૧) મુજબ ભારત સરકારે જારી કરેલ કંપની (ઓડિટરોનો અહેવાલ) હુકમ ૨૦૧૬ માં સૂચવ્યા મુજબ આ હુકમના ફકરા ૩ અને ૪માં નિર્દિષ્ટ કરવામાં આવેલી બાબતો મુજબનું એક પત્રક જોડાણ “અ” માં સામેલ કરીએ છીએ.
 ૨. કંપની ધારા ૨૦૧૩ની કલમ ૧૪૩ (પ) અનુસંધાને ભારતના ઓડિટર અને કોમ્પ્રોલર દ્વારા બહાર પાડવામાં આવેલી સુચનાઓના સંદર્ભમાં કંપનીના રેકર્ડની ચકાસણીના આધારે તથા પૂરી પાડવામાં આવેલી માહિતી અને સ્પષ્ટતાઓ ધ્યાને લઈને નીચે મુજબનો અહેવાલ રજૂ કરીએ છીએ.
 - (૧) કંપનીમાં હિસાબી વ્યવહારોમાં આઈ.ટી. પદ્ધતિએ પ્રક્રિયા કરવા માટેની વ્યવસ્થા છે ? જો હા તો હિસાબી વ્યવહારોની વિશ્વાસનિયતા ઉપર અસર પડી હોય તો તે જણાવવી. કંપનીમાં કેન્દ્રીયકૃત હિસાબો રાખવાની વ્યવસ્થા છે અને ઈ.આર.પી. ટેલી-૯ ઉપર હિસાબો તૈયાર કરવામાં આવે છે.
 - (૨) કંપનીની લોન પરત ભરપાઈ કરવાની અસમર્થતાને કારણે નાણા ધિરનાર દ્વારા લોનના માળખામાં ફેરફાર કરવો અથવા હયાત લોન કે, દેવા/લોન/વ્યાજ વગેરે જતુ કરવા/માંડવાણ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ? જો હા તો તેની નાણાકીય અસરો જણાવો.
લાગુ પડતુ નથી.
 - (૩) કેન્દ્ર/રાજ્ય સરકારની એજન્સી દ્વારા કોઈ ચોકકસ યોજના માટે મળેલા/ મળવાપાત્ર નાણાં યોગ્ય રીતે હિસાબે લેવામાં આવ્યા છે/શરતો અને બોલીઓ પ્રમાણે વપરાશમાં લેવામાં આવ્યા છે ? જો કોઈ ફેરફાર કરેલ હોય તો એવા કિસ્સાઓ પત્રક રૂપે જણાવવા
આ પ્રકારના કોઈ કિસ્સા નથી.
૩. કાયદાની કલમ ૧૪૩ (૩) ની જરૂરિયાત મુજબ અમે અહેવાલ આપીએ છીએ કે...
- (એ) અમારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ અમે ઓડિટના હેતુ માટે જરૂરી હોય તેવી તમામ માહિતી અને ખુલાસાઓ મેળવેલ છે.

- (બી) અમોએ કરેલી ચોપડાઓની તપાસમાં જણાવ્યા મુજબ અમારા મતે કંપનીએ કાનુની જરૂરિયાત મુજબના યોગ્ય ચોપડાઓ રાખેલ છે.
- (સી) આ અહેવાલ સાથે સામેલ રાખેલ સરવૈયું, નફા નુકસાન ખાતું તથા રોકડ પ્રવાહ પત્રક હિસાબી ચોપડાઓ સાથે મળી રહે છે.
- (ડી) અમારા મતે ઉપર જણાવેલ નાણાકીય પત્રકો કંપની ધારાની કલમ ૧૩૩માં ઉલ્લેખ થયા મુજબ તથા કંપની (હિસાબ) નિયમો ૨૦૧૪ના નિયમ ૭માં સૂચવ્યા મુજબના હિસાબી ધોરણો મુજબના છે.
- (ઈ) સરકારી કંપની હોવાના કારણે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડેલ અધિસૂચના ક્રમાંક : જીએસઆર ૪૬૩ (૩) તા. ૫મી જૂન, ૨૦૧૫ તથા કંપની ધારા ૨૦૧૩ની કલમ ૧૬૪ની પેટા કલમની જોગવાઈઓ કંપનીને લાગુ પડતી નથી.
- (એફ) કંપનીના નાણાકીય અહેવાલ ઉપરની આંતરિક નાણાકીય અંકુશોની પર્યાપ્તતાના સંદર્ભમાં અને આવા અંકુશોની સંચાલનમાં અસરકારકતા બાબતે અમારો અલગ અહેવાલ “એનેક્ષર બી” તરીકે સામેલ છે.
- (જી) અમારા મતે અને અમારી શ્રેષ્ઠ જાણકારી અને અમને આપેલા ખુલાસાઓ અનુસાર કંપની (ઓડિટ અને ઓડિટર) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૧ અનુસાર ઓડિટમાં સમાવવાની બાબતો અંગે અમે નીચે મુજબ અહેવાલ આપીએ છીએ.
- (૧) કંપનીએ પડતર કેસોની અસર નાણાકીય પત્રકોમાં બતાવેલ છે. જુઓ નાણાકીય પત્રકો ઉપરની નોંધ : ૨૨.
- (૨) કંપનીના વ્યુત્પન્ન કરાર સહિત કોઈ લાંબા ગાળાનાં કરાર ન હતા
- (૩) કંપની દ્વારા રોકાણકારનાં શિક્ષણ અને સુરક્ષા ભંડોળમાં તબદીલ કરવા જરૂરી એવી કોઈ રકમો લેણી નથી.

કિશન એમ. મહેતા એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી
ફર્મ રજિ. નં. ૧૦૫૨૨૯ ડબલ્યુ

સહી/-
યુ.પી. ભાવસાર

સ્થળ : અમદાવાદ

તા. ૩૦મી ડિસેમ્બર, ૨૦૨૦

યુડીઆઈએન નં. ૨૦૦૪૩૫૫૯એએએસીએસ૪૦૯૫



સ્વતંત્ર ઓડિટરના અહેવાલ સાથેનું જોડાણ - “અ”

સંદર્ભ : ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમિટેડ

(જુઓઅમારા સમાન તારીખના અહેવાલનો ફકરા નં. ૧)

- (અ) (૧) (ક) સ્થાયી અસ્કયામતોની પરિમાણાત્મક વિગતો અને સ્થિતિ દર્શાવતી પૂરેપૂરી વિગતો દર્શાવતું યોગ્ય રેકર્ડ કંપનીએ રાખેલ છે પરંતુ તેને યોગ્ય અને સંપૂર્ણ બનાવવા માટે કેટલી વિગતો પૂર્ણ કરવી જરૂરી છે.
- (ખ) અમોને સ્પષ્ટતા કર્યા મુજબ વર્ષ દરમ્યાન સ્થાયી અસ્કયામતોની ભૌતિક ખરાઈ વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવેલ નથી તેના કારણે નોંધપાત્ર તફાવતો બાબતે અમે અભિપ્રાય આપવાની સ્થિતિમાં નથી.
- (ગ) કંપનીએ માલિકીના હકકપત્રકો અમારી ચકાસણી માટે રજૂ કરેલ નથી તેથી કોઈ સ્થાયી મિલકત કંપનીના નામે છે કે નહીં તે અંગે કોઈ ટીપ્પણી કરવાની સ્થિતિમાં નથી. .
- (૨) અમોને સ્પષ્ટતા કર્યા મુજબ કંપની જથ્થામાં પાણી પુરુ પાડે છે. તેથી તે ઈન્વેન્ટરી ધરાવતી નથી. તેથી હુકમ ના ફકરા ૩ (૨) કંપની ને લાગુ પડતો નથી.
- (૩) કંપનીએ કોઈ કંપની, પેઢી, મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી અથવા અન્ય પક્ષકારને લોન મંજૂર કરી નથી તેમ કાયદાકીય કલમ-૧૮૯ હેઠળ નિભાવેલ રજીસ્ટર ઉપરથી જણાય છે.
- (૪) જે માહિતીઓ અને સ્પષ્ટતા પૂરી પાડવામાં આવેલ છે તે અનુસાર કંપની અધિનિયમ ૨૦૧૩ કલમ ૧૮૫ તથા ૧૮૬ હેઠળ કંપનીએ કોઈ લોન આપેલ નથી કે કોઈ રોકાણ કરેલ નથી કે કોઈ બાંહેધરી આપી નથી કે કોઈ જમીનગીરી આપી નથી.
- (૫) કલમ ૭૩ થી ૭૬ નાં નિયમો અને જોગવાઈઓ તથા તે હેઠળ બનાવેલ નિયમોના અર્થમાં કંપનીએ વર્ષ દરમ્યાન પ્રજા પાસેથી કોઈ પણ થાપણ સ્વિકારેલ નથી.
- (૬) કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૮ હેઠળ હેઠળ પડતરનું રેકર્ડ રાખવાની જોગવાઈ લાગુ પડતી નથી.
- (ક) કંપનીના રેકર્ડ અનુસાર અને અમોને આપેલી માહિતી અને ખુલાસા અનુસાર અવિવાદિત વૈધાનિક લેણાં જેમાં ભવિષ્યનિધિ, કર્મચારી રાજ્ય વીમા, આવક વેરો, વેચાણ વેરો, વસ્તુ અને સેવા કર, આબકારી શુલ્ક, ઉપકર, અને અન્ય કોઈ વૈધાનિક લેણાં યોગ્ય સત્તાધિકારીઓ પાસે જમા કરવામાં કંપની સામાન્ય રીતે નિયમિત છે. અને જી.એસ.ટી. મુળસ્થાનેથી કપાતની રકમ રૂ. ૧૧,૩૬,૮૨૫ ને બાદ કરતાં તા. ૩૧.૦૩.૨૦૨૦ના રોજ છ માસથી વધુ સમય માટે અવિવાદિત કોઈ રકમ હોય તેવી ચુકવણા બાકી નથી.
- (ખ) અમોને આપેલ માહિતી અને ખુલાસાઓ અનુસાર અને ચૂકવવાપાત્ર હોય તેવા આવક વેરો, વેચાણ વેરો, સેવા કર, વસ્તુ અને સેવા કર, કસ્ટમ ડ્યુટી, એક્સાઈઝ ડ્યુટી, વેટ વગેરે વિવાદને કારણે ભરવામાં આવેલ ન હોય તેવો કોઈ કિસ્સો નથી.

- (૮) કંપનીએ કોઈ પણ નાણાકિય સંસ્થા, બેન્ક, સરકાર અથવા ડિબેનચર ધારક પાસેથી લોન લીધી નથી તેથી કંપનીના (ઓડિટરના અહેવાલ) ને લગતા હુકમ ૨૦૧૬ ના ફકરા-૩ (૮) ની જોગવાઈ કંપનીને લાગુ પડતો નથી.
- (૯) નાણા ઉભા કરવા માટે કંપનીએ જાહેર ઓફર કે વધારાની જાહેર ઓફર(જેમાં ઋણપત્રનો સમાવેશ થાય) કોઈ લોન વર્ષ દરમિયાન મેળવેલ નથી. તેથી હુકમના ફકરા-૩ ની જોગવાઈ (૯) કંપનીને લાગુ પડતી નથી.
- (૧૦) નાણાકીય પત્રકોનો સાચો અને વ્યાજબી અભિપ્રાય આપવા માટે હાથ ધરેલ ઓડિટ પ્રક્રિયા તથા અમોને આપેલ માહિતી અને ખુલાસાઓ અનુસાર કંપની પર અથવા કંપનીના કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા છેતરપીંડી થયેલ છે તેવું ચાલુ વર્ષ દરમિયાન ધ્યાને આવેલ નથી કે તેવી બાબત ઓડિટ દરમિયાન ધ્યાને મૂકવામાં આવેલ નથી.
- (૧૧) ભારત સરકારના કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય દ્વારા તા.૦૫/૦૬/૨૦૧૫ ના જાહેરનામામાં નંબર જીએએસઆર (૪૬૩) (ઈ) નાં સંદર્ભે સંચાલકીય મહેનતાણાને લગતી કંપની અધિનિયમની કલમ ૧૯૭ આ કંપનીને લાગુ પડતી નથી.
- (૧૨) કંપની તે નીધિ કંપની નથી તેથી કંપનીના (ઓડિટરના અહેવાલ) હુકમો, ૨૦૧૬ના ફકરાની કલમ ૩ (૧૨)ની જોગવાઈઓ કંપનીને લાગુ પડતો નથી.
- (૧૩) અમોને આપેલ માહિતી અને ખુલાસાઓ અને કંપનીના રેકર્ડની ચકાસણી અનુસાર તથા પક્ષકારો સાથે કરવામાં આવેલ વ્યવહારો, લાગુ પડતી હોય ત્યાં, કાયદાની કલમ -૧૭૭ અને ૧૮૮ મુજબના છે અને નાણાકીય પત્રકોમાં લાગુ પડતા હિસાબી ધોરણો મુજબ માહિતી રજૂ કરવામાં આવેલ છે.
- (૧૪) ચકાસણીના વર્ષમાં કંપનીએ શેર, અંશત: કે પુરા કનવર્ટિબલ ડિબેનચરની અગ્રતાના ધોરણે ફાળવણી કરી નથી કે ખાનગી પક્ષકારોના હવાલે કરેલ નથી.
- (૧૫) કંપનીએ કોઈ બિન રોકડ વ્યવહાર ડીરેક્ટર કે કંપની સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ સાથે કરેલ નથી. તેથી કંપની (ઓડિટરના અહેવાલ) ના હુકમ-૨૦૧૬ ના ફકરા (૩) ની જોગવાઈ (૧૫) તેને લાગુ પડતી નથી.
- (૧૬) અમોને આપેલ માહિતી અને ખુલાસાઓ અનુસાર રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અધિનિયમ ૧૯૩૪ ની કલમ-૪૫ આઈ એ મુજબ કંપનીની નોંધણી કરાવવી જરૂરી નથી.

કિશન એમ. મહેતા એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી
ફર્મ રજિ. નં. ૧૦૫૨૨૯ ૩બલ્યુ

સ્થળ : અમદાવાદ

તા. ૩૦મી ડિસેમ્બર, ૨૦૨૦

યુડીઆઈએન નં. ૨૦૦૪૩૫૫૮એએએએસીએસ૪૦૮૫

સહી/-
યુ. પી. ભાવસાર
ભાગીદાર



સ્વતંત્ર ઓડિટરના અહેવાલનું જોડાણ - “બ”

કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૪૩ ની પેટા કલમ-૩ નાં ખંડ-૧ હેઠળ
આંતરિક નાણાંકિય અંકુશ ઉપરનો અહેવાલ.

અમોએ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમિટેડના (ધી કંપની) તા.૩૧ માર્ચ ૨૦૨૦ ના રોજનું આંતરિક નાણાંકિય અંકુશનું નાણાંકિય અહેવાલ ઉપર આ સાથે આ તારીખે વર્ષનાં અંતે એકલ નાણાંકિય પત્રકોનું ઓડિટ કરેલ છે.

આંતરિક નાણાંકિય અંકુશ માટે જવાબદાર વ્યવસ્થાપકો :

ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શક નોંધ, જે નાણાંકિય અહેવાલ પર નાં આંતરિક અંકુશ માટે જરૂરી ઘટકોને ધ્યાનમાં રાખીને કંપનીએ સ્થાપિત માપદંડ ને આધારે નાણાંકિય અહેવાલ પરના આંતરિક નાણાંકિય અંકુશનો, આંતરિક અંકુશને સ્થાપિત અને જાળવણી કરવાની વ્યવસ્થાપકોની જવાબદારી છે. આ જવાબદારીમાં સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરતા હોય અને છેતરપીંડી અથવા ભૂલના કારણે મહત્વશીલ ગેર રજૂઆત થી મુક્ત હોય તેવા નાણાં વિષયક પત્રકો સંપૂર્ણ રીતે તૈયાર કરવા અને ભરોસાપાત્ર નાણાંકીય માહિતી સમયમર્યાદામાં રજૂ કરવા સાથે સંબંધિત કંપનીના અસરકારક અને કંપનીની નીતિને અનુરૂપ નિયમસરની કામગીરી થઈ શકે તેવી આંતરિક નિયંત્રણની રચના અમલ અને નિભાવનો સમાવેશ થાય છે જે કંપનીના અધિનિયમ ૨૦૧૩ મુજબ જરૂરી છે.

ઓડિટરોની જવાબદારી :

અમારી જવાબદારી આ નાણાં વિષયક પત્રકો નાં અહેવાલ પર નાં આંતરિક નાણાંકિય અંકુશનો અમોએ કરેલા ઓડિટના આધારે અમારો અભિપ્રાય આપવાનો છે. આંતરિક નાણાંકિય અંકુશના સંદર્ભમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ નોંધ (માર્ગદર્શક નોંધ) તથા ઓડિટના ધોરણો સાથે સુસંગત કંપની ધારાની કલમ ૧૪૩ (૧૦) મુજબ અમો એ ઓડિટ કરેલ છે. આ ધોરણો અને માર્ગદર્શક નોંધ માં એ જરૂરી છે કે નૈતિક જરૂરિયાતોના પાલન સાથે આ આંતરિક અંકુશ નાણાંકિય અહેવાલના પત્રકોમાં અસરકારક રીતે સ્થાપિત કરવામાં અને દરેક મહત્વની બાબતોમાં અસરકારક રીતે અમલી બનાવવામાં આવ્યા છે તેની વ્યાજબી ખાતરી થઈ શકે તેવા ઓડિટનાં આયોજનની કાર્યવાહી કરેલ છે.

નાણાં વિષયક પત્રકોની રજૂઆત ઉપર આંતરિક નાણાંકીય અંકુશની પર્યાપ્ત તથા અસરકારકતા ને લગતા પુરાવા મેળવવાની બાબતનો અમારા ઓડિટમાં સમાવેશ થાય છે તથા નાણાં વિષયક પત્રકો તૈયાર કરવા ઉપર આંતરિક નાણાંકીય અંકુશને સમજવો અને જ્યાં મુખ્ય રીતે જોખમ જણાતું હોય તેનું તારણ કાઢવું અને આ તારણ ઉપર આધારીત અસરકારક આંતરિક અંકુશની બાબતનો અભ્યાસ કરે છે. ઓડિટમાટે પસંદ કરવામાં આવેલી પદ્ધતિનો આધાર છેતરપીંડી અથવા ભૂલના

કારણે થતી મહત્વની નાણાં વિષયક ગેરરજૂઆતોના જોખમોનું મુલ્યાંકન કરવામાં ઓડિટરની નિર્ણય શક્તિ પર છે.

અમે માનીએ છીએ કે અમે પ્રાપ્ત કરેલા ઓડિટ ને લગતા પુરાવા નાણાંકિય પત્રકો માટે આપવામાં આવતા અભિપ્રાય માટે પર્યાપ્ત અને યોગ્ય આધાર પુરા પાડે છે.

નાણાંકિય અહેવાલ પર આંતરિક અંકુશનો અર્થ

કંપનીના નાણાંકિય અહેવાલ પર આંતરિક નાણાંકિય અંકુશ રજૂ કરવાની પ્રક્રિયાનો આધાર એ નાણાંકિય બાહ્ય હેતુને સુસંગત સામાન્ય હિસાબી ધોરણોને સ્વીકારી તૈયાર કરેલ અહેવાલ અને પત્રકો જેના દ્વારા નાણાંકિય માહિતીના વ્યાજબીપણાની ખાત્રી થાય તેવી જાણકારી મેળવવાનો છે. કંપનીના નાણાંકિય અહેવાલ પર આંતરિક નાણાંકિય અંકુશમાં નીતિઓનો અને પ્રક્રિયાનો સમાવેશ થાય છે. (૧) રેકોર્ડની જાળવણીજે કંપનીની અસ્કયામતોના વ્યવહારો તથા અસ્કયામતોના નિકાલની વિગતો વિસ્તારપૂર્વક, ચોકકસાઈપૂર્વક તથા વ્યાજબી રીતે આપે. (૨) કંપનીના નાણાંકિય વ્યવહારોની વ્યવસ્થિત નોંધ થાય અને તેના આધારે હિસાબી સિદ્ધાંતોને અનુરૂપ જરૂરી નાણાંકિય પત્રકો તૈયાર થાય આવક તથા ખર્ચ કંપનીના ડીરેક્ટરો અને વ્યવસ્થાપકોની અધિકૃતી બાદ થયેલ હોય. (૩) અનધિકૃત સંપાદન ને સમયસર રોકવા અને બચાવવા માટેની યોગ્ય ખાતરી થાય તથા તેનો ઉપયોગ અને કંપનીની અસ્કયામતોની ગેરવ્યવસ્થાના કારણોસર કંપનીના નાણાંકિય પત્રકો પર મહત્વની અસર થવી ન જોઈએ.

નાણાંકિય અહેવાલ પર આંતરિક નાણાંકિય અંકુશની સહજ મર્યાદાઓ :-

નાણાંકિય અહેવાલ પરનાં આંતરિક અંકુશની સહજ મર્યાદાઓના કારણોસર અયોગ્ય વ્યવસ્થાપન અને મેળાપીપણાની શક્યતાના સમાવેશના લીધે નિયંત્રણ પર અંકુશ મેળવી ન શકાય અને ભૂલ અને છેતરપીંડીથી મહત્વની ખોટી રજૂઆતોને લીધે ઠગાઈ શોધી શકાતી નથી. પરિસ્થિતિઓના બદલાવથી તથા નીતિઓ અને પ્રક્રિયાને માન્ય ન રાખવાથી, ભવિષ્યના સમયમાં નાણાંકિય અહેવાલ પરના આંતરિક નાણાંકિય અંકુશના મુલ્યાંકનનાં પ્રક્ષેપણથી અપુરતા અંકુશના કારણોસર નાણાંકિય અહેવાલ અપૂરતો સાબીત થાય અથવા નીતિઓ તથા પ્રક્રિયાના સંદર્ભમાં કેટલેક અંશે અપર્યાપ્ત લાગે .

અભિપ્રાય :

અમારા અભિપ્રાય મુજબ ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ નાણાંકિય અહેવાલ પરની આંતરિક નાણાંકિય અંકુશ ચકાસવા ઓડિટર માટેની માર્ગદર્શક નોંધ પર આધારિત નાણાંકિય અહેવાલ પરની આંતરિક નાણાંકિય અંકુશ પદ્ધતિ કંપનીની મહત્વની બાબતે ૩૧ માર્ચ-૨૦૨૦ ના રોજ અસરકારક રીતે કાર્યરત છે.



ચાલુ બાબત પર ભાર

ચોકકસ વિસ્તારમાં “આંતરીક નાંણાકીય અંકુશ” પદ્ધતિમાં સુધારો જરૂરી છે. મહત્વના ખાતાઓ તેના અનુષાંગીક હિસાબી તદ્દતર અને સહાયક દફતરના આધારે સ્થાયી અસ્કયામતોના મહત્વના ખાતા નકકી કરી નાણાંકીય માહિતીની પ્રક્રિયામાં, ખાસ કરીને, માહિતીની એકત્રિકરણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે કંપનીએ તેની દરેક શાખાઓ માટે યોગ્ય હિસાબી પદ્ધતિ દાખલ કરવી જરૂરી છે. જો કે, અમે ઉપરની બાબતમાં અમારો અભિપ્રાય બદલતા નથી.

કિશન એમ. મહેતા એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ વતી
ફર્મ રજિ. નં. ૧૦૫૨૨૯ ડબલ્યુ

સહી/-
યુ. પી. ભાવસાર
ભાગીદાર

સ્થળ : અમદાવાદ
તા. ૩૦મી ડિસેમ્બર, ૨૦૨૦
યુડીઆઈએન નં. ૨૦૦૪૩૫૫૯એએએસીએસ૪૦૯૫

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગર
તારીખ ૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજનું સરવૈયું

(રૂ. લાખમાં)

વિગતો	નોંધ નં.	૩૧.૦૩.૨૦૨૦ ના રોજ	૩૧.૦૩.૨૦૧૯ ના રોજ
૧. ઈકવીટી અને જવાબદારીઓ			
(૧) શેર ધારકોનું ભંડોળ			
(ક) શેર મૂડી	૨	૧૫,૫૦૨.૦૧	૧૪,૯૬૦.૩૪
(ખ) અનામત અને વધારો	૩	૨,૦૪,૭૧૦.૧૫	૧૬૪,૯૩૭.૬૩
(૨) ફાળવણી બાકી શેર અરજીના નાણાં	૪	૦.૦૦	૫૪૧.૬૭
(૩) વિલંબિત અનુદાન	૫	૨૫૫,૯૫૨.૫૨	૨૫૩,૦૨૯.૭૮
(૪) બિન- આવર્તક જવાબદારીઓ			
(ક) લાંબાગાળાની ઉછીની લીધેલી લોન		૦.૦૦	૦.૦૦
(ખ) વિલંબિત કરની જવાબદારીઓ (ચોખ્ખી)		૨.૬૭	૦.૦૦
(ગ) લાંબાગાળાની જવાબદારીઓ	૬	૨૨,૫૨૩.૮૪	૨૧,૩૧૭.૨૬
(ઘ) લાંબા ગાળાની જોગવાઈઓ		૦.૦૦	૦.૦૦
(૫) ચાલુ જવાબદારીઓ			
(ક) ટૂંકા ગાળાની ઉછીની લીધેલ રકમ		૦.૦૦	૦.૦૦
(ખ) વેચારી ચૂકવણા	૭	૫,૪૦૬.૪૮	૩,૨૭૪.૧૦
(ગ) અન્ય ચાલુ જવાબદારીઓ	૮	૫,૪૬૨.૮૨	૨,૮૧૨.૪૩
(ઘ) ટૂંકા ગાળાની જોગવાઈઓ		૦.૦૦	૦.૦૦
કુલ		૫૦૯,૫૬૦.૪૯	૪૬૦,૮૭૩.૨૧
૨. અસ્કયામતો (મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો)			
(૧) બિન-ચાલુ અસ્કયામતો, પ્લાન્ટ તથા ઉપકરણો			
(ક) સ્થાયી અસ્કયામતો, પ્લાન્ટ તથા ઉપકરણો			
(૧) દ્રશ્ય અસ્કયામતો પ્લાન્ટ તથા ઉપકરણો	૯	૨૫૭,૭૯૨.૫૨	૨૫૪,૯૩૪.૫૯
(૨) અદ્રશ્ય અસ્કયામતો		૦.૦૦	૦.૦૦
(૩) પ્રગતિ હેઠળના મૂડી કામો		૨૬,૫૫૧.૬૬	૩૪,૪૮૦.૯૩
(ખ) બિન ચાલુ રોકાણો		૦.૦૦	૦.૦૦
(ગ) વિલંબિત કર અસ્કયામતો (ચોખ્ખી)		૦.૦૦	૧.૨૯
(ઘ) લાંબા ગાળાની લોન અને ધિરાણો	૧૦	૬,૪૯૮.૬૧	૬,૧૨૮.૨૩
(ચ) અન્ય બિન-ચાલુ અસ્કયામતો		૦.૦૦	૦.૦૦
(૨) ચાલુ અસ્કયામતો			
(ક) ચાલુ રોકાણો		૦.૦૦	૦.૦૦
(ખ) સાધન સામગ્રી		૦.૦૦	૦.૦૦
(ગ) વ્યાપારી મળવાપાત્ર રકમો	૧૧	૧૨૧,૬૫૪.૪૬	૧૧૭,૩૫૩.૪૦
(ઘ) રોકડ અને રોકડ સમાન મિલકતો	૧૨	૯૬,૦૨૯.૫૧	૪૩,૧૨૩.૦૨
(ચ) ટૂંકી મુદતની લોનો અને ધિરાણો	૧૩	૧૩૦.૯૨	૪,૫૩૦.૩૦
(છ) અન્ય ચાલુ મિલકતો (અસ્કયામતો)	૧૪	૯૦૨.૮૧	૩૧૧.૪૫
કુલ		૫૦૯,૫૬૦.૪૯	૪૬૦,૮૭૩.૨૧
મહત્વની હિસાબી નીતિઓ અને હિસાબમાં ભાગ બનતી નોંધો ૧ થી ૪૨			

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમિટેડના બોર્ડ માટે અને તેમના વતી.

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મયુર મહેતા, આઈએએસ
વહીવટી સંચાલક

જલદીપ. દવે
મુખ્ય જનરલ મેનેજર (નાણાં)

કિશન એમ. મહેતા એન્ડ કું

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ વતી

ફર્મ રજીસ્ટ્રેશન નં. ૧૦૫૨૨૯ ડબલ્યુ

નિરવ સોલંકી
નિયામક

(ઉમેશ ભાવસાર)

ભાગીદાર

સભ્યપદ નં. ૦૪૩૫૫૯

સ્થળ : અમદાવાદ

તારીખ : ૩૦.૧૨.૨૦૨૦

યુડીઆઈએન નં. ૨૦૦૪૩૫૫૯એએએસીએસ૪૦૯૫

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૩૦.૧૨.૨૦૨૦



ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગર
તારીખ ૩૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થતાં વર્ષનું નફા અને નુકસાનનું પત્રક

(રૂ. લાખમાં)

વિગતો	નોંધ નં.	૩૧.૦૩.૨૦૨૦ ના રોજ	૩૧.૦૩.૨૦૧૯ ના રોજ
૧. કામગીરીમાંથી આવક	૧૫	૪૫,૭૧૦.૬૦	૩૭,૪૧૨.૮૬
૨. અન્ય આવક	૧૬	૩૬,૫૮૮.૫૧	૩૩,૨૫૭.૫૮
૩. કુલ આવક (૧ + ૨)		૮૨,૨૯૯.૧૧	૭૦,૬૭૦.૪૪
૪. ખર્ચ			
માલ- સામગ્રીની કિંમત	૧૭	૨૪,૬૩૬.૫૬	૧૮,૦૮૨.૩૩
વીજળી ખર્ચ	૧૮	૩૫,૮૮૬.૨૩	૩૩,૪૫૧.૪૫
કર્મચારી માટેનો ખર્ચ	૧૯	૧,૪૨૮.૧૮	૧,૫૪૨.૬૭
ઘસારો અને માંડવાળ અંગેનો ખર્ચ	૨૦	૨૭,૭૬૪.૮૪	૨૫,૫૬૮.૮૨
અન્ય ખર્ચ	૨૦	૨,૭૬૩.૬૪	૨,૩૦૪.૫૫
કુલ ખર્ચ		૯૨,૪૮૦.૪૬	૮૦,૯૬૦.૮૩
૫. અપવાદરૂપ તથા અસાધારણ બાબતો અને ટેક્ષ પહેલા નફો/(નુકસાન)(III-IV)		-૧૦,૧૮૧.૩૬	-૧૦,૨૮૦.૩૮
૬. અપવાદરૂપ	૨૧	૫૧૭.૪૨	૨૧.૭૨
૭. નફો/નુકસાન અસાધારણ આઈટમ અને ટેક્ષ પહેલા (V-VI)		-૮,૬૭૩.૮૩	-૧૦,૨૬૮.૬૭
૮. અસાધારણ બાબતો		૦.૦૦	૦.૦૦
૯. કર પહેલાનો નફો/ (નુકસાન) (VII-VIII)		-૮,૬૭૩.૮૩	-૧૦,૨૬૮.૬૭
૧૦. કરને લગતો ખર્ચ			
૧. ચાલુ વર્ષનો કર			
૨. વિલંબિત કર		-૩.૮૬	-૨.૮૩
૧૧. કામગીરી ચાલુ કરી તે સમયથી નફો/(નુકસાન) (XI+X)		-૮,૬૭૭.૮૦	-૧૦,૨૭૧.૬૦
૧૨. ચાલુ વર્ષનો નફો/(નુકસાન)		-૮,૬૭૭.૮૦	-૧૦,૨૭૧.૬૦
શેર દીઠ કમાણી (૧) મૂળ અને મંદિત		-૬.૪૩	-૬.૮૭
મહત્વની હિસાબી નીતિઓ અને હિસાબમાં ભાગ બનતી નોંધો ૧ થી ૪૩			

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમિટેડના બોર્ડ માટે અને તેમના વતી.

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મયુર મહેતા, આઈએએસ
વહીવટી સંચાલક

જલદીપ. દવે
મુખ્ય જનરલ મેનેજર (નાણાં)

કિશન એમ. મહેતા એન્ડ કું
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી
ફર્મ રજીસ્ટ્રેશન નં. ૧૦૫૨૨૮ ડબલ્યુ

નિરવ સોલંકી
નિયામક

(ઉમેશ ભાવસાર)
ભાગીદાર
સભ્યપદ નં. ૦૪૩૫૫૮
સ્થળ : અમદાવાદ
તારીખ : ૩૦.૧૨.૨૦૨૦
યુડીઆઈએન નં. ૨૦૦૪૩૫૫૮એએએસીએસ૪૦૮૫

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૩૦.૧૨.૨૦૨૦

તારીખ ૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજના નાણાકીય પત્રકોનો ભાગ બનતી નોંધો

(રૂ. લાખમાં)

વિગતો	૩૧.૦૩.૨૦૨૦ ના રોજ	૩૧.૦૩.૨૦૧૯ ના રોજ
નોંધ : ૨		
શેરમૂડી		
અધિકૃત		
ઈકવિટી શેર મૂડી ૧૭,૫૦,૦૦,૦૦૦ (૧૫,૦૦,૦૦,૦૦૦ દરેક શેક રૂ. ૧૦/- શેર બહાર પાડેલી, ભરણું થયેલી અને ભરપાઈ થયેલી	૧૭,૫૦૦.૦૦	૧૫,૦૦૦.૦૦
ઈકવિટી શેર મૂડી		
૧૫૫૦૨૦૦૭૦ (૧૪૯૬૦૩૩૭૦) રૂ. ૧૦/- ના એક એવા ઈકવિટી શેર	૧૫,૫૦૨.૦૧	૧૪,૯૬૦.૩૪
કુલ	૧૫,૫૦૨.૦૧	૧૪,૯૬૦.૩૪

(અ) અહેવાલ હેઠળના વર્ષની શરૂઆતમાં તથા વર્ષના અંતે શેરની સંખ્યા તથા શેરની રકમનું મેળવણું

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ		૩૧મી માર્ચ ૨૦૧૯ ના રોજ	
	સંખ્યા	રૂ.	સંખ્યા	રૂ.
વર્ષની શરૂઆતની સિલક	૧૪,૯૬,૦૩,૩૭૦	૧,૪૯,૬૦,૩૩,૭૦૦	૧૪,૯૬,૦૩,૩૭૦	૧,૪૯,૬૦,૩૩,૭૦૦
ઉમેરો : વર્ષ દરમ્યાન બહાર પાડેલા શેર	૫૪,૧૬,૭૦૦	૫,૪૧,૬૭,૦૦૦		
બાદ : વર્ષ દરમ્યાન ખરીદ કરેલા શેર				
વર્ષના અંતે સિલક	૧૫૫,૦૨૦,૦૭૦	૧,૫૫,૦૨,૦૦,૭૦૦	૧૪,૯૬,૦૩,૩૭૦	૧,૪૯,૬૦,૩૩,૭૦૦

(બ) કંપનીના ૫% શેર કરતા વધુ શેર ધરાવતા શેરધારકોની વિગતો

શેર ધારકનું નામ	૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ		૩૧મી માર્ચ ૨૦૧૯ ના રોજ	
	ધારકના હિસ્સાની ટકાવારી	શેરની સંખ્યા	ધારકના હિસ્સાની ટકાવારી	શેરની સંખ્યા
ગુજરાત સરકાર	૯૯.૯૯	૧૫,૫૦,૨૦,૦૬૩	૯૯.૯૯	૧૪,૯૬,૦૩,૩૬૩
શેરની સંખ્યાનું મેળવણું નીચે નિર્દિષ્ટ કર્યું છે.				

(ક) ઈકવિટી શેરે સાથે સંકળાયેલ શરતો અને અધિકારો:

કંપનીના રૂપિયા ૧૦/- પ્રતિ શેરની કિંમત ધરાવતા એકજ પ્રકારના શેર છે. દરેક શેર ધારકોને પ્રતિ શેર એક મત આપવાનો અધિકાર છે.

નોંધ : ૩ અનામતો અને પુરાંત	૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ		૩૧મી માર્ચ ૨૦૧૯ ના રોજ	
	સંખ્યા	રૂ.	સંખ્યા	રૂ.
ગુજરાત સરકાર પાસેથી મળેલ અનુદાન				
છેલ્લા સરવૈયા મુજબ	૧૩૮,૬૩૪.૪૯		૧૩૬,૮૮૦.૨૫	
ઉમેરો : વર્ષ દરમ્યાન મળેલ અનુદાન	૯૪,૩૦૪.૦૦		૬૯,૩૦૦.૦૦	
બાદ : વિલંબિત અનુદાન ખાતે તબદિલી	૨૩૨,૯૩૮.૪૯		૨૦૬,૧૮૦.૨૫	
ગુજરાત સરકાર પાસેથી મળેલ અનુદાન	૨૯,૬૩૯.૩૧	૨૦૩,૨૯૯.૧૮	૬૭,૫૪૫.૭૬	૧૩૮,૬૩૪.૪૯
(ક્ષાર નિવારણ એકમ માટે)				
છેલ્લા સરવૈયા મુજબ	૦.૦૦		૦.૦૦	
ઉમેરો : વર્ષ દરમ્યાન મળેલ અનુદાન	૬,૬૦૦.૦૦		૦.૦૦	
બાદ : વિલંબિત અનુદાન ખાતે તબદિલી	૬,૬૦૦.૦૦		૦.૦૦	
	૦.૦૦	૬,૬૦૦.૦૦	૦.૦૦	૦.૦૦



(રૂા. લાખમાં)

વિગતો		૩૧.૦૩.૨૦૨૦ ના રોજ પુરા થતા વર્ષ માટે રૂા.		૩૧.૦૩.૨૦૧૯ ના રોજ પુરા થતા વર્ષ માટે રૂા.
કેન્દ્રનું ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ મારફત મળેલ અનુદાન છેલ્લા સરવૈયા મુજબ				
	૧૦,૪૦૬.૫૪		૧૦,૪૦૬.૫૪	
ઉમેરો : વર્ષ દરમ્યાન મળેલ અનુદાન	૧૦,૪૦૬.૫૪		૧૦,૪૦૬.૫૪	
બાદ : વિલંબિત અનુદાન ખાતે તબદિલી	૮,૪૫૫.૦૦		૦.૦૦	
	૧,૯૫૧.૫૪	૧૭,૨૦૧.૯૭	૦.૦૦	૧૦,૪૦૬.૫૪
ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ મારફત રાજ્ય તરફથી મળેલ અનુદાન છેલ્લા સરવૈયા મુજબ	૬૮,૮૮૨.૭૧		૬૮,૮૮૨.૭૧	
બાદ : પાણીની ખરીદી સામે સમાયોજન	૨૮,૬૦૮.૭૦	૪૦,૩૮૩.૦૧	૦.૦૦	૬૮,૮૮૨.૭૧
નફા-નુકસાન ખાતુ છેલ્લા સરવૈયા મુજબ	-૫૩,૦૮૬.૧૧		-૪૨,૮૨૪.૫૨	
ઉમેરો : નફા-નુકસાન ખાતે લઈ ગયા	-૮,૬૬૭.૮૦	-૬૨,૭૭૪.૦૧	-૧૦,૨૭૧.૬૦	-૫૩,૦૮૬.૧૧
કુલ		૨૦૪,૭૧૦.૧૫		૧૬૪,૮૩૭.૬૪
નોંધ : ૪ શેર અરજી નાણાં શેર અરજી ના નાણાં (ફાળવણી બાકી)	૫૪૧.૬૭		૫૪૧.૬૭	
બાદ : ઈકવીટી શેર મુડી ખાતે તબદિલી રકમ	૫૪૧.૬૭	૦.૦૦	૦.૦૦	૫૪૧.૬૭
કુલ		૦.૦૦		૫૪૧.૬૭
નોંધ : ૫ વિલંબિત અનુદાન છેલ્લા સરવૈયા મુજબ	૨૫૩,૦૨૮.૭૮		૨૨૭,૪૬૨.૫૩	
ઉમેરો : અનામતો અને પુરાંતના સદરેથી તબદિલી કરેલ				
ગુજરાત સરકાર તરફથી મળેલ અનુદાનો	૨૮,૬૩૮.૩૧		૬૭,૫૪૫.૭૫	
ઉમેરો : અનામતો અને પુરાંતના સદરેથી તબદિલી કરેલ				
ગુજરાત સરકાર તરફથી મળેલ અનુદાનો	૧,૯૫૮.૫૭		૦૦.૦૦	
	૨૮૪,૬૨૫.૬૬		૨૮૫,૦૦૮.૨૮	
બાદ : અગાઉનાં સમયના વિલંબિત અનુદાન ખાતે લઈ ગયાં (નફા નુકસાનના પત્રકમાં દર્શાવેલ છે.)	૬૮૫.૮૪		૧૬,૫૦૦.૫૩	
બાદ : અનુદાનમાંથી મેળવેલ સ્થાયી અસ્કયામતોના ધસારા જેટલું વિલંબિત અનુદાન નફા નુકસાન પત્રક ખાતે તબદિલી	૨૭,૬૮૦.૨૮	૨૫૫,૯૫૨.૫૩	૨૫,૪૭૭.૮૮	૨૫૩,૦૨૮.૭૮
નોંધ : ૬ (ગ) અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ સિક્યોરીટી ડીપોઝીટ		૮,૫૮૩.૧૬		૮,૮૨૭.૬૩
કામની અનામતો		૬૪૨.૦૮		૮૪૧.૬૪
પાણીના વેચાણ સામે અનામતો		૧૩,૨૮૮.૫૮		૧૦,૬૪૭.૮૮
કુલ		૨૨,૫૨૩.૮૪		૨૧,૩૧૭.૨૬

(રૂ. લાખમાં)

વિગતો		૩૧.૦૩.૨૦૨૦ ના મુજબ		૩૧.૦૩.૨૦૧૯ ના મુજબ
નોંધ: ૭				
ચુકવવા પાત્ર વેપારી ચુકવણા		૦.૦૦		૦.૦૦
સૂક્ષ્મ અને નાના ઉપક્રમો		૫,૪૦૬.૪૮		૩,૨૭૪.૧૦
અન્ય				
	કુલ	૫,૪૦૬.૪૮		૩,૨૭૪.૧૦
<p>નોંધ : સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉપક્રમ વિકાસ ધારો ૨૦૦૬ સક્ષમ, નાના અને મધ્યમ ઉપક્રમોના સંદર્ભમાં કેટલીક વિગતો જાહેર કરવી જરૂરી છે. આ કાયદાના સંદર્ભમાં સપ્લાય પાસેથી તેઓ કાયદા હેઠળ આવરી લેવાતા હોય તો તે બાબતે કંપની દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે. સંબંધિત માહિતી ઉપલબ્ધ ન હોઈ હિસાબોમાં કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઓડિટર માહિતી ઉપર આધારિત છે.</p>				
નોંધ: ૮				
અન્ય ચાલુ જવાબદારીઓ				
વેધાનિક જવાબદારી				
શુલ્ક અને કરવેરા		૧૫૫.૬૬		૧૩૪.૬૩
શ્રમ ઉપકર		૫૭.૮૮		૨૧૧.૩૫
અન્ય જવાબદારીઓ				
અન્ય જવાબદારીઓ		૨,૨૩૨.૬૮		૧,૬૨૪.૨૬
સીડબલ્યુઆઈપી તથા સ્થાયી અસ્કયામતોના લેણદારો		૭૫૨.૬૮		૫૧૨.૫૫
ગાંધા પાણીના નિકાલ માટેની પરિયોજના (જી.પી.સી.બી)				
માટે મળેલ મૂડી ખર્ચ માટેનો ફાળો		૨,૨૧૮.૦૦		૦.૦૦
પરિયોજના કચેરીને ધિરાણ (જુઓ નં. ૨૮)		૦.૦૦		૨૮૮.૩૮
ચુકવવા પાત્ર પાક વળતર		૪૫.૮૦		૪૧.૨૬
	કુલ	૫,૪૬૨.૮૨		૨,૮૧૨.૪૩

અસ્કયામતોની વિગત	કુલ ઘટક					ધસારો					ચોખ્ખો ઘટક	
	૧-૪-૨૦૧૯ ના રોજ મુજબ સિલક	વર્ષ દરમિયાન ઉમેરો	મૂડી એડવાન્સ ખાતેથી તબદીલી	તબદીલ શ્લેલ રકમ	૩૧-૩-૨૦૨૦ ના રોજ સિલક	૩૧-૩-૨૦૧૯ સુધી જોગવાઈ કરેલ	અગાઉના વર્ષનો ધસારો	વર્ષ દરમિયાન કરેલ જોગવાઈ	૩૧-૩-૨૦૨૦ સુધીનું કુંલ	૩૧-૩-૨૦૨૦	૩૧-૩-૨૦૧૯	
અનુદાન માંથી અસ્કયામતો												
જમીન	૨૩૦૭.૧૯	૧૫૦.૪૪	૦.૦૦	૦.૦૦	૨૪૫૭.૬૩	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૨૪૫૭.૬૩	૨૩૦૭.૧૯	
મકાનો	૮૪૨૯.૮૬	૫૬૭.૮૬	૦.૦૦	૧૫.૪૫	૯૦૫૩.૧૭	૩૯૪૭.૩૩	૦.૦૦	૪૯૭.૮૦	૪૪૪૫.૧૩	૪૫૩૭.૧૪	૪૪૮૨.૧૩	
વીજળી સ્થાપના	૬૪૧૪.૭૫	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૬૪૧૪.૭૫	૪૮૧૨.૦૮	૦.૦૦	૩૪૩.૨૮	૫૧૫૫.૩૬	૧૨૫૯.૩૯	૧૬૦૨.૬૭	
પ્લાન્ટ અને યંત્ર સામગ્રી	૨૨૦૪૩.૦૫	૬૬૪૫.૦૨	૦.૦૦	૦.૦૦	૨૮૬૮૮.૦૭	૧૪૪૮૮.૦૫	૫૪૮.૮૦	૨૪૭૫.૭૬	૧૭૫૧૨.૬૧	૧૧૧૭૫.૪૬	૭૫૫૪.૯૯	
પાઈપ લાઈન	૪૩૪૫૩૦.૭૯	૨૩૭૩૫.૨૪	૨૧૫.૭૭	૦.૦૦	૪૫૮૪૮૧.૮૦	૧૯૬૭૭૯.૭૦	૧૩૭.૦૫	૨૪૩૭૧.૩૦	૨૨૧૨૮૮.૦૫	૨૩૭૧૯૩.૭૫	૭૫૫૪.૯૯	
ફર્નિચર અને જડાણ	૧૭.૯૧	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૭.૯૧	૧૭.૦૨	૦.૦૦	૦.૦૦	૧૭.૦૨	૦.૯૦	૦.૯૦	
કચેરી સાધનસામગ્રી	૩૮.૫૬	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૩૮.૫૬	૩૬.૪૪	૦.૦૦	૦.૧૩	૩૬.૫૭	૧.૯૯	૨.૧૨	
વાહનો	૨૬.૪૫	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૨૬.૪૫	૧૫.૭૩	૦.૦૦	૨.૦૩	૧૭.૭૬	૮.૯૬	૧૦.૭૨	
સરવાળો	૪૭૩૮૦૮.૫૫	૩૧૦૯૮.૫૬	૨૧૫.૭૭	૧૫.૪૫	૫૦૫૧૦૭.૪૩	૨૨૦૦૯૬.૩૫	૬૮૫.૮૪	૨૭૬૯૦.૨૯	૨૪૮૪૭૨.૪૯	૨૫૬૬૩૪.૯૪	૨૫૩૭૧.૨૦	
સ્વ-મંડોળની અસ્કયામતો												
જમીન	૫૧૧.૧૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૫૧૧.૧૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૫૧૧.૧૦	૫૧૧.૧૦	
મકાનો	૧૪૫.૬૩	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૪૫.૬૩	૯૩.૫૦	૦.૦૦	૬.૦૯	૯૯.૫૯	૪૬.૦૫	૫૨.૧૪	
પ્લાન્ટ અને યંત્ર સામગ્રી	૫૧૨.૨૩	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૫૧૨.૨૩	૪૫૬.૧૧	૦.૦૦	૮.૫૧	૪૬૫.૬૧	૪૬.૬૦	૫૬.૧૧	
પાઈપલાઈન	૩૫૩૧.૭૦	૦.૦૦	૦.૪૧	૦.૦૦	૩૫૩૨.૧૨	૨૯૮૫.૩૩	૦.૨૮	૪૫.૬૧	૩૦૩૧.૨૨	૫૦૦.૯૦	૫૪૬.૩૭	
ફર્નિચર અને જડાણ	૩૬.૮૧	૩.૧૦	૦.૦૦	૦.૦૦	૩૯.૯૧	૨૮.૧૬	૦.૦૦	૨.૭૨	૩૦.૮૮	૮.૬૪	૮.૬૪	
કચેરી સાધનસામગ્રી	૩૪.૪૮	૨.૧૭	૦.૦૦	૦.૦૦	૩૬.૬૬	૨૮.૬૭	૦.૦૦	૧.૯૯	૩૦.૫૬	૬.૧૦	૫.૮૨	
વાહનો	૧૪૨.૩૫	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૪૨.૩૫	૧૧૬.૦૦	૦.૦૦	૬.૧૫	૧૨૨.૧૪	૨૦.૨૦	૨૬.૩૫	
ગ્રંથાલય પુસ્તક	૪.૭૪	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૪.૭૪	૪.૭૪	૦.૦૦	૦.૦૦	૪.૭૪	૦.૦૦	૦.૦૦	
કમ્પ્યુટર	૫૧.૨૧	૧.૨૧	૦.૦૦	૦.૦૦	૫૨.૪૨	૪૫.૨૯	૦.૦૦	૨.૫૫	૪૭.૮૩	૪.૫૯	૫.૯૨	
વીજળી સ્થાપના	૨૦૫.૫૫	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૨૦૫.૫૫	૧૯૫.૬૧	-૩.૧૨	૦.૦૪	૧૯૨.૫૩	૧૩.૦૨	૯.૯૩	
સરવાળો	૫૧૭૫.૮૦	૬.૪૮	૦.૪૧	૦.૦૦	૫૧૮૨.૬૯	૩૯૫૩.૪૧	-૨.૮૫	૭૪.૫૫	૪૦૨૫.૧૨	૧૧૫૭.૬૮	૧૨૨૨.૩૮	
એકંદર સરવાળો	૪૭૯૯૮૪.૩૫	૩૧૦૫૦.૦૪	૨૧૬.૧૯	૧૫.૪૫	૫૧૦૨૯૦.૧૨	૨૨૪૦૪૯.૭૭	૬૮૩.૦૦	૨૭૬૬૪.૮૪	૨૫૨૪૯૭.૬૦	૨૫૭૭૯૨.૫૨	૨૫૪૯૩૪.૫૮	
પ્રગતિ હેઠળના મૂડીકામો												
સરવાળો												

(રૂ. લાખમાં)

વિગતો		૩૧.૦૩.૨૦૨૦ના મુજબ		૩૧.૦૩.૨૦૧૯ના મુજબ
<p><u>નોંધ: ૧૦</u> લાંબા ગાળાની લોન તથા ધિરાણો (અન્ય રીતે સુચવવામાં આવેલ ન હોઈ બીન તારણવાળી લોન ખરેખર (મળવાપાત્ર ગણવામાં આવી છે.) ૧) રોકડ, વસ્તુ કે મૂલ્યરૂપે વસુલી શકાય તેવા ધિરાણો ૨) મૂડી ગત ધિરાણો ૩) પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલની સીક્યોરીટી ડિપોઝીટ ૩) મળવાપાત્ર ચોખ્ખી એમએટી કેડિટ</p> <p style="text-align: right;">સરવાળો</p>		૩૪.૪૬ ૩૮૬.૨૪ ૬,૦૪૯.૭૫ ૨૮.૧૬ ૬,૪૯૮.૬૧		૩૪.૪૬ ૬૦૭.૧૬ ૫,૪૫૮.૪૫ ૨૮.૧૬ ૬,૧૨૮.૨૩
<p><u>નોંધ: ૧૧</u> મળવા પાત્ર વ્યાપારી લેણા (જુઓ નોંધ-૨૮) ચુકવણા પાત્ર તારીખથી ૬ માસથી વધુ સમયથી બાકી બિન તારણવાળી તથા ચુકવવા પાત્ર રકમ શંકાસ્પદ બાદ શંકાસ્પદ દેવા માટે જોગવાઈ અન્ય લેણા (બિન તારણવાળા તથા મળવાપાત્ર ગણેલ)</p> <p style="text-align: right;">કુલ</p>	૧૦૨,૮૦૦.૬૨ ૧૮૮.૦૩ ૧૦૩,૦૮૮.૬૬ -૧૮૮.૦૩	૧૦૨,૮૦૦.૬૨	૭૬,૭૦૧.૨૨ ૩૦૮.૦૫ ૭૭,૦૧૦.૨૭ -૩૦૮.૦૫	૭૬,૭૦૧.૨૨ ૪૦,૬૫૨.૧૭ ૧૧૭,૩૫૩.૪૦
<p><u>નોંધ: ૧૨</u> રોકડ અને રોકડ સમકક્ષ (૧) હાથ પર રોકડ (૨) અનુસુચિત બેંકની ચાલુ ખાતાની સિલકો (૩) જીએસએફએસમાં ત્રણ માસથી વધુ સમયની ઈન્ટર કોર્પોરેટ ડિપોઝીટ (૪) બેંકમાં ૧ વર્ષ વધુની થાપણો (માર્જગ મની સામે)</p> <p style="text-align: right;">કુલ</p>		૦.૨૪ ૧૯,૦૪૫.૪૫ ૭૬૮૩૭.૩૮ ૪૬.૪૪ ૯૬,૦૨૯.૫૧		૦.૪૪ ૩૨,૨૪૯.૯૨ ૧૦૮૨૮.૪૬ ૪૪.૧૯ ૪૩,૧૨૩.૦૨
<p><u>નોંધ: ૧૩</u> ટુંકા ગાળાની લોન અને ધિરાણો (ચાલુ) (અન્યથા સુચવેલ હોય તે સિવાય બીન તારણવાળી લોન મળવાપાત્ર ગણેલ છે.) (૧) કર્મચારીઓને પેશગી (૨) પ્રોજેક્ટ કચેરીઓને પેશગી (જુઓ નોંધ-૨૮) (૩) અન્ય મળવા પાત્ર ટી.ડી.એસ. મળવાપાત્ર અનુદાન (૨૦૧૮-૧૯) મોબીલાઈઝેશન એડવાન્સ (ક્ષાર નિવારણ પ્રાયોજના) અગાઉથી ચુકવે ખર્ચ</p> <p style="text-align: right;">કુલ</p>		૦.૦૦ ૦.૩૫ ૫૪.૬૦ ૦.૦૦ ૭૩.૭૩ ૨.૨૪ ૧૩૦.૯૨		૦.૦૨ ૦૦.૦૦ ૬૦.૪૪ ૪૩૧૭.૫૦ ૧૫૦.૦૦ ૨.૩૬ ૪,૫૩૦.૩૦



(રૂ. લાખમાં)

વિગતો		૩૧.૦૩.૨૦૨૦ના મુજબ		૩૧.૦૩.૨૦૧૯ના મુજબ
નોંધ: ૧૪ અન્ય ચાલુ અસ્કયામતો વ્યાજ જમા થયેલ છે પરંતુ મળેલ નથી.				
		૯૦૨.૮૧		૩૧૧.૪૫
કુલ		૯૦૨.૮૧		૩૧૧.૪૫
નોંધ: ૧૫ કામગીરીમાંથી થયેલ આવક જીડબલ્યુએસએસબીને પાણીના વેચાણની આવક અન્યને પાણીના વેચાણની આવક	૨૦,૬૯૦.૪૪ ૨૫,૦૨૦.૧૭	૪૫,૭૧૦.૬૦	૨૦,૮૩૦.૫૩ ૧૬,૫૮૨.૩૩	૩૭,૪૧૨.૮૬
કુલ		૪૫,૭૧૦.૬૦		૩૭,૪૧૨.૮૬
નોંધ: ૧૬ અન્ય આવક અ વિલંબિત અનુદાનની આવક (નોંધ ૨૪) બ અન્ય આવક (૧) ટેન્ડર ફી ની આવક (૨) વિલંબિત ચુકવણી ચાર્જ (૩) બેંકનું વ્યાજ (૪) અન્ય વ્યાજ (૫) મળેલ ભાડું (૬) ગુ.રા. પાસેથી મળેલી મહેસુલી અનુદાન (૭) પરચુરણ આવકો	૧૦.૧૯ ૭,૯૧૫.૯૮ ૪૯૪.૦૪ ૩૪૪.૩૨ ૭.૫૬ ૧૦૦.૦૦ ૨૬.૧૩	૨૭૬૯૦.૨૯	૧૫.૮૬ ૬,૭૩૩.૩૨ ૩૩૫.૩૯ ૩૦૦.૯૧ ૯.૪૧ ૩૭૫.૦૦ ૯.૭૧	૨૫૪૭૭.૯૮
કુલ		૨૭,૬૯૦.૨૯		૨૫,૪૭૭.૯૮
નોંધ: ૧૭ સામગ્રીને લગતો ખર્ચ પાણીની ખરીદી				
		૨૪,૬૩૬.૫૬		૧૮,૦૯૨.૩૩
કુલ		૨૪,૬૩૬.૫૬		૧૮,૦૯૨.૩૩
નોંધ: ૧૮ વિજળી ખર્ચ વિજળી ખર્ચ				
		૩૫,૮૯૬.૨૩		૩૩,૪૫૧.૪૫
કુલ		૩૫,૮૯૬.૨૩		૩૩,૪૫૧.૪૫
નોંધ: ૧૯ કર્મચારીઓ માટેની ચુકવણીઓ પગાર તથા અન્ય ચુકવણીઓ કર્મચારી કલ્યાણ ખર્ચ ભ.નિ. તથા અન્ય નિધિઓમાં ફાળો	૧,૪૦૦.૯૫ ૦.૫૯ ૨૭.૬૫	૧,૪૨૯.૧૯	૧,૫૦૫.૫૬ ૫.૫૯ ૩૧.૫૨	૧૫૪૨.૬૭
કુલ		૧,૪૨૯.૧૯		૧,૫૪૨.૬૭

વિગતો		૩૧.૦૩.૨૦૨૦ના મુજબ		૩૧.૦૩.૨૦૧૯ના મુજબ
નોંધ: ૨૦				
અન્ય ખર્ચ				
ભાડું		૪.૮૮		૩.૩૮
છપામણી અને લેખન સામગ્રી		૧૭.૬૭		૧૮.૨૩
જાહેરાત ખર્ચ		૬.૭૫		૮.૮૧
ટપાલ, તાર તથા ટેલીફોન ખર્ચ		૮.૨૩		૧૦.૮૬
વીજળી તથા પાણીનો વેરો/ચાર્જ		૭.૪૩		૪.૮૩
બેન્ક ચાર્જીસ		૦.૧૦		૦.૧૫
વીમો		૩.૬૧		૩.૭૫
મુસાફરી તથા હેરફેર ખર્ચ		૭૦.૧૫		૮૦.૨૦
વાહનો ખર્ચ		૩૭.૨૬		૫૪.૨૦
જીએસટી ખર્ચ		૬.૬૩		૧૦.૬૩
મરામત અને નિભાવ				
મકાનની મરામત	૧.૩૮		૦.૫૨	
કમ્પ્યુટરની મરામત	૨.૧૭		૨.૦૪	
કચેરી સાધન સામગ્રીની મરામત	૦.૮૪		૦.૫૫	
વાહનોની મરામત અને નિભાવણી	૧૫.૭૭		૨૫.૦૮	
અન્ય મરામત	૩.૮૮	૨૪.૦૫	૧.૪૫	૨૮.૬૪
ઓપરેશન અને મેન્ટેનન્સ ખર્ચ		૧,૮૦૫.૩૬		૧,૩૨૭.૩૫
સલામતી ખર્ચ (ટાસ્ક ફોર્સ)		૭૧૧.૨૦		૬૨૮.૩૪
અધિકૃત મૂડી વધારવાની ફી		૨૫.૬૧		૦.૦૦
ઓડિટોરનું મહેનતાણું				
વૈધાનિક ઓડીટ ફી		૧.૭૭		૧.૪૧
ખિસ્સા બહારનાં ખર્ચ		૦.૧૦		૦.૧૧
કાયદા વિષયક અને વ્યવસાયિક ખર્ચ		૬૬.૨૪		૨૩.૦૭
પ્રકીર્ણ ખર્ચ		૭૭.૫૦		૮૭.૩૮
શંકમંદ દેવા માટેની જોગવાઈ		-૧૧૧.૦૧		૦.૦૦
		૨,૭૬૩.૬૪		૨,૩૦૪.૫૫
કુલ				
નોંધ: ૨૧				
અપવાદરૂપ બાબતો				
અગાઉના સમાયોજનો (જુઓ નોંધ-૩૮)				
પૂર્વ-મુદતની વિલંબિત અનુદાનની આવક		૬૮૫.૮૪		૧૬,૫૦૦.૫૩
પૂર્વ-મુદતનો આવક ખાતુ				૫૧.૬૩
પૂર્વ-મુદતનો વિલંબિત ચુકણીનો ચાર્જ		૦.૦૦		૪૩૮.૪૮
પૂર્વ-મુદતનો વિજળીને લગતો ખર્ચ		૬૮૭.૮૦		૦.૦
પૂર્વ-મુદતની વ્યાજની આવક		૨.૭૪		૩૪.૩૭
પૂર્વ મુદત વ્યાજ સમાયોજન	૦.૦૧		૦.૦૧	
પૂર્વ મુદતના ખર્ચ	૨૫.૫૬		૮૮.૨૭	
પૂર્વ મુદતના સિકયોરીટી ટાસ્કફોર્સ ખર્ચ	૪૧૬.૨૩			
પૂર્વ મુદતના જી.એસ.ટી ખર્ચ (૨૦૧૮-૧૯)		૧૫.૪૨		
પૂર્વ-મુદતના ખર્ચ (૨૦૧૭-૧૮)			૪૧૬.૮૫	
પૂર્વ-મુદતના વેચાણ (૨૦૧૨-૧૩)				
પૂર્વ-મુદતના વેચાણ (૨૦૧૪-૧૫)	૨૮.૪૩			
પૂર્વ-મુદતના વેચાણ (૨૦૧૫-૧૬)	૮.૨૧			
પૂર્વ-મુદતના વેચાણ (૨૦૧૬-૧૭)	૦.૮૬			૦.૧૨
પૂર્વ-મુદતના વેચાણ (૨૦૧૮-૧૯)		૨૧૫.૭૦		
પૂર્વ મુદતનો ધસારો (સરકારી અનુ.ની મિલકતો ઉપર)	૬૮૫.૮૪		૧૬,૫૦૦.૫૨	
પૂર્વ-મુદતનો ધસારો (સ્વબંડોળની મિલકતો ઉપર)		૨.૮૫		૨.૨૪
પૂર્વ-મુદતનો ઓ એન્ડ એમ ખર્ચ		૭૪.૨૧		
	૧,૧૬૭.૧૪	૧,૬૮૪.૫૬	૧૭,૦૦૫.૬૫	૧૭,૦૨૭.૩૭
કુલ		૫૧૭.૪૨		૨૧.૭૨



૩૧ મી માર્ચ ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રોકડ પ્રવાહ પત્રક

(રૂ. લાખમાં)

	વિગતો	૩૧ માર્ચ ૨૦૨૦ ના રોજ પૂરા થયેલ વર્ષ માટે	૩૧ માર્ચ ૨૦૧૯ ના રોજ પૂરા થયેલ વર્ષ માટે
ક.	કંપનીની પ્રવૃત્તિઓમાંથી મળતો રોકડ પ્રવાહ કર તથા અસાધારણ બાબતો પહેલાનો ચોખ્ખો નફો નીચેના માટે સમાયોજન : ઉમેરો : ઘસારો (અગાઉ)નાં સમયનો ઘસારા સાથે) ઉમેરો : જોગવાઈ/માંડવાળની રકમ બાદ : વિલંબિત અનુદાન બાદ : મહેસુલી અનુદાન બાદ : વ્યાજનું ખર્ચ બાદ : મેળવેલ વ્યાજ બાદ : પૂર્વ/અગાઉના સમયના આવક વેરાનો ખર્ચ બાદ- બિન : ચાલુ જવાબદારીઓમાં વધારો-ઘટાડો બાદ : લાંબા ગાળાની લોન અને ધિરાણોમાં વધારો	-૯૬૭૩.૯૩ ૨૮૪૪૭.૮૪ ૦.૦૦ -૨૮૩૭૬.૧૪ ૦.૦૦ ૦.૦૦ -૮૩૮.૩૬ ૦.૦૦ ૧૨૦૬.૫૯ -૩૭૦.૩૮	-૧૦૨૬૮.૬૭ ૪૨૦૭૦.૩૫ ૦.૦૦ -૪૧૯૭૮.૫૧ ૦.૦૦ ૦.૦૦ -૬૩૬.૩૦ ૦.૦૦ ૨૦૭૦.૧૫ -૨૬૪.૧૪
	કાર્યકારી મૂડીના ચાર્જ પહેલાનો કંપનીની પ્રવૃત્તિઓમાંથી મળતો નફો નીચેના માટે સમાયોજન ચાલુ મિલકતમાં વધારો/ઘટાડો ચાલુ જવાબદારીઓમાં વધારો/ઘટાડા મૂડી અનુદાનની આવક પાણી પુરવઠા સામે સરભર કરવામાં આવેલું અનુદાન ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ ને પરત કરેલ અનુદાન કંપનીની પ્રવૃત્તિઓમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ	-૯૬૦૪.૩૮ -૪૯૩.૩૮ ૪૭૮૨.૭૭ ૧૦૯૩૫૯.૦૦ -૨૮૬૦૯.૭૦ ૦.૦૦ ૭૫૪૩૪.૬૪	-૯૦૦૭.૧૨ -૪૬૬૫.૩૨ -૧૨૪૬.૭૦ ૬૯૩૦૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૫૪૩૮૦.૮૬
ખ.	મૂડી-રોકાણ પ્રવૃત્તિઓમાંથી મળતો રોકડ-પ્રવાહ લાંબા ગાળાની લોનમાં ઘટાડો/વધારો પ્રગતિ હેઠળના મુડી કામો સ્થાયી અસ્ક્યામતોની ખરીદી મળેલ વ્યાજ રોકાણની પ્રવૃત્તિઓમાંથી મેળવેલ ચોખ્ખો રોકડ પ્રવાહ	૦ ૭૯૩૯.૨૭ -૩૧૩૦૫.૭૭ ૮૩૮.૩૬ -૨૨૫૨૮.૧૪	૦ ૪૫૧૭૦.૦૫ -૬૭૫૬૧.૩૫ ૬૩૬.૨૯ -૨૧૭૫૫.૦૦
ગ.	નાણાંકીય- ધિરાણની પ્રવૃત્તિઓમાંથી મળતો રોકડ-પ્રવાહ તારણવાળી તથા બીન તારણવાળી મેળવેલ લોન (બિન-ચાલુ જવાબદારીઓ) તારણવાળી અને બીન તારણવાળી લોનની પરત ચૂકવણી વર્ષ દરમ્યાન ચૂકવેલ વ્યાજનો ખર્ચ શેરમૂડ/અરજી મેળવેલ નાણાં	૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦	૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦
	નાણાંકીય- ધિરાણની પ્રવૃત્તિઓમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ રોકડ અને રોકડ સમકક્ષ બાબતોમાં ચોખ્ખો ફેરફાર (ક+ખ+ગ)	૦.૦૦ ૫૨૯૦૬.૫૦	૦.૦૦ ૩૨૬૨૫.૮૬
	રોકડ અને રોકડ સમકક્ષની ઉઘડતી સિલક રોકડ અને રોકડ સમકક્ષની બંધ સિલક રોકડ અને રોકડ સમકક્ષમાં વધારો/ઘટાડો	૪૩૧૨૩.૦૨ ૯૬૦૨૯.૫૨ ૫૨૯૦૬.૫૦	૧૦૪૯૭.૧૬ ૪૩૧૨૩.૦૨ ૩૨૬૨૫.૮૬
	વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષનું સમાયોજન (ક) હાથ પરની રોકડ (બ) બેંક સિલક (ક) ચાલુ ખાતાની રકમ	૦.૨૪ ૯૬૦૨૯.૨૭ ૯૬૦૨૯.૫૧	૦.૪૪ ૪૩૧૨૨.૫૮ ૪૩૧૨૩.૦૨
	રોકડ અને રોકડ પ્રવાહમાં સમકક્ષની રકમ	૯૬૦૨૯.૫૧	૪૩૧૨૩.૦૨

રોકડ પ્રવાહના પત્રકની સમજૂતિ આપતી નોંધ

- ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ બહાર પાડેલ હિસાબી ધોરણોના ધોરણ-૩ ની અપ્રત્યક્ષ (પરોક્ષ)પદ્ધતિ અનુસાર રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે.
- રોકડ પ્રવાહ પત્રકના ભાગ ક,ખ, અને ગમાં નકારાત્મક (માઈનસ) આંકડા રોકડની જાવક (આઉટ ફ્લો) દર્શાવે છે. જ્યારે હકારાત્મક આંકડા આવક (ઈન ફ્લો) દર્શાવે છે.

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડના બોર્ડ માટે અને તેમના વતી.

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મયુર મહેતા, આઈએએસ
વહીવટી સંચાલક

જલદીપ. દવે
મુખ્ય જનરલ મેનેજર (નાણાં)

ક્રિશન એમ. મહેતા એન્ડ કું
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ વતી
ફર્મ રજીસ્ટ્રેશન નં. ૧૦૫૨૨૯ ડબલ્યુ

નિરવ સોલંકી
નિયામક

(ઉમેશ ભાવસાર)

ભાગીદાર

સભ્યપદ નં. ૦૪૩૫૫૯

સ્થળ : અમદાવાદ

તારીખ : ૩૦.૧૨.૨૦૨૦

યુડીઆઈએન નં. ૨૦૦૪૩૫૫૯એએએસીએસ૪૦૯૫

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૩૦.૧૨.૨૦૨૦



ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગર ૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરા થયેલા વર્ષના નાણાકીય પત્રકો ઉપર નોંધ.

નોંધ:૧

મહત્વની નાણાકીય નીતિઓ

એ. નાણાંકિય પત્રકો તૈયાર કરવાનો આધાર

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમિટેડના નાણાંવિષયક પત્રકો પરંપરાગત ખર્ચ ઉપાર્જનની પદ્ધતિ મુજબ તથા કંપનીના ચાલુ સંસ્થાના ધોરણે અને ભારતમાં પ્રવર્તમાન હિસાબી સિદ્ધાંતો અને કંપની ધારા-૨૦૧૩ની કલમ તથા એમસીએના જાહેરના ક્રમાંક ૧૫/૨૦૧૩માં નિર્દિષ્ટ કરેલા હિસાબી ધોરણો તથા કંપની ધારાની અન્ય જોગવાઈઓનો પાલન થાય તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

તમામ અસ્ક્યામતો તથા જવાબદારીઓ ચાલુ કે કાયમી તરીકે કંપનીની કામગીરીની સામાન્ય પ્રક્રિયા તથા કંપની ધારા-૨૦૧૩ની કલમ-૧૨૮ હેઠળ નક્કી કરવામાં આવેલ શીડ્યુઅલ-૩ માં નક્કી કરેલ ધોરણો મુજબ દર્શાવવામાં આવી છે. કંપનીએ ચાલુ તથા અસ્થાયી અસ્ક્યામતો અને જવાબદારીઓના વર્ગીકરણ માટે કામગીરી પ્રક્રિયા ૧૨ માસની નક્કી કરેલ છે.

બી. આવકની ઓળખ

વેચાણની આવકની ઓળખ જોખમ તથા વળતરની ફેરબદલીના આધારે નિયત કરવામાં આવેલ છે.

સી. અંદાજોનો ઉપયોગ

ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબના સિદ્ધાંતોને અનુરૂપ તૈયાર કરવામાં આવતા નાણાંકિય પત્રકો તૈયાર કરતી વખતે અનુમાનો તથા ધારણાઓ કરવી પડે છે જે નાણાકીય પત્રકોમાં દર્શાવેલ અસ્ક્યામતો તથા જવાબદારીઓ અને અહેવાલ હેઠળના વર્ષના આવક તથા ખર્ચને અસર કરે છે. જે વર્ષમાં પરિણામોની જાણકારી મળે અને આવક ખર્ચ વાસ્તવિક બને તે મુદ્દતમાં ખરેખર પરિણામો અને અંદાજો વચ્ચેના તફાવત દર્શાવવામાં આવે છે.

ડી. મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો

૧. સ્થાયી મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણોના સંપાદનની કિંમત/બાંધકામ ખર્ચમાંથી સંચિત ઘસારો બાદ કર્યા પછી આવતી રકમ સ્થાયી અસ્ક્યામત તરીકે દર્શાવવામાં આવે છે. ખરીદ કિંમત અને મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણોને ઉપયોગમાં લાવવા માટે (ચાલુ સ્થિતિમાં લાવવા) ના ખર્ચનો પડતર કિંમતમાં સમાવેશ થાય છે.

૨. ચાલુ કામો ઉપરનો મૂડી ખર્ચમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. (૧) કાર્યરત નથી તેવી અસ્ક્યામત ઉપર કરવામાં આવેલ ખર્ચ (૨) પ્રાયોજના વ્યાપારી ધોરણે કામ કરતી થાય તે પહેલાં પ્રાયોજના માટે ઉછીના લીધેલ નાણાની પડતર તથા આનુષંગિક ખર્ચને મૂડીકૃત કરવાનું બાકી છે તેવા અનુષંગિક ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે

અને તે પ્રગતિ હેઠળના મુડી કામો તરીકે દર્શાવવામાં આવે છે. (કામની પ્રગતિ હેઠળના સમય દરમ્યાન મળેલ આવક બાદ કર્યા પછીની રકમ) (૩) સ્થાયી મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો ઉભી કરવા માટે આપવામાં આવતા મૂડી ધિરાણને બિનચાલુ મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો તરીકે ગણવામાં આવે છે અને તે લાંબાગાળાની લોન તથા ધિરાણ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે (૪) ખેડૂતોને ચુકવવામાં આવતા પાક વળતર તથા જમીન ઉપયોગમાં લેવા માટેના હક (રાઈટ ઓફ યુઝ) જે પાઈપલાઈન નાંખવા સાથે સીધો સંકળાયેલ છે.

ઈ. ઘસારો અને ઋણમુક્તિ

૧. સ્થાયી મિલકતોના ઘસારાની જોગવાઈ કંપની ધારા -૨૦૧૩ના શિડયુઅલ-૨માં દર્શાવેલ જોગવાઈઓ અનુસાર ઘટતી જતી બકીની પદ્ધતિઓએ ગણવામાં આવે છે.
૨. એ એસ-૧૨ ને અનુલક્ષીને અને અનુદાનમાંથી મેળવવામાં આવેલ હોય તેવી સ્થાયી અસ્કયામતોના ઘસારાની રકમ વિલંબિત અનુદાન ખાતે ઉધારવામાં આવે છે અને તે “વિલંબિત અનુદાન આવક” ખાતે હિસાબમાં જમા લેવામાં આવે છે.

એફ. પ્રત્યેક શેર દિઠ કમાણી:

વર્ષના કર બાદના નફા/નુકશાનની રકમ વર્ષ દરમ્યાનની બાકી સરાસરી ઈકવિટી શેરની સંખ્યા વડે તેને ભાગીને ભારીત સરેરાશ ની પદ્ધતિ મુજબ પ્રત્યેક શેર દિઠ કમાણીની ગણતરી કરવામાં આવે છે.

જી. આવક પરનો કર:

- (૧) આવક વેરા અધિનિયમ ૧૯૬૧ની જોગવાઈ મુજબની અંદાજીત આવક પર આવક વેરો ગણવામાં આવે છે.
- (૨) જે તે સમયની હિસાબી આવક અને અંદાજીત વેરા પાત્ર આવકના તફાવતના આધારે વિલંબિત કર નકકી કરવામાં આવે છે. અને તેનું પ્રમાણ વેરાના દર તથા સરવૈયાની તારીખે ઘડાયેલા (અસ્તિત્વમાં હોય તેવા) અધિનિયમોના આધારે નકકી કરવામાં આવે છે.
- (૩) નહીં સરભર થયેલા ઘસારા સિવાયની બાબતો માટે તથા આગળ ખેંચાતી જતી ખોટના સંદર્ભમાં ભવિષ્યમાં જેટલા પ્રમાણમાં વિલંબીત કર મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો (ડિફર્ડ ટેક્સ એસેટ્સ) સરભર કરી શકાય તેટલા પૂરતી કર પાત્ર આવક મળશે તેવી શક્યતા હોય તેટલા પ્રમાણમાં વિલંબીત કર મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો (ડિફર્ડ ટેક્સ એસેટ્સ) નકકી કરવામાં આવે છે. પરંતુ જો સરભર નહીં થયેલ ઘસારો હોય અને નુકસાન આગળ ખેંચવામાં આવતું હોય તો, ભવિષ્યમાં વિલંબિત કર મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો સરભર કરી શકાય તેવી પૂરતી કરપાત્ર આવક મળશે તેવી ખરેખર શક્યતા હોય તો વિલંબિત કર મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો નકકી કરવામાં આવે છે.



એચ. સરકારનું અનુદાન તથા સબસીડી (સહાય) :

- (૧) ગુજરાત સરકાર તરફથી મળેલ મુડી અનુદાન ને મળેલ મુડી તરીકે ગણવામાં આવે છે અને સરવૈયામાં “અનામત અને પુરાંત” ના જૂથમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.
- (૨) કંપની, અનુદાન ભંડોળમાંથી પ્રાપ્ત કરેલી મિલ્કતો, પ્લાન્ટ તથા ઉપકરણો ની રકમને પાકા સરવૈયામાં વિલંબિત અનુદાન તરીકે ઓળતા ખાતે તબદિલ કરે છે.
- (૩) ગુજરાત સરકાર તરફથી મળેલ મહેસુલ અનુદાન તે અનુદાન સાથે સંકળાયેલ શરતોનું કંપની પાલન કરશે તેવી વ્યાજબી ખાત્રી થયેથી મહેસૂલી અનુદાન તરીકે માન્ય રાખવામાં આવે છે.

આઈ. જોગવાઈઓ, આકસ્મિક જવાબદારીઓ અને પરચૂરણ અસ્કયામતો :

ભૂતકાળના બનાવોના પરિણામરૂપે વર્તમાનમાં જવાબદારી ઉભી થતી હોય ત્યારે ગણતરીના અંદાજ મુજબ પ્રમાણસરની જોગવાઈઓ માન્ય કરવામાં આવે છે. અને તેથી સંસાધનો ઓછા થવાની શક્યતા રહે છે. આકસ્મિક જવાબદારીઓ જો કોઈ હોય તો તે જાણી શકાતી નથી પરંતુ તેનો નોંધમાં ઉલ્લેખ કરવામાં આવે છે. પરચૂરણ આવકો જાણી શકાઈ નથી કે નોંધ રૂપે પણ દર્શાવવામાં આવતી નથી.

જે. અસ્કયામતોની ક્ષતિ :

દરેક સરવૈયાની તારીખે અસ્કયામતોને આંતરી/ બાહ્ય કારણોસર તેને કોઈ ક્ષતિ થયેલ છે કે કેમ ? તેની સમીક્ષા કરવામાં આવે છે. કોઈપણ અસ્કયામત ત્યારે ક્ષતિગ્રસ્ત ગણવામાં આવે છે. જ્યારે તેની વેચાણકિંમત તેની પડતર કિંમત કરતા ઓછી હોય. જે વર્ષે અસ્કયામત ક્ષતિગ્રસ્ત જણાય તે વર્ષના નફાનુકશાનના પત્રમાં તેને નુકસાન તરીકે બતાવવામાં આવે છે. પાછલા હિસાબી વર્ષમાં જો નુકસાન અંદાજમાં કોઈ ફેરફાર થયા હોય તો તેને ચાલુ વર્ષમાં હિસાબોમાં અંદાજિત વસુલાતપાત્ર રકમ જેટલી વિરૂદ્ધ નોંધ આપવામાં આવે છે.

કે. સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી પ્રથા સાથે સુસંગત હિસાબીનીતિઓ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી નથી.

નોંધ : હિસાબોપરની નોંધો

૨૨. જોગવાઈ નહીં કરાયેલ આકસ્મિક જવાબદારી

(રૂ. લાખમાં)

વિગતો	૨૦૧૯-૨૦	૨૦૧૮-૧૯
મે. મોટ્ટ મેકડોનાલ્ડ પ્રા.લિ. કન્સલ્ટીંગ એન્જનીયરીંગ સર્વિસીસ પ્રા.લિ. અને એમ. ડબલ્યુ. એચ. ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવા સંબંધીત લવાદના કેસમા એવોર્ડ વર્ષ ૨૦૧૯-૨૦માં મળેલ છે. જે પરત્વે મુદ્દલ તથા વ્યાજની રકમ નીચે મુજબ છે. મુદ્દલ રૂ. ૮૮.૫૪ લાખ વ્યાજ રૂ. ૧૪૭.૪૧ લાખ માટે મુદ્દલ રૂ. ૧૮૬.૦૫ લાખ વ્યાજ રૂ. ૩૧૧.૧૮ લાખ (આ એવોર્ડ સામે કંપનીએ અરજી કરી છે.)	૭૪૩.૧૮	૮૮૯.૬૪

<p>મહા શક્તિ કોક સામે લવાદનો ચુકાદો જી.ડબલ્યુ.આઈ.એલ. વિરૂધ્ધ આવેલ છે. તેમ છતાં જી.ડબલ્યુ.આઈ.એલ. એ ચુકાદો કોમર્શીયલ કોર્ટમાં સીએમએ નંબર ૨૫ ૨૦૧૬ તા. ૧૩મી જુલાઈ ૨૦૧૬થી કોમર્શીયલ કોર્ટમાં ચુકાદાને પડકારેલ છે. જેના કારણે રૂા. ૨,૯૧.૬૮લાખ વત્તા તા. ૧૨/૧૦/૨૦૧૦થી તા. ૮/૧૨/૨૦૧૧ સુધીનું ૮% અને ત્યાર બાદ ૧૫% લેખે વ્યાજ) રૂા. ૩,૪૯.૭૩લાખ</p>	<p>૬૪૧.૪૧ -લવાદી ન્યાય પંચનાં ચુકાદા પ્રમાણે</p>	<p>૬૪૧.૪૧ -લવાદી ન્યાય પંચનાં ચુકાદા પ્રમાણે</p>
---	--	--

૨૩. મહત્વની પ્રતિબદ્ધતા

મુડીનાં હિસાબ પર અમલવારી બાકી છે તેવા કરાર ની અંદાજીત રકમ તથા જેની જોગવાઈ કરવામાં આવેલ નથી તેવી ૩૧ માર્ચ ૨૦૨૦નાં રોજની ધિરાણ બાદની ચોખ્ખી રકમ રૂા. ૨૪૦.૪૧ કરોડ છે. (ગત વર્ષની રૂા. ૩૫૫.૩૫ કરોડ)

૨૪. (૧) ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કંપનીએ રૂા ૨૮૪.૪૭ કરોડ ધસારાની જોગવાઈ કરેલ છે. (આગળ ના સમયનો રૂા.૬.૮૨ કરોડ અને ચાલુ વર્ષનાં રૂા.૨૭૭.૬૫ કરોડ) જે માંથી ધસારા ખર્ચ રૂા.૨૮૩.૭૫ કરોડ (આગળનાં સમયનો રૂા.૬.૮૫ કરોડ અને ચાલુ વર્ષનાં રૂા.૨૭૬.૯૦ કરોડ) અનુદાન ભંડોળમાંથી પ્રાપ્ત કરેલ અસ્ક્યામતો માટેના છે અને રૂા.૦.૭૨ કરોડની ધસારાની રકમ સ્વભંડોળમાંથી પ્રાપ્ત કરેલ અસ્ક્યામતો માટેની છે. એ.એસ.-૧૨ મુજબ કંપનીએ વિલંબીત અનુદાન ખાતામાંથી અન્ય આવકના નફા અને ખોટ ખાતામાં તબદીલ કરી જમા કરેલ રકમ રૂા. ૨૮૩.૭૫ કરોડ છે. (આગળનાં સમયનો રૂા. ૬.૮૫ કરોડ અને ચાલુ વર્ષનાં રૂા.૨૭૬.૯૦ કરોડ) નો ધસારો વિલંબિત અનુદાનની આવક (રૂા.૨૭૬.૯૦ કરોડ) ખાતે તબદીલ કરેલ છે. અને અગાઉના સમયની વિલંબિત અનુદાનની આવક (રૂા.૬.૮૫ કરોડ) નોંધ નં. ૨૧માં અપવાદરૂપ (અન્ય) આવક તરીકે નફાનુકસાન ખાતે જમા લેવામાં આવેલ છે.

(૨) અગાઉના સમયના મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો જે અગાઉના વર્ષોમાં ઉપયોગમાં લેવામાં આવેલ છે. તેની ઉપરના રૂા.૫.૫૬ કરોડના ધસારાની રકમમાં રૂા.૨૫.૩૭ કરોડની રકમ અગાઉના વર્ષોની છે. મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણોની રકમ ઠેકેદારો (કોન્ટ્રાક્ટરો) દ્વારા આખરી બીલો રજૂ ન કરવાને કારણે મૂડીકૃત કરાઈ નથી જો કે અસ્ક્યામતો અગાઉના વર્ષોમાં કાર્યરત કરાઈ હતી, પરંતુ તે ચાલુ વર્ષમાં મૂડીકૃત કરવામાં આવી છે અને ધસારો અગાઉના સમયગાળાના ધસારા તરીકે દર્શાવવામાં આવેલ છે. તેને નોંધ નં.(૨૧)માં મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો હેઠળ અગાઉના સમયગાળા વિલંબીત અનુદાન તરીકે દર્શાવી હોવાથી તે કંપના નફા (નફાકારકતા)ને અસર કરતી નથી.

- (૩) અગાઉના વર્ષમાં ઉપયોગમાં લેવાયેલ રૂા.૨.૧૬ કરોડના મિલ્કતો, પ્લાન્ટ તથા ઉપકરણો ઉપર પ્રયોજનાની પાઈપલાઈન કોર્સીંગ માટે આપેલ “એડવાન્સ” ને લગતો છે અને વર્ષ દરમ્યાન ચકાસણી કરતા માલુમ પડેલ છે કે સંબંધિત પ્રાયોજના પૂર્ણ થયેલ છે અને એડવાન્સ પરત ચુકવવા પાત્ર નથી.
૨૫. વેસ્ટર્ન રેલ્વે તથા અન્યને મુડી સામે આપવામાં આવેલ ધિરાણ, લાંબાગાળાની લોન તથા ધિરાણ નીચે દર્શાવવામાં આવેલ છે. (ચાલુ વર્ષના રૂા.૩.૮૬ કરોડ, અગાઉના વર્ષના રૂા.૬.૦૭ કરોડ) અને તે અંશતઃ વસુલાતપાત્ર છે અને સિલકની આખરી કરણ થયેથી સ્થાયી અસ્કયામતો તરીકે મૂડીકૃત કરવામાં આવશે અને ત્યારબાદ લાગુ પડતા ઘસારાની જોગવાઈ કરવામાં આવશે.
- વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન જે પ્રાયોજના પૂર્ણ થઈ ગયેલ છે અને જે પરત મળવાપાત્ર નથી તેવા રૂા.૨.૧૬ કરોડના પ્રાયોજનાને લગતા ધિરાણ સંબંધિત અસ્કયામતોના મૂડી ખર્ચ સામેના ધિરાણ (એડવાન્સ) ખાતેથી સંબંધિત અસ્કયામત ખાતે તબ્દીલ કરેલ છે. અને તે મુજબ ઘસારો ગણેલ છે.
૨૬. વર્ષ દરમ્યાન, કંપનીના તમામ કર્મચારીઓ કાંતો સરકાર/ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાંથી પ્રતિનિયુક્તિ પર આવેલા છે અથવા કરાર આધારિત નિમણુંક પામેલ છે. કોઈ કર્મચારી, કંપનીની સીધી ભરતીથી નિમણુંક પામેલા નથી કરાર આધારિત કર્મચારીઓના પુરાવા ભવિષ્ય નિધિફંડ, ગ્રેયુઈટી, રજા પગારનો રોકડમાં રૂપાંતર જેવા નિવૃત્તિના લાભો સંબંધિત કોન્ટ્રાક્ટરો દ્વારા ચુકવવામાં આવે છે, તેથી કંપનીની, એએસ-૧૫ મુજબની જવાબદારી ઉભી થતી નથી. નોંધ-૧૯માં કંપનીએ દર્શાવેલ ખર્ચ પ્રોવિડન્ડ ફાળા તથા બોર્ડ ઈન્સ્યોરન્સ ફંડમાં ફાળાની રકમ ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડના પ્રતિનિયુક્તિ ઉપરના કર્મચારીઓને સંબંધિત છે.
૨૭. મળવાપાત્ર રકમ, ચુકવવાપાત્ર રકમ, અન્ય લાંબા સમયની જવાબદારીઓ તથા લાંબી મુદ્દતી લોન અને ધીરાણો જરૂરી જણાય ત્યાં સમર્થન અને સરભર થવાને પાત્ર છે. આ નાણાંકીય પત્રકોમાં જણાવેલ બિન ચાલુ અસ્કયામતો તથા ચાલુ અસ્કયામતો સામાન્ય રીતે મળવા પાત્ર અંદાજીત રકમને ધ્યાનમાં રાખીને દર્શાવેલ છે.
૨૮. ગયા વર્ષની આખરમાં હિસાબમેળ બાકી હોવાના કારણે ૧૩ પ્રાયોજના કચેરીઓની સિલકોમાં આવતાં સિલકોના તફાવત રૂા. ૨૮૮.૩૮ લાખ નોંધ નં. ૮માં અન્ય ચાલુ જવાબદારીઓ હેઠળ ધિરાણ તરીકે દર્શાવેલ છે. ૧૩ કચેરીઓ પૈકી ૬ કચેરીઓના કિસ્સામાં વ્યવહારોનું મેળવણું કરવાને કારણે તા.૩૧.૩.૨૦૨૦ના રોજ કુલ તફાવત રૂા.૩૫૩૦૯.૬૮ રહે છે. (કુલ ઉધાર બાકી રૂા.૨૪૨૨૯૭૦.૦૦ અને કુલ જમા બાકી રૂા.૨૩૮૭૬૬૦.૩૨)
૨૮. કંપનીની કામગીરીના સંદર્ભમાં છ માસથી વધુ સયથી મળવાપાત્ર હોય અને મળેલ ન હોય તેવી રકમ તા.૩૧.૩.૨૦૨૦ ના રોજ રૂા.૧૦૨૯.૦૦ કરોડ હતી તે પૈકી સરકારી નિગમો અને સંસ્થાઓને લગતી બાકી રૂા.૧૦૦૭.૬૯ કરોડ છે. અને રૂા.૨૧.૩૧ કરોડ બિન સરકારી સંસ્થાને લગતા છે રૂા.૧૨૧૫.૪૩ કરોડની

મળવાપાત્ર બાકી રકમ પૈકી રૂા.૫૬૭.૬૨ કરોડની રકમ (ગત વર્ષની રૂા.૪૫૪.૬૫ કરોડ) જુદી જુદી મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાના સાત વર્ષના બાકી પાણીના બીલો તથા બિલંબિત ચૂકવણાને લગતા દંડની રકમો છે જેની વસૂલાત માટે તેઓને યાદીપત્રો પાઠવેલ છે અને વસૂલાત માટે કંપનીના તજજ્ઞોને પણ મોકલવામાં આવેલ છે અને તેથી તેને મળવાપાત્ર આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવી છે.

સમાયોજન ને પાત્ર સિકયોરીટી ડિપોઝીટની રકમનું સમાયોજન કર્યા વગર શંકાસ્પદ લેણાની જોગવાઈ કરવામાં આવેલ છે.

૩૦. રૂા.૦.૩૬ કરોડની રકમ (ગતવર્ષે રૂા.૦.૪૭ કરોડ) જે બેંકમાં જમા કરવામાં આવી છે, તે કઈ પાર્ટીઓ તરફથી મળેલ છે તેની માહિતી બેંક દ્વારા આપવામાં આવી નથી. તેથી આ રકમને દેવાદારોના ખાતા સામે નોંધ -૧૧ માં સરભર બતાવવામાં આવેલ છે અને જે તે પાર્ટીઓની માહિતી મળેથી જે તે વ્યક્તિગત ખાતે જમા આપવામાં આવશે.

૩૧ મોટા જથ્થાના પાણીના વહન માટેની પાઈપલાઈનના માળખાને એકત્રીત કરવાના હેતુથી અગાઉના વર્ષોમાં ગુજરાત સરકારે નીચે જણાવેલ મોટા જથ્થાના પાણીના વહન માટેની પાઈપલાઈનોનું માળખું જીડબલ્યુએસએસબીમાંથી જીડબલ્યુઆઈએલને તબદીલ કરેલ છે.

- ૧) એનસી-૬ માળિયાથી મોરબી
- ૨) એનસી-૭ મોરબી થી ટંકારા
- ૩) એનસી-૮ માળિયાથી ભચાઉ
- ૪) એનસી-૧૨ ટંકારાથી રતનપુર
- ૫) એસપીપી-૧ પરિચેજથી પીપળી
- ૬) એસપીપી-૨ પીપળી થી નાવડા
- ૭) એસપીપી-૩ નાવડા, બોટાદ, ગઢડા
- ૮) એસપીપી-૪ નાવડા, વલભીપુર

ગુ.પા.પુ. અને ગ.વ્ય બોર્ડ દ્વારા પાણીના વહન માટેની પાઈપ લાઈનનોના માળખામાં સમાવિષ્ટ ઉપર જણાવેલી અસ્કયામતો હજુ ગુ.વો.ઈ.લિ.ને તબદીલ કરવાની બાકી છે. આ બાબતના નિરાકરણ બાદ જ સ્થાયી મિલકતો, પ્લાન્ટ તથા ઉપકરણો પરના ઘસારાની નોંધ હિસાબી ચોપડાઓમાં કરવામાં આવશે.

મોટા જથ્થાની પાઈપલાઈનનો એકત્રીકરણ કરવાના હેતુથી ગુજરાત સરકારે મોટા જથ્થાના પાણીના વહન માટે પાઈપલાઈનના માળખામાંથી નીચે મુજબની પાલપલાઈન ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.તરફથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને અગાઉના વર્ષોમાં તબદીલ કરેલ છે.

(૧) એન.સી-૧૪ નભોઈથી ગાંધીનગર શહેર અને જી.ઈ.બી.



- (૨) એન.સી-૧૭ મોઢેરા થી મહેસાણા
- (૩) એન.સી-૨૩ પંચમહાલ જિલ્લામાં હાલોલ-કાલોલ .

ઉપરની પરિયોજનાની અસ્કયામતો હજી જીડબલ્યુએસએસબી દ્વારા જીડબલ્યુઆઈએલ ને તબદીલ કરવાની બાકી છે. હાલમાં ઉપરની પરિયોજનાની સ્થાયિ અસ્કયામતો અને અસ્કયામતો પરના ઘસારાની નોંધ કંપનીનાં હિસાબી ચોપડામાં કરવામાં આવેલ છે.

બન્ને સંસ્થાઓના હિસાબી દફતરે યોગ્ય નોંધો તથા હિસાબી પ્રક્રિયાઓના ઉકેલ માટે બન્ને સંસ્થાઓના અધિકારીઓ તરફથી એક સમિતિની રચના કરવામાં આવી છે.

૩૨. પક્ષકારો સંબંધી માહિતી

- (૧) કંપની સાથેનો સંબંધ

(ક) જ્યાં નિયંત્રણ હોય: ગુજરાત સરકાર.

(ખ) મુખ્ય વ્યવસ્થાપક ગણ.

શ્રી ધનંજય દ્વિવેદી, આઈ.એ.એસ., અધ્યક્ષ, તા.૩૦/૦૮/૨૦૧૯ થી ચાલુ

શ્રી જે.પી. ગુપ્તા, આઈ.એ.એસ., અધ્યક્ષ, તા.૧૪/૦૭/૨૦૧૭ થી તા. ૩૦/૦૮/૨૦૧૯ સુધી

શ્રી તુષાર ઘોળકીયા, આઈ.એ.એસ. વહીવટી સંચાલક, તા.૨૮/૦૮/૨૦૧૬ થી

તા. ૧૧/૦૮/૨૦૧૯ સુધી

શ્રી કે.કે. નિરાલા, આઈ.એ.એસ. વહીવટી સંચાલક, તા.૧૧/૦૮/૨૦૧૯ થી

તા.૦૩/૦૨/૨૦૨૦ સુધી

શ્રી આર.એસ. નિનામા, આઈ.એ.એસ. વહીવટી સંચાલક, તા.૦૩/૦૨/૨૦૨૦ થી

તા.૦૫/૦૬/૨૦૨૦

શ્રી મયુર કે. મહેતા, આઈ.એ.એસ. વહીવટી સંચાલક, તા.૦૫/૦૬/૨૦૨૦ થી ચાલુ

શ્રી રવિ સોલંકી, સી.જી. એમ. (પી) અને નિયામક, તા ૩૦/૦૬/૨૦૧૯ સુધી

શ્રી નિરવ સોલંકી, સી.જી. એમ. (પી) અને નિયામક, તા ૩૦/૦૮/૨૦૧૯ થી ચાલુ

- (ગ) ચાવીરૂપ વ્યવસ્થાપક ગણને મહેનતાણું

શ્રી રવિ સોલંકી, સી.જી. એમ. (પી) અને નિયામકને મહેનતાણું રૂા. ૫,૮૮,૦૫૭/-

(ગયા વર્ષે રૂા. ૨૩,૩૫,૪૧૦/-) તા. ૩૦/૦૬/૨૦૧૯ સુધી

શ્રી નિરવ સોલંકી, સી.જી. એમ. (પી) અને નિયામકને મહેનતાણું રૂા. ૮,૫૫,૯૨૯/-

(ગયા વર્ષે રૂા. શૂન્ય) તા. ૩૦/૦૮/૨૦૧૯ સુધી

સંચાલકો પાસે કોઈ બાકી લેણાં નથી.

૩૩. શેરદીઠ મૂળ અને ઓછી થયેલ કમાણી

વિગત	૩૧-૦૩-૨૦૨૦ (રૂ.)	૩૧-૦૩-૨૦૧૯ (રૂ.)
આંકડાકીય માહિતી		
ચોખ્ખો નફો/નુકસાન	-૯૬,૭૭,૮૯,૬૦૮.૭૧	-૧,૦૨,૭૧,૫૯,૭૭૧.૦૪
ડિનો મિનેટર		
વર્ષ દરમ્યાન ઈકિવિટી શેરની સંખ્યા - મૂળ	૧૫,૦૬,૨૭,૩૫૦.૦૦	૧૪,૯૬,૦૩,૩૭૦.૦૦
શેર દીઠ અંકિત મૂલ્ય	દરેકના રૂ. ૧૦/-	દરેકના રૂ. ૧૦/-
શેર દીઠ કમાણી- મૂળ	શેરદીઠ રૂ. -૬.૪૩	શેરદીઠ રૂ. -૬.૮૭

૩૪. ઓડિટરનું મહેનતાણું

(રકમ રૂપિયા)

વિગત	૨૦૧૯-૨૦૨૦	૨૦૧૮-૨૦૧૯
ઓડિટ ફી	૧,૭૭,૦૦૦	૧,૪૧,૬૦૦
ખિસ્સા ખર્ચ પૈકી	૯,૯૩૬	૧૧,૫૧૧

૩૫. કંપની, ઉત્પાદકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ન હોઈ, કંપની ધારા ૨૦૧૩ની જોગવાઈઓને અનુરૂપ, વધારાની માહિતી(રજુ કરવાની બાબત) લાગુ પડતી નથી.

૩૬. હિસાબી ધોરણ-૨૨ અનુસાર, પ્રતિતીકાર પુરાવાના નકકી કરી શકાય કે “વિલંબિત કર અસ્કયામત” વસુલ કરવા માટે ભવિષ્યમાં પુરતી આવક મળશે તેવી પ્રતિતીકારક પુરાવાના આધારે ખાત્રી થતી હોય તો તેટલે અંશે હિસાબી ધોરણ-૨૨ અનુસાર “વિલંબિત કર અસ્કયામત” નકકી કરી શકાય. વર્ષ દરમ્યાન “વિલંબિત કર અસ્કયામત”ની જોગવાઈ રૂ. ૩.૯૬ લાખ ની કરવામાં આવેલ છે.

(રૂ.લાખમાં)

વિલંબિત કર ગણતરી	૨૦૧૯-૨૦૨૦	૨૦૧૮-૨૦૧૯
વિલંબિત કર અસ્કયામત (જવાબદારી) ઉઘડતી સિલક	૧.૨૯	૪.૨૨
હિસાબના ચોપડા મુજબ ધસારો	૭૧.૭૦	૯૧.૮૩
આવક વેરા મુજબ ધસારો	૮૬.૯૫	૧૦૧.૨૨
ધાલખાધ અને શંકાસ્પદ દેવા	૦.૦૦	૦.૦૦
વિલંબિત કર અસ્કયામત (જવાબદારી)	૩.૯૬	૨.૯૩
ચાલુ વર્ષ માટે પ્રવર્તમાન કર દર	૨૬.૦૦	૩૧.૨૦
વિલંબિત કર અસ્કયામતોની સિલક	(૨.૬૭)	૧.૨૯



૩૭. કંપની, ગુજરાતના ભૌગોલિક વિસ્તારમાં પાઈપ લાઈન નેટવર્ક (માળખા) મારફત મોટા જથ્થામાં પાણી પહોંચાડવાની પ્રાથમિક કામગીરી કરે છે. ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંસ્થાએ બહાર પાડેલ હિસાબી ધોરણ-૧૭ હેઠળ જરૂરી હોય તે પ્રમાણે માહિતી આપવાની બાબત આ કંપનીને લાગુ પડતી નથી.
૩૮. એસએસએનએલ તરફથી પુરા પાડવામાં આવતા પાણીના બીલમાં દર્શાવવામાં આવતી વ્યાજ અને દંડની રકમ માટે ઘણા વર્ષોથી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. ગુજરાત સરકારે જાહેર કરેલી એકી સાથે ચુકવણા અને પતાવટની યોજના હેઠળ કંપનીએ એસએસએનએલને દંડ અને વ્યાજની રકમ જતી કરવા રજૂઆત કરેલ છે. જેની કાર્યવાહી ચાલુ છે.
૩૯. અગાઉના વર્ષના (વ્યવહારોનું) સમાયોજન કરવું.
(અગાઉના સમયના દરેક વ્યવહારોના સમાયોજન જરૂરી છે તેવા ખાતાની વિગતો.)

(રકમ રૂ.)

ચુકવણાના પ્રકાર	૨૦૧૨-૧૩	૨૦૧૪-૧૫	૨૦૧૫-૧૬	૨૦૧૬-૧૭	૨૦૧૮-૧૯	સરવાળો
(અ) આવક						
વેચાણો	૨૪૦				૨૧૫૭૦૧૪૦	૨૧૫૭૦૩૮૦
વિજળી બીલ					૬૮૭૮૦૧૬૯	૬૮૭૮૦૧૬૯
વ્યાજ		૧૩૭૨૯૨	૧૩૭૧૯૨			૨૭૪૪૮૪
વિલંબિત અનુદાન આવક					૬૮૫૮૪૪૮૪	૬૮૫૮૪૪૮૪
જી.એસ.ટી.ને લગતો ખર્ચ					૧૫૪૧૬૪૬	૧૫૪૧૬૪૬
ઓ.એન્ડ એમ. ખર્ચ					૭૪૨૦૭૦૦	૭૪૨૦૭૦૦
અન્ય આવક						૦.૦૦
કુલ (અ)	૨૪૦	૧૩૭૨૯૨	૧૩૭૧૯૨	૦	૧૬૭૮૯૭૧૩૯	૧૬૮૧૭૧૮૬૩
(બ) ખર્ચ						
સિક્યુરીટી ટાસ્કફોર્સના ખર્ચ					૪૧૬૨૩૩૯૩	૪૧૬૨૩૩૯૩
ઘસારો					૬૮૨૯૯૯૧૬	૬૮૨૯૯૯૧૬
વેચાણ		૨૯૪૨૦૪૦	૯૨૧૨૦૪	૮૫૬૧૨		૩૯૪૮૮૫૬
અન્ય ખર્ચ					૨૫૫૭૨૬૩	૨૫૫૭૨૬૩
કુલ (બી)	૦	૨૯૪૨૦૪૧	૯૨૧૨૦૪	૮૫૬૧૨	૧૧૨૪૮૦૫૭૨	૧૧૬૪૨૯૪૨૮
કુલ સરવાળો (એ - બી)						૫૧૭૪૨૪૩૪

૪૦. વ્યવસ્થાપનના મતે સરવૈયાની તારીખે સ્થાયિ મિલ્કતો, પ્લાન તથા ઉપકરણોને નોંધ પાત્રક્ષતિને કારણે નુકસાન થયા અંગેની કોઈ જાણકારી મળી નથી. તેથી ક્ષતિને કારણે થયેલ નુકસાનની વિગતોની જોગવાઈ કરવી જરૂરી નથી.
૪૧. ચાલુ વર્ષના આંકડા સાથે સરખામણી થઈ શકે તે હેતુથી આગળના વર્ષના આંકડાઓને જ્યાં જરૂર પડે ત્યાં પુનઃ ગઠન કરી દર્શાવેલ છે.
૪૨. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (જી.ડબલ્યુ.એસ.એસ.બી.) એ કંપનીને વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૪-૧૫ દરમ્યાન રૂા.૧૧૦૭ કરોડનું એડવાન્સ (અગાઉથી) અનુદાન ચુકવેલ છે. આ સમય ગાળા દરમ્યાન કંપનીએ રૂા.૨૫૦ કરોડ પરત કરેલ છે.
- તા.૩૧/૦૩/૨૦૧૮ના રોજ બાકી રકમ રૂા. ૬૮૯.૯૩ કરોડ હતી વર્ષ ૨૦૧૮-૨૦ દરમ્યાન પાણીના ચાર્જસ (વટર ચાર્જસ) ના બીલો કે જે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવેલ છે તેવી રૂા.૨૮૬.૧૦ કરોડ ની મળવા પાત્ર રકમનું આ અનુદાનની રકમ સામે સમાયોજન કરવામાં આવેલ છે. આમ હવે રૂા.૪૦૩.૮૩ કરોડની રકમ “અનામત અને વધારો” શિર્ષક નીચે પાકા સરવૈયામાં બાકી રહે છે.

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમિટેડના બોર્ડ માટે અને તેમના વતી.

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મયુર મહેતા, આઈએએસ
વહીવટી સંચાલક

જલદીપ. દવે
મુખ્ય જનરલ મેનેજર (નાણાં)

કિશન એમ. મહેતા એન્ડ કું
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ વતી
ફર્મ રજીસ્ટ્રેશન નં. ૧૦૫૨૨૯ ડબલ્યુ

નિરવ સોલંકી
નિયામક

(ઉમેશ ભાવસાર)
ભાગીદાર
સભ્યપદ નં. ૦૪૩૫૫૯
સ્થળ : અમદાવાદ
તારીખ : ૩૦.૧૨.૨૦૨૦
યુડીઆઈએન નં. ૨૦૦૪૩૫૫૯એએએસીએસ૪૦૯૫

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૩૦.૧૨.૨૦૨૦



ફોર્મ નં. એમજીટી-૧૧

પ્રોક્સી ફોર્મ

(કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ -૧૦૫ (દ) અને કંપની (વ્યવસ્થાપન અને વહિવટ)

નિયમો, ૨૦૧૪ના નિયમ ૧૯(૩) મુજબ)

સભ્ય (સભ્યો)નું નામ		
નોંધાયેલ સરનામું		
ઈ-મેલ આઈડી	ફોલિઓ નં./ કલાયન્ટ આઈડી	ડીપીઆઈડી

હું/ અમે ઉપરોક્ત કંપનીનાં શેર ના સભ્ય સભ્યો આથી નીમીએ છીએ.

નામ :	ઈ-મેઈલ આઈડી
સરનામું :	
સહી અથવા તે નિષ્ફળ જતાં	

નામ :	ઈ-મેઈલ આઈડી
સરનામું :	
સહી અથવા તે નિષ્ફળ જતાં	

નામ :	ઈ-મેઈલ આઈડી
સરનામું :	
સહી અથવા તે નિષ્ફળ જતાં	

કંપનીની તા.૦૬/૦૩/૨૦૨૧ ના રોજ ૪:૩૦ વાગ્યે બોર્ડ રૂમ, જી.ડબલ્યુ.એસ.એસ.બી., પહેલો માળ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર ખાતે યોજનાર વાર્ષિક સામાન્ય સભા / અસાધારણ સભા અને મુલતવી રહેલ કોઈ બેઠકની બાબતમાં નીચે દર્શાવેલા આવા ઠરાવની બાબતમાં મારા / અમારા પ્રોક્સી તરીકે મારા / અમારા વતી હાજર રહેવા અને મારા/ અમારા વતી મત આપવા (મતદાન સમયે)નીમીએ છીએ.

ઠરાવ નં.

ક્રમ નં.	ઠરાવ (વો)	શૂન્ય	
		તરફેણમાં	વિરૂદ્ધમાં
૧	૩૧ મી માર્ચ ૨૦૨૦ના નાણાંકીય વર્ષ માટે નફા-નુકસાન પત્રક, સરવૈયું, ડાયરેક્ટરોનો અને ઓડિટરનો અહેવાલ મંજૂર કરવા.		
૨	નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વૈધાનિક ઓડિટરોનો પગાર નક્કી કરવા.		

* ઈલેક્ટ્રોનિક્સ ફોર્મમાં શેર ધારણ કરનાર રોકાણકારોને લાગુ પડનાર

આજ તા. ૨૦૨૧ ના રોજ સહી કરી

શેર હોલ્ડરની સહી

પ્રોક્સી હોલ્ડરની સહી

નોંધ :

- ૧) અમલી બનાવવા માટે પ્રોક્સીનું આ ફોર્મ યોગ્ય રીતે પૂરું કરીને કંપનીની નોંધાયેલી કચેરી ખાતે બેઠક શરૂ થયાના ૪૮ કલાક પહેલાં જમા કરાવવું જોઈએ.
- ૨) પ્રોક્સી, કંપનીનો સભ્ય હોવો જરૂરી નથી.

રેવન્યુ
સ્ટેમ્પ
ચોટાડો

રેવન્યુ સ્ટેમ્પ પર
શેર હોલ્ડરની સહી

હાજરી સ્વીપ

સભા ખંડના પ્રવેશ દ્વાર પર સોંપવાની

તા. રોજ ૨૧મી વાર્ષિક સાધારણ સભા.

હાજર રહેનાર સભ્યનું પુરુ નામ.....
(સ્વચ્છ મોટા અક્ષરમાં)

હેજર ફોલિઓ નં. / કલાયન્ટ આઈડી નં. ધારણ કરેલ શેરની સંખ્યા.....
પ્રોકસીનું નામ (સભ્ય બદલેલ પ્રોકસી
હાજર રહે તો ભરવાનું)

તા. ના રોજ ખાતે મળનાર ૨૧મી વાર્ષિક સામાન્ય સભા મા હું આથી મારી હાજરી
નોંધાવું છું.

(સભ્ય/ પ્રોકસીની સહી)

નોંધ :

- ૧) વધુ નકલો મળી શકશે નહી તેથી બેઠકમાં વાર્ષિક અહેવાલની નકલો લાવવા સભ્યોને વિનંતિ કરવામાં આવે છે.
- ૨) અમલી બનાવવા માટે બેઠકની શરૂઆતના અડતાલીસ કલાક પહેલાં કંપનીની નોંધાયેલી કચેરી પ્રોકસી ફોર્મ જમા કરાવવું.
- ૩) પ્રોકસી, કંપનીનો સભ્ય હોવો જરૂરી નથી.
- ૪) જોઈન્ટ હોલ્ડરોના કેસમાં, પોતે અથવા પ્રોકસી દ્વારા મત આપનાર સિનિયરના મતને, અન્ય જોઈન્ટ હોલ્ડરોના મતને બાકાત કરીને સ્વીકારવાનો રહેશે. સભ્યોના રજિસ્ટ્રારમાં જે ક્રમમાં નામ હોય તે ક્રમમાં સિનિયોરીટી નક્કી કરવાની રહેશે.
- ૫) આ પ્રોકસી ફોર્મ સભ્ય દ્વારા રજૂ કરવાની બાબત જાતે બેઠકમાં હાજર રહેવા અને મત આપવા આવા સભ્યને રોકી શકશે નહી.



કંપની, ૨૦૧૩
ટૂંકાગાળાની નોટિસ માટે શેર ધારકો દ્વારા સંમતિ
(ધારા ૧૦૧ (૧) મુજબ)

પ્રતિ,
બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ,
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.
બ્લોક નં. ૧, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

હું નો પુત્ર/પુત્રી/ પતિ-પત્ની, રહેવાસી.....
..... કંપનીમાં રૂા. ૧૦/- નો એક એવા ૧૦ (દસ) ઈકવીટી શેર ધરાવું છું, આથી કંપની કાયદો,
૨૦૧૩ ની રકમ ૧૦૧(૧) અન્વયે સંમતિ આપું છું કે ૧૯ મે, ૨૦૨૦ ના રોજ ૧૬.૪૫ કલાકે જી.ડબલ્યુ.એસ.એસ.બી.ના
બોર્ડ રૂમમાં, બ્લોક નં. ૧લો માળ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર, ખાતે, અથવા તેની કોઈ પણ મુલત્વી રહેલી બેઠક,
ટૂંકાગાળાની નોટિસ સાથે યોજવામાં આવે.

સહી :
નામ :
તારીખ :



ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

(ગુજરાત સરકારનું સાહસ)

બ્લોક નં. ૧, પહેલો માળ, ડો. જીવરાજ મહેતા ભવન,
સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૦૧૦.

ફોન : (૦૭૯) ૨૩૨ ૩૯૫૩૭, ૯૯૭૮૪૪૧૧૪૭/૪૮, ફેક્સ : ૨૩૨૨૨૩૯૬,
E-mail : gwilcompany1@gmail.com

Annual report of Gujarat Water Infrastructure Limited for the year ended 31-03-2020 as per Section 395 (1) of the companies Act, 2013.

Name of officer of presenting Annual Report

Dhananjay Dwivedi (IAS)
Secretary (Water Supply)
Narmada, Water Resources, Water Supply & Kalpsar
Department
Gujarat State



(Dhananjay Dwivedi) (IAS)
Signature of the officer In Charge

Annual Report Year 2019-20

Department Name: Gujarat Water Infrastructure Limited Water Supply Department.

Preamble

- Based on the Narmada Master Plan and as per the award of the Narmada Tribunal 1.06 million acre feet (MAF) i.e. 3571 million litres per day (MLD) water is reserved for domestic and industrial purpose, allocates 0.86 million acre whereas 0.20 MAF (671 MLD) water is to be used for industrial purpose
- In the last 20 years more than 2960 km of bulk pipelines have been laid and 42 Pumping Station were functioned for inter basin transfer of drinking water from Mahi and Narmada water off takes to water scarce areas of Saurashtra and Kutch Regions of the State. At present Rural, Urban and Industrial Area of Saurashtra and Kutch are getting water from state wide water supply Grid Network., At present Average 1700 MLD water is being supplied through Grid Network
- Total 2390 MLD Pumping Machineries are installed in 42 Pumping Stations.

Works carried out/Completed during year 2019-20

1. **Desalination Projects implementation in Saurashtra and Kutch Region: (Cost : Rs 1080 Crore)**
 - In order to decrease the dependence on Narmada waters and provide water security Gujarat Government has decided to establish various desalination plants to convert sea water into potable water at different places of Gujarat. The objective is to create water sources at local level for drinking purpose.
 - Government of Gujarat has decided to implement four desalination plants on Hybrid Model (DBOT Basis) at
 - (1) At Gandhvi Village in Devbhoomi Dwarka District-70 MLD
 - (2) At Ghogha Village in Bhavnagar District- 70 MLD
 - (3) At Vadodara Zala Village in Sutrapada Taluka of Gir Somnath-30 MLD
 - (4) At Gundiyali Village of Mandvitaluka of Kutch District-100 MLD
 - M/S Shapoorji Palonji and Company Private Limited, Mumbai and Aquatech System Private Limited has formed Special Purpose Vehicle for all four locations and Concession Agreement is signed with all SPV'S on Date 26-2-2020

- At Present, the process of various Environmental approvals are under progress by all SPVS. The Implementation works will be completed and all desalination plants will be functioned in two years after getting necessary Environmental clearance Municipal (Desalinated water will be supplied to the beneficiaries of urban and rural areas and industries units of Saurashtra and Kutch areas by connecting existing water supply grid network to provide additional water security to those areas of coastal region.

2. Brahmani Dam – II to NC – 7 Morbi Pumping Station Project:

- In order to lift 300 MLD water from Brahmani – II Dam to NC – 7 Pumping Station near Nava Sadulka, works including Intake well cum Pump House, Approach Bridge, Civil and Electro Mechanical and Pipeline were taken up. The tendering process for above packages was carried out during the year and works were awarded to various contractors by inviting online tender through N-Procure during the F.Y. 19-20. Presently, the works are under progress for all the three packages.

Work under Planning

3. Budhel to Borda Bulk Pipeline project- 180 MLD (Cost Rs 376 Crores)

- As per water supply gap analysis for Budhel to Kadiyali, it is found that the carrying capacity of existing bulk pipeline laid from Budhel PS to Kadiyali PS is 175 MILD against the supply of 352 MLD at Budhel PS. Hence, in order to provide future water demand onwards Budhel to Sonariya sections, it is decided to lay down parallel pipeline from Budhel Pumping Station to Borda 58 Km of 180 MLD carrying capacity and implementation works are carried out
- The Necessary administrative approval for Rs. 376.19 Crore Gross accorded by State Government
- The tender process completed and works are awarded to L.I Agency and works are started. The works will be completed on June, 2022
- After completion of the project, scheme will be functioned and will get the benefit of additional water to 43 lacs beneficiaries in 612 villages and 20 towns of Urban Rural and Industrial areas of (1) Mahuva, Talaja of Bhavnagar District Rujula, Jafrabad Taluka of Amreli District (3) Una, Diu, Kodinar and Veraval of Gir - Somnath district

4. Navda to Chavand Bulk Pipeline project- 280 MLD (Cost Rs 644 Crores)

- As per the demand analysis from Navda to Gadhaha, it is found that the carrying capacity of existing pipeline is 500 MLD against the demand of 767 MLD at Gadhada Pumping station, it

is decided to lay down one more parallel pipeline from Navda to Chavand of 280 MLD and implementation works are carried out.

- The Necessary administrative approval for Rs. 644.08 Crore gross accorded by State Government
- The tender process is completed and works are awarded to I I Agency and works are started. The works will be completed on June 2022
- After completion of the project, scheme will be functioned and will get the benefit of additional water to 67 lacs beneficiaries in 1298 villages and 36 towns of Lirban Rural and Industrial areas of (1) Gadhada to Chavand Section of Botad District (2) Babra, Dhari and Savarkundala of Amreli District (3) Vadiya and Visavadar Taluka of Junagadh District (4) Gondal, Jetpur, Upleta, Dhoraji and Jamkondoma of Rajkot District and (5) Porbandar, Kutiya and Ranavav Talukas of Porbandar district

5. Replacement of Old Pumping Machinery and all allied Electro Mechanical Works at NC 3 Vallabhipur Pumping Station

This pumping station and existing electro-mechanical facility was commissioned in year of 2002. NC-3 is very important pumping station for supplying water towards B Network. The electro-mechanical equipment is 18 years old. Hence it is necessary to replace pump-set with allied electro-mechanical works for energy saving and smooth running of system. In this connection, GWIL has decided to replace the pumps and other electro-mechanical equipment with estimated cost of Rs. 14 Crores.

6. Replacement of Old Pumping Machinery and all allied Electro Mechanical Works at NC 7 Pumping Station

This pumping station and existing electro-mechanical facility was commissioned in year of 2002. NC-7 is very important pumping station for supplying water towards Jamnagar and industries. The electro-mechanical equipment is 18 years old. Hence it is necessary to replace pump-set with allied electro-mechanical works for energy saving and smooth running of system. In this connection, GWIL has decided to replace the pumps and other electro-mechanical equipment with estimated cost of Rs. 14 Crores.

7. Replacement of Old Pumping Machinery and all allied Electro Mechanical Works at Pipli Pumping Station

This pumping station and existing electro-mechanical facility was commissioned in year of 2000. Pipli is very important pumping station for supplying water towards B and D Network. The electro-mechanical equipment is 20 years old. Hence it is necessary to replace pump-set with allied electro-mechanical works for energy saving and smooth running of system. In this connection, GWIL has decided to replace the pumps and other electro-mechanical equipment with estimated cost of Rs. 15 Crores.

Gujarat Water Infrastructure Limited



Annual Report 2019-20

Gujarat Water Infrastructure Limited

(A Government of Gujarat Undertaking)

Dr. Jivraj Mehta Bhavan, Block No. 1, First Floor,
Sector - 10, Gandhinagar - 382010. GUJARAT

Ph: 079-23239537, M: 9978441147/48 Fax: 23222396

E-mail : gwilcompany1@gmail.com



GUJARAT WATER INFRASTRUCTURE LIMITED

21th Annual Report : 2019 - 20

I N D E X

Sr. No.	Details	Page No
1.	Board of Directors	02
2.	Notice of 21 st Annual General Meeting	03
3.	Board's Report	11
4.	Comments of the office of Comptroller & Auditor General of India on the Accounts of 2019-2020	22
5.	Independent Auditor's Report	45
6.	Balance Sheet	57
7.	Profit & Loss Account	58
8.	Cash Flow Statement	65
9.	Significant Accounting Policies	67
10.	Notes to the Financial Statements	70
11.	Proxy Form (MGT-11)	77
12.	Attendance Slip	78
13.	Short Notice Form	79



Board of Directors: (As on 03/03/2021)	(1) Shri Dhananjay Dwivedi, IAS	Chairman
	(2) Shri Roopwant Singh, IAS	Director
	(3) Shri Mayur Mehta, IAS	Managing Director
	(4) Shri S. B. Vasava	Director
	(5) Shri K. A. Patel	Director
	(6) Shri Nirav Solanki	Director
	(7) Shri R. D. Soni	Independent Director

Statutory Auditors : M/s. Kishan M. Mehta & Co.
Chartered Accountants,
Ahmedabad.

Bankers : (1) State Bank of India, (Formerly State Bank of Saurashtra)
Sector-11, Udhyog Bhavan,
Gandhinagar.
(2) Punjab National Bank
Sector-16, Gandhinagar.
(3) HDFC Bank
Sector-16, Gandhinagar.
(4) ICICI Bank
Sector-16, Gandhinagar.

Regd. Office : Dr. Jivraj Mehta Bhavan,
Block No. 1, First Floor,
Sector-10,
Gandhinagar-382010,
GUJARAT.



Gujarat Water Infrastructure Limited

(A Govt. of Gujarat Undertaking)

Dr. Jivraj Mehta Bhavan, Block No. 1, First Floor, Sector-10, Gandhinagar-382010.

NOTICE

To,
The Shareholders,

NOTICE IS HEREBY GIVEN THAT the **21st Annual General Meeting** of **Gujarat Water Infrastructure Limited (GWIL)** is scheduled to be held on **30th December, 2020** at **01:45 hours** of the **Board Room, GWIL, 1st Floor, Block No. 1, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar** to transact the following:

ORDINARY BUSINESS:-

1. To receive, adopt and approve the Audited Annual Financial Statements (standalone) of the Company for the financial year ended on 31st March, 2020 together with the reports of the Board of Directors, Auditors' and C&AG thereon.
2. To consider & fix remuneration of Statutory Auditors for the year 2020-2021.

For and on Behalf of the Board of Directors of
Gujarat Water Infrastructure Limited

Date: - 21/12/2020
Place:- Gandhinagar

sd/-
Mayur Mehta, IAS
Managing Director

NOTES:

- (1) The relevant Explanatory Statement pursuant to section 102 (1) of the Companies Act, 2013, in respect of Special Business at the meeting, is annexed hereto and forms part of this notice.



- (2) A member entitled to attend and vote is entitled to appoint a proxy to attend and vote instead of himself and the proxy need not be a member of the Company. Proxies in order to be effective must be received by the company not later than forty eight (48) hours before the meeting. Proxies submitted on behalf of limited companies, societies, etc., must be supported by appropriate resolutions/authority, as applicable.
- (3) Members are requested to bring their attendance slips duly completed and signed mentioning therein details.
- (4) In case of joint holders attending the Meeting, only such joint holder who is higher in the order of names will be entitled to vote in the Meeting.
- (5) Relevant documents referred to in the accompanying Notice and in the Explanatory Statements are open for inspection by the Members at the Company's Registered Office on all working days of the Company, during business hours up to the date of the Meeting.
- (6) Corporate Members intending to send their authorized representatives to attend the Meeting Pursuant to Section 113 of the Companies Act, 2013 are requested to send to the Company, a certified copy of the relevant Board Resolution together with their respective specimen signatures authorizing their representative(s) to attend and vote on their behalf in the Meeting.
- (7) Members seeking any information with regard to the Accounts are requested to write to the Company at an early date, so as to enable Management to keep information ready at the time of meeting.
- (8) An explanation to above items (1 & 2) (Annexure-A) is appended herewith as the part of a notice.

ANNEXURE: A

EXPLANATION REGARDING THE ORDINARY BUSINESS

ITEM NO. 1:

TO RECEIVE, CONSIDER AND ADOPT THE AUDITED FINANCIAL STATEMENT (STANDALONE) OF THE COMPANY FOR THE FINANCIAL YEAR ENDED ON 31ST MARCH, 2020 TOGETHER WITH THE REPORTS OF BOARD OF DIRECTORS, AUDITORS AND C&AG THEREON.

As per provisions of Section 96 of the Companies Act, 2013, every Company must hold General Meeting (GM) each year as its Annual General Meeting (AGM) and not more than 15 months shall elapse between two Annual General Meetings. Provided that Annual General Meeting shall be held within six months from the date of closing of the financial year i.e. up to 30th September, 2020. However, in view of Covid-19, Registrar of Companies has granted extension of time for holding an AGM for F.Y. 19-20 by 3(three) months i.e. up to 31st December, 2020.

In this AGM, GWIL, required to place Annual Financial Statements along with report of the Statutory Auditors, Directors report & C&AG reports for the F.Y. 2019-20.

Audit of Accounts of GWIL for F.Y. 19-20 is completed. Thereafter, audited Accounts duly approved by the Board along with report of Statutory auditors will be submitted to C&AG. Therefore, it may not be possible to receive final comments of C&AG on Financial Statements for F.Y. 19-20.

Therefore, GWIL may hold the AGM of the Company With the Shorter notice and adjourn the same sine die till the receipt of the final comments form C&AG on the Accounts of the company for the F.Y. 2019-20.

None of the directors are directly or indirectly interested in this resolution.

The members are requested to pass the following resolution with or without modification, as an Ordinary Resolution.

PROPOSED RESOLUTION:

“RESOLVED THAT Audited Annual Financial Statements (standalone) of the Company for the year ended on 31st March, 2020 i.e. Balance Sheet as at 31st March 2020, Profit and Loss Account for the period from 01.04.2019 to 31.03.2020 along with schedules thereto, significant Accounting Policies and Notes to Accounts



together with Board's Report, Statutory Auditor's Report and Report of Comptroller and Auditor General of India and Management's reply, be and are hereby considered and adopted."

ITEM NO.2:

TO CONSIDER & FIX REMUNERATION OF STATUTORY AUDITORS FOR THE YEAR 2020-21.

As per the provisions of Section 139 (5) of the Companies Act, 2013, the appointment of Statutory Auditors of the Government Company is to be made by the Comptroller and Auditor General of India within 180 days from the commencement of the financial year. As per Section 142 (1) of the Companies Act, 2013, the remuneration of Statutory Auditor has to be decided by the shareholders in the Annual General Meeting.

C&AG vide their letter no. CA.V/COY/GUJARAT, GJWATR (1)/ 793 dated 24/08/2020 appointed M/s Kishan M. Mehta & Co. (WR0370), Chartered Accountant, Ahmedabad as Statutory Auditors of the Company for the F.Y. 2020-21.

The Board of Directors vide resolution no. 95/8, dated 30th September, 2020 recommended to fix the remuneration of Rs. 1,50,000/- plus GST and actual travelling and other expenditure to the Statutory Auditors for the financial year 2020-21.

None of the directors are directly or indirectly interested in this resolution.

The members are requested to pass the following resolution with or without modification, as an Ordinary Resolution ;

PROPOSED RESOLUTION:

“RESOLVED THAT shareholders takes note of the appointment of M/s. Kishan M. Mehta & Co. (WR0370), Ahmedabad as Statutory Auditors made by C&AG vide letter no. CA.V/COY/GUJARAT, GJWATR (1)/ 793 dated 24/08/2020 and that approval be and is hereby accorded to fix the remuneration of Rs. 1,50,000/- plus GST and actual travelling and other expenditure to the Statutory Auditors for the Financial Year 2020-21 as recommended by the Board & audit Committee.

For and on behalf of Board of Directors of
GUJARAT WATER INFRASTRUCTURE LIMITED

Date : 21.12.2020
Place : Gandhinagar

Sd/-
Mayur Mehta, IAS
Managing Director



Gujarat Water Infrastructure Limited

(A Govt. of Gujarat Undertaking)

Dr. Jivraj Mehta Bhavan, Block No. 1, First Floor, Sector-10, Gandhinagar-382010.

NOTICE

To,
The Shareholders,

NOTICE IS HEREBY GIVEN THAT the 21st **Adjourned Annual General Meeting** of **Gujarat Water Infrastructure Limited (GWIL)** is scheduled to be held on **6th March, 2021 at 04:30 PM** of the **Board Room, 1st Floor, GWSSB Jalseva Bhavan, Gandhinagar, Gujarat** to transact the following:

ORDINARY BUSINESS:-

1. To receive, adopt and approve the Audited Annual Financial Statements (standalone) of the Company for the financial year ended on 31st March, 2020 together with the reports of the Board of Directors, Auditors' and C&AG thereon.

For and on Behalf of the Board of Directors of
Gujarat Water Infrastructure Limited

Date: - 04/03/2021
Place:- Gandhinagar

sd/-
Mayur Mehta, IAS
Managing Director

NOTES:

- (1) The relevant Explanatory Statement pursuant to section 102 (1) of the Companies Act, 2013, in respect of Special Business at the meeting, is annexed hereto and forms part of this notice.



- (2) A member entitled to attend and vote is entitled to appoint a proxy to attend and vote instead of himself and the proxy need not be a member of the Company. Proxies in order to be effective must be received by the company not later than forty eight (48) hours before the meeting. Proxies submitted on behalf of limited companies, societies, etc., must be supported by appropriate resolutions/authority, as applicable.
- (3) Members are requested to bring their attendance slips duly completed and signed mentioning therein details.
- (4) In case of joint holders attending the Meeting, only such joint holder who is higher in the order of names will be entitled to vote in the Meeting.
- (5) Relevant documents referred to in the accompanying Notice and in the Explanatory Statements are open for inspection by the Members at the Company's Registered Office on all working days of the Company, during business hours up to the date of the Meeting.
- (6) Corporate Members intending to send their authorized representatives to attend the Meeting Pursuant to Section 113 of the Companies Act, 2013 are requested to send to the Company, a certified copy of the relevant Board Resolution together with their respective specimen signatures authorizing their representative(s) to attend and vote on their behalf in the Meeting.
- (7) Members seeking any information with regard to the Accounts are requested to write to the Company at an early date, so as to enable Management to keep information ready at the time of meeting.
- (8) An explanation to above items (1) (Annexure-A) is appended herewith as the part of a notice.

ANNEXURE: A

EXPLANATION REGARDING THE ORDINARY BUSINESS

ITEM NO. 1:

TO RECEIVE, CONSIDER AND ADOPT THE AUDITED FINANCIAL STATEMENT (STANDALONE) OF THE COMPANY FOR THE FINANCIAL YEAR ENDED ON 31ST MARCH, 2020 TOGETHER WITH THE REPORTS OF BOARD OF DIRECTORS, AUDITORS AND C&AG THEREON.

As per provisions of Section 96 of the Companies Act, 2013, every Company must hold General Meeting (GM) each year as its Annual General Meeting (AGM) and not more than 15 months shall elapse between two Annual General Meetings. Provided that Annual General Meeting shall be held within six months from the date of closing of the financial year ROC-gujarat has granted general extension in view of Covid-19 to all the Companies in the State of Gujarat to hold AGM by period 3 months i.e. up to 31Th December, 2020. Accordingly, 21st Annual Genral Meeting (AGM) to GWIL was held on 30th December 2020 and the same was adjourned sine die till receipt of final comments of C&AG on the Financial Statements for the F.Y. 2019-20.

Annual Financial Statements of the Company for the F.Y. 2019-20 audited by M/S Kishan M. Mehta & Co., Chartered Accountants, Ahmedabad were approved at 96th Board meeting held on 30th Decembe, 2020. Thereafter, Financial Statements along with report of the Statutory Auditors were submitted to C&AG and C&AG has compeleted their supplimentary audit.

Final Comments from C&AG on the financial statements for the F.Y. 2019-20 has been received vide therletter no. Tech. S.Cell/S-2/Comments/GWIL/ 2019-20/OW No.234 dated 17.02.2021. Therefore, 21st adjourned Annual General meeting of the Company is called with shorter notice.

None of the directors are directly or indirectly interested in this resolution.

The members are requested to pass the following resolution with or without modification, as an Ordinary Resolution.



PROPOSED RESOLUTION:

“RESOLVED THAT Audited Annual Financial Statements (standalone) of the Company for the year ended on 31st March, 2020 i.e. Balance Sheet as at 31st March 2020, Profit and Loss Account for the Financial Year 2019-20, along with schedules thereto, Significant Accounting Policies and Notes to Accounts together with Board’s Report, Statutory Auditors Report and Report of Comptroller and Auditor General of India and the Management’s reply, be and are hereby considered and adopted.”.

For and on behalf of Board of Directors of
GUJARAT WATER INFRASTRUCTURE LIMITED

Date : 04.03.2021
Place : Gandhinagar

Sd/-
Mayur Mehta, IAS
Managing Director



GUJARAT WATER INFRASTRUCTURE LIMITED

CIN- U41000GJ1999SGC036777

Registered Office:

Dr. Jivraj Mehta Bhavan, Block No 1, First Floor, Sector-10, Gandhinagar-382010.

BOARD'S REPORT

To,
The Members,

Your Directors have pleasure in presenting 21st Annual Report on the business and operations of the Company and the accounts for the Financial Year ended on March 31st, 2020.

- Financial summary or highlights/Performance of the Company** (Stand-alone)
The Board's Report is prepared based on the standalone financial statements of the company.

(Rs. in Crore)

Particulars	2019-2020	2018-2017
Revenue from Operations (A)	457.11	374.13
Other Income		
• Interest & Other Income	87.98	74.04
• Deferred Grant Income	276.90	254.78
• Revenue Grant Income	1.00	3.75
Total Other Income (B)	365.88	332.57
Total Revenue (A)+(B)	822.99	706.70
Cost of Materials Consumed	246.36	180.92
Power Chargers	358.96	334.51
Other Administrative Expenses	41.93	38.48
Depreciation and amortization	277.65	255.69
Total Expenses	924.90	809.60
Profit/ Loss Before Exceptional & Extra Ordinary items & Tax	-101.91	-102.90
Exceptional Items	5.17	0.22
Tax Expenses		
(a) Current Tax		
(b) Deferred Tax	-0.03	-0.02
Loss for the Year (+/-)	-96.78	-102.71
Earnings/Loss per share Basic/Diluted(+/-)	-6.43	-6.87



2. (I) Works undertaken by the Company during the year (F.Y. 19-20):

(A) Desalination Project implementation in Saurashtra and Kutch Region:

In order to reduce the dependency on Narmada water as well as State water supply grid and also to provide water security, Gujarat Government has decided to establish the various desalination plants to convert the sea water in potable water by using 1600 km long sea coast at different places of Gujarat.

Government of Gujarat has decided to implement seven desalination plants at sea coast like (1) At village Gandhvi Village in Devbhoomi Dwarka District-70 MLD (2) At Ghogha Village in Bhavnagar District-70 MLD (3) At Vadodara Zala Village in Sutrapada Taluka of Gir Simnath-30 MLD (4) At village Gundiyaali of Mandvi Taluka of Kutch District-100 MLD.

The letter of Award is issued to consortium of Shapoorji Pallonji and Company Private Limited, Mumbai and Aquatech System Asia Private Limited on Date 18-11-2019 for all four locations.

M/S Shapoorji Paloonji and Company Private Limited, Mumbai and Aquatech System Private Limited has formed Special Purpose Vehicle for all four locations on Date 26-12-2019. Concession Agreement is signed for all projects by all four SPV on Date 26-2-2020.

The process of getting Environmental Clearances and Financial closure for each project is taken up by all SPV during the year.

(B) Bhrahmani Dam – II to NC – 7 Morbi Pumping Station Project:

In order to lift 300 MLD water from Brahmani – II Dam to NC – 7 Pumping Station near Nava Sadulka, following works were taken up:

Package – 1	Works of Approach Channel, Intake well cum Pump House, Approach bridge, Panel room, switch yard, Design, Engineering, Supply, Installation, Testing and Commissioning works of Pumping Machinery and Supplying, Lowering, Laying, Jointing, Testing and Commissioning of MS pipe (2028 mm dia 500 m and 1200 mm dia 350m)
--------------------	---

Package – 2	Works of laying 18.40 Km long 2028 mm dia MS Pipeline from Bhrahmani Dam- 2 to Chakampar Village canal crossing road.
Package – 3	Works of laying 14.60 km long 2028 mm Dia MS Pipeline from Chakampar Village canal crossing road to Nava Sadulka Pumping Station

The execution works for above packages were carried out during the year. Presently the works are under progress for all three packages.

(II) Projects under planning:

(A) Navada-Gadhdha to Chavand Bulk Pipeline:

- In order to provide future water demand towards Chanvand from navda, it is planned to lay pipeline from Navda to Gadhdha 52 Kms and Gadhdha to Chavand 33.5 km total 85.5 km having 280 MLD from Navda and 200 MLD towards Chavand with estimated cost of Rs. 644 Crores.
- The following works are included in this project
 1. 85 Km Pipeline from Navda-Gadhada to Chavand
 2. Construction of Pump House at Navda and Gadhada
 3. Pumping Machinery at Navda, Gadhada
 4. Construction of RCC Raw water Sump at Navda, Gadhada and Chavand
 5. Miscellaneous works at Navda, Gadhada and Chavand Pumping Station like RCC Approach Road, Compound wall etc.
 6. 10 Years O & M
- The tenders for the works are awarded in month October 2020 and physical work has been started.
- After completion of scheme, the water security will be provided to the 67 lacs beneficiaries of 1298 villages and 36 cities of Rural and Urban and Industrial areas of Botad, Amreli, Junagadh, Rajkot and Porbandar areas

(B) Budhel to Borda Bulk Pipeline

- In order to provider future water demand towards Bhavnagar, Amreli and Gir Somnath District having 180 MLD, it is planned to lay Pipeline from Budhel to Borda 58.00 km with estimated cost of Rs. 376 Crores.



- The following works are included in this project
 1. 58 Km Pipeline from Budhel to Borda
 2. Construction of Pump House at Budhel
 3. Pumping Machinery at Budhel
 4. Construction of RCC Raw water Sump at Budhel
 5. Miscellaneous works at Budhel Pumping Station like RCC Approach Road etc.
 6. 10 Years O & M
- The tenders for the works are awarded in month October 2020 and physical work has been started.
- After completion of scheme, the water security will be provided to the 43 lacs beneficiaries of 612 villages and 20 cities of Rural and Urban and Industrial areas of Bhavnagar, Amreli and Gir Somnath areas.

(c) Replacement of Old Pumping Machinery and all allied Electro Mechanical works at NC 7 Pumping Station

NC 7 (Morbi) pumping station and existing electro-mechanical facility was commissioned in year of 2002. NC-7 is very important pumping station for supplying water towards Jamnagar, Rajkot & Morbi Districts The electro-mechanical equipment is 18 years old. Hence it is necessary to replace pump set with allied electro mechanical works for energy saving and smooth running of system. In this connection, GWIL has decided to replace the pumps and other electro mechanical equipment with estimated cost of Rs. 14 Crores.

(D) Replacement of Old Pumping Machinery and all allied Electro Mechanical works at NC 3 Vallabhipur Pumping Station

NC 3 Vallabhipur pumping station and existing electro-mechanical facility was commissioned in year of 2002. NC-3 Pumping station at Vallabhipur Pumping station is very important pumping station for supplying water for Beneficiaries of Urban, Rural areas and industries of Bhavnagar, Amreli and Gir Somnath Districts upto Veraval. The electro-mechanical equipment is 18 years old. Hence it is necessary to replace pump-set with allied electro-mechanical works for energy saving and smooth running of system. In this connection, GWIL has decided to replace the pumps and other electro-mechanical equipment with estimated cost of Rs. 12 Crores.

(E) Replacement of Old Pumping Machinery and all allied Electro Mechanical works at Pipli Pumping Station

Pipli pumping station and existing electro-mechanical facility was commissioned in year of 2000. Pipli is very important pumping station for supplying water towards B and D Network. The electro-mechanical equipment is 20 years old. Hence it is necessary to replace pump-set with allied electro-mechanical works for energy saving and smooth running of system. In this connection, GWIL has decided to replace the pumps and other electro-mechanical equipment with estimated cost of Rs. 11 Crores

(F) Replacement of Old Pumping Machinery and all allied Electro Mechanical works at Sukhpar Pumping Station

Sukhpar pumping station and existing electro-mechanical facility was commissioned in year of 2003. Sukhpar is very important pumping station for supplying water towards Mandvi, Nakhtrana, Lakhpat and Abdasa Talukas upto Khirsara. The electro-mechanical equipment is 17 years old. Hence it is necessary to replace pump-set with allied electro-mechanical works for energy saving and smooth running of system. In this connection, GWIL has decided to replace the pumps and other electro-mechanical equipment with estimated cost of Rs. 12 Crores

(G) Replacement of Old Pumping Machinery and all allied Electro Mechanical works at Mangwana Pumping Station

Mangwana pumping station and existing electro-mechanical facility was commissioned in year of 2003. Magwana is very important pumping station for supplying water towards Nakhtrana, Lakhpat and Abdasa Talukas upto Khirsara. The electro-mechanical equipment is 17 years old. Hence it is necessary to replace pump-set with allied electro-mechanical works for energy saving and smooth running of system. In this connection, GWIL has decided to replace the pumps and other electro-mechanical equipment with estimated cost of Rs. 10 Crores

3. Change in the nature of business, if any:

There is no change in the nature of business of the Company.

4. Dividend:

The company has suffered loss during the financial Year. Your directors do not recommend any dividend for the year ended on 31st March, 2020.

5. Reserves:

During the Financial Year, your company has suffered loss pf Rs.96.78 crore. The entire amount of loss is transferred under the head Reserve and Surplus Account.



6. Share Capital:

Authorized Share Capital of the Company is Rs. 1,75,00,00,000/- (Rupees one Hundred Seventy Five Crores) divided into 17,50,00,000 Equity shares of Rs. 10/- each and Issued, Subscribed & Paid up share Capital of the company is Rs.1,55,02,000,700/- (Rupees one hundred Fifty Five Crores Two Lacs Seven Hundred Only,) divided into 15,50,20,070 equity share of Rs.10/- each as on 31st March, 2020.

7. Directors and Key Managerial Personnel:

From the 01st April, 2019 to till date of report, the changes that have been occurred in Board of Directors as per orders of State Government from time to time are as per **ANNEXURE – A**.

8. Particular of Employees:

Your company is not a Listed Company and hence provisions of section 197 (12) and Companies (Appointment and Remuneration of Managerial Personal) Rules, 2014, regarding furnishing of statement of particulars of employees is not applicable to the Company.

9. Board Meetings:

During this year, three Board Meeting were convened and held on 21/06/2019, 25/10/2019 and 22/01/2020.

10. Audit Committee Meetings

During the year, two Audit Committee Meetings were convened and held on 21/06/2019 and 22/01/2020.

11. Composition of Audit Committee :

Following were members of the Audit Committee as on 31/03/2020.

Sr. No.	Name	Designation
1.	Shri Roopwant Singh, IAS Secretary (Expenditure) Finance Dpt. (Chairman-Audit Committee)	Chairman
2.	Shri R.D. Soni, Independent Director, GWIL (Member)	Member
3.	Dr. Gargi Rajpara, Woman & Independent Director, GWIL (Member)	Member

The Board has considered all recommendations made by the Audit Committee during the year.

12. Board Evaluation:

Appointments of Board of Directors are made by the State Government. As per the Ministry of Corporate Affairs, Government of India notification dated 05.06.2015, Government Companies are exempted from the provision of sub-section 3 clause (p) of section 134 of the Companies Act, 2013. your company being a Government Company, Provision of Board Evaluation is not applicable.

13. Auditor's Reports and C&AG Report:

(A) Auditor's Reports:

M/S Kishan M Mehta & co. (WR0370), Chartered Accountant, Ahmedabad was appointed as Statutory Auditors of the Company for the year 2019-20 by the comptroller and Auditor General of India, vide letter no. CA.V/COY/GUJARAT, GJWATR(1)/1537 dated 23/08/2019. Statutory Auditors has given their independent report on financial statement based on their audit on 30th December 2020.

(B) C&AG Reports for the F.Y. 2019-20:

Final Comments of C&AG on financial statement of the company for the F.Y. 19-20 is received from C&AG vide letter dated 17.02.2021 (**ANNEXURE – B**). Management reply on final comment of C&AG is placed as **ANNEXURE – C**.

14. Internal Audit & Controls:

Internal Auditors, M/s. N P K U & Associates, Reports findings are discussed with the Audit Committee and suitable corrective actions taken as per the directions on an ongoing basis to improve efficiency in operations.

15. Risk Management Policy:

Risk management Policy is not implemented.

16. Extract of Annual Return:

As required pursuant to provision of section 92(3) of the Companies Act, 2013 and Rule 12 (1) of the Companies (Management and Administration) Rules, 2014, an extract of Annual Return in MGT – 9 as a part of this Annual Report is as per **ANNEXURE – D**.



17. Material Changes and Commitments affecting Financial Position of the company:

There are no material changes and commitments, if any, affecting the financial position of the company during the year under review.

18. Significant and material orders passed by the regulators or courts or tribunals impacting the going concern status of the company:

During the year no significant and material orders passed by the regulators or courts or tribunals impacting the going concern status and company's operation in future.

19. Particulars of Loans, Guarantees or Investments under section 186:

Detail of Loans: NIL

Details of Investments: NIL

Details of Guarantee / Security Provided: NIL

20. Particulars of contracts or arrangements with related parties:

The particulars of every contract or arrangements entered into by the company with related parties referred to in sub-section (1) of section 188 of the Companies Act, 2013 during the F.Y. 2019-20 in prescribed from AOC-2 is placed as **ANNEXURE – E**.

21. Conservation of Energy, Technology Absorption and Foreign Exchange Earnings and Outgo:

The Company (Accounts) Rules, 2014, regarding the conservation of energy, technology absorption are applicable to the Company:

(A) Foreign Exchange Earnings and Outgo: NIL

22. Corporate Social Responsibility (CSR):

As per section 135 of Companies Act, 2013, Company has formed CSR Committee. However, question of transfer/spending of 2% of profit of the Company did not arise since company have not earned profit in last three out of three immediately preceding financial year. Hence, Company is not required to spend on CSR activities as per section 135 of the Companies Act, 2013 and rules made there under.

23. Secretarial Audit Report:

Secretarial Audit Report submitted by M/S Gaudana & Gaudana, Practicing Company Secretaries as per the requirement of the Companies Act, 2013 is attached with the Board's Report as **ANNEXURE – F**.

24. Director's Responsibility Statement:

The Director's Responsibility Statement referred to in clause (c) of sub-section (3) of Section 134 of the Companies Act, 2013, shall state that---

- a. In the preparation of the annual accounts, the applicable accounting standards had been followed along with proper explanation relating to material departures;
- b. The directors had selected such accounting policies and applied them consistently and made judgements and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the company at the end of financial year and of the profit and loss of the company for that period;
- c. The directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of the companies Act, 2013 for safeguarding the assets of the company and for preventing and detecting fraud and other irregularities;
- d. The directors had prepared the annual accounts on a going concern basis; and
- e. The directors had devised proper system to ensure compliance with the provisions of all applicable laws and that such system were adequate and operating effectively.

25. Transfer of Amounts to Investors Education and Protection Fund

Your Company is not required to transfer any amounts to Investors Education and Protection Fund as it has never declared dividend.

26. Acknowledgment:

Your Directors express their warm wish to place on record their sincere appreciation to the Co-Operation extended by the Registrar of Companies, Comptroller & Auditor General of India and Statutory Auditors. The directors are also grateful to the Government of Gujarat, GWSSB, Bankers, Officers and staff of the company for their co-operation and look forward for their continued support.

For and on behalf of the Board of Directors of
Gujarat Water Infrastructure Limited

Date:- 06/03/2021

Place:- Gandhinagar

Mayur Mehta, IAS
Managing Director
DIN : 08842155

Nirav Solanki
Director
DIN : 08750494



GWIL

Board's Report

ANNEXURE INDEX

<u>Annexure</u>	<u>Content</u>
A.	Details of Changes in Key Managerial Personnel & Board of Directors from 01/04/2019 to till Date of report
B.	Comments of the C&AG on the Financial Statements for the F.Y. 19-20.
C.	Management Reply on Final Comments of C&AG
D.	Annual Return Extracts in MGT-9
E.	Particulars of Contracts or Arrangements with related parties in Form AOC-2
F.	Secretarial Audit Report

Annexure - A

Details of Changes in Key Managerial Personnel &
Board of Directors from 01/04/2019 to till date of report :

Sr. No.	Name of Directors	DIN/ PAN	Designation	Date of Appointment	Date of Cessation
1	Shri J. P. Gupta, IAS	01952821	Chairman	14/07/2017	30/09/2019
2	Shri Dhananjay Dwivedi, IAS	07260908	Chairman	30/09/2019	Continue
3	Shri Milind Torawane, IAS	03632394	Director	14/07/2017	30/09/2019
4	Shri Roopwant Singh, IAS	06717937	Director	30/09/2019	Continue
5	Shri M. K. Jadav	01193143	Director	06/08/2015	30/09/2019
6	Shri K. A. Patel	07619743	Director	30/09/2019	Continue
7	Shri Sandeep Vasava	02037918	Director	14/12/2016	Continue
8	Shri Tushar Dholakia, IAS	07600044	Managing Director	22/06/2016	30/09/2019
9	Shri K. K. Nirala, IAS	-	Managing Director	11/09/2019	29/11/2019
10	Shri R. S. Ninama, IAS	08745698	Managing Director	03/02/2020	05/06/2020
11	Shri Mayur Mehta, IAS	08842155	Managing Director	05/06/2020	Continue
12	Shri Ravi Solanki	03618829	Director	25/08/2011	30/09/2019
13	Shri Nirav Solanki	08750494	Director	30/09/2019	Continue
14	Shri R. D. Soni	00559973	Independent Director	14/10/2014	Continue
15	Dr. Gargi Rajpara	07011076	Woman & Independent Director	14/10/2014	28/09/2020
16	Shri S. G. Patel	AAZPP4693F	CFO	28/03/2019	03/09/2019
17	Shri B. J. Dave	AEEPDP5651C	CFO	25/10/2019	19/05/2020
18	Shri Jaldeep Dave	ACGPD5769B	CFO	19/05/2020	Continue



ANNEXURE - B

Comments of the Comptroller and Auditor General of India Under Section 143 (6) (b) of The Companies Act, 2013 on the Financial Statement of Gujarat Water Infrastructure Limited, Gandhinagar for the year ended on 31 March, 2020.

The Preparation of financial Statements of Gujarat Water Infrastructure Limited, Gandhinagar (GWIL) for the year ended 31 March 2020 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 is the responsibility of the Management of the Company. The Statutory Auditor appointed by the Comptroller and Auditor General of India under section 139 (5) of the Act, are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act, based on independent audit in accordance with the standards on auditing prescribed under section 143 (10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated 30th December, 2020.

I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit under section 143 (6) (a) of the Act of the financial statements of Gujarat Water Infrastructure Limited, Gandhinagar for the year ended 31st March 2020. This supplementary audit has been carried out independently without access to the working papers of the statutory auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records. Based on my supplementary audit, I would like to highlight the following significant matters under Section 143 (6) (b) of the Act which have come to my attention and which in my view are necessary for enabling a better understanding of the financial statements and the related Audit Reports:

A. Comments on Financial Position

Balance Sheet

1. Other Current Liabilities (Note 8) Rs. 54.63 crore

The above balance includes power charges of Rs.15.14 crore payable to the electricity company for the consumption of electricity used in the ordinary course of business for distribution of water. Hence, it should have been depicted as Trade Payable



(Note -7) instead of Other Current Liabilities. This led to understatement of Trade Payable (Note-7) and overstatement of Other Current Liabilities by Rs. 15.14 Crore.

2. None- Current Assets

Capital Work-in-Progress Rs. 265.52 crore

This does not include capital expenditure amounting to Rs. 85.05 lakh for two works executed during / Pertaining to year 2019-20 for which payments were made in year 2020-21 Non provisioning for the aforesaid capital expenditure in the accounts of 2019-20 resulted in understatement of CWIP/ Capital Expenditure and Other Current Liabilities (Note -8) by Rs. 85.05 Lakh.

For and on behalf of the
Comptroller & Auditor General of India

Sd/-

(Yashwant Kumar)

**Principal Accountant General (Audit-I)
Rajkot, Gujarat.**

Place : Rajkot

Date : 17/02/2021



ANNEXURE - C

Management Reply on Final Comments of comptroller and Auditor General of India under section 143 (6)(b) of the companies Act, 2013 on the Financial Statements of Gujarat Water Infrastructure Limited, Gandhinagar for the year ended 31st March 2020.

Sr. No.	Comments of Financial Position	Management Reply
1.	<p>A. Comments on Financial Position</p> <p>Balance Sheet</p> <p>Other Current Liabilities</p> <p>(Note -8) Rs.54.63 Crore.</p> <p>The above balance includes power charges of Rs.15.14 Crore payable to the electricity company for the consumption of electricity used in the ordinary course of business for distribution of water. Hence, it should have been depicted as Trade Payable (Note-7) instead of Other Current Liabilities. This led to understatement of Trade Payable (Note-7) and overstatement of Other Current Liabilities by Rs. 15.14 Crore.</p>	<p>The suggestion of the audit have been noted and necessary changes will be made in the accounts of 2020-21 on wards.</p>
2.	<p>Non-current Assets</p> <p>Capital Work in Progress</p> <p>Rs. 265.52 Crore</p> <p>This does not include capital expenditure amounting to Rs. 85.05 lakh for two works executed during / pertaining to year 2019-20 for which payments were made in year 2020-21. Non provisioning for the aforesaid capital expenditure in the accounts of 2019-20 resulted in understatement of CWIP/ Capital Expenditure and Other current Liabilities (Note-8) by Rs. 85.05 Lakh.</p>	<p>The observation of the audit has been noted and due care will be taken now onwards to make such provision for expenditure.</p>



Annexure-D
FORM NO. MGT 9
EXTRACT OF ANNUAL RETURN

As on financial year ended on 31.03.2020

Pursuant to Section 92 (3) of the Companies Act, 2013 and rule 12(1) of the Company (Management & Administration) Rules, 2014

I. REGISTRATION AND OTHER DETAILS:

1.	CIN	U41000GJ1999SGC036777
2.	Registration Date	25.10.1999
3.	Name of the Company	GUJARAT WATER INFRASTRUCTURE LIMITED
4.	Category / Sub- Category of the Company	Company Limited by Shares / State Govt Company
5.	Address of the Registered office & Contact Details	Dr. Jivraj Mehta Bhavan, Block No. 1, 1st Floor, Sector-10, Gandhinagar-382010.
6.	Whether Listed Company	No.
7.	Name, Address & Contact Details of the Registrar & Transfer Agent, if any.	NA

II. PRINCIPAL BUSINESS ACTIVITIES OF THE COMPANY (All the business activities contributing 10 % or more of the total turnover of the company shall be stated)

SN	Name and Description of main products / services	NIC Code of the Product/service	% to total turnover of the company
1	Collection, Purification and distribution of water	41	100%

III. PARTICULARS OF HOLDING, SUBSIDIARY AND ASSOCIATE COMPANIES
[No. of Companies for which information is being filled]

SN	NAME AND ADDRESS OF THE COMPANY	CIN/GLN	HOLDING/ SUBSIDIARY / ASSOCIATE
	NIL	NIL	NIL



IV. SHARE CAPITAL, DEBENTURES AND OTHER SECURITIES OF THE COMPANY

i) Share Capital

a) Authorized Capital.

Class of Shares	No. of shares	Nominal Value per share (Rs.)	Total Nominal value of shares (Rs.)
Equity Share :-			
At the beginning of the year	15,00,00,000	10	150,00,00,000
Changes during the year (Increase)	2,50,00,000	10	25,00,00,000
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	17,50,00,000	10	175,00,00,000
Preference Share :-			
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase)	NIL	NIL	NIL
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Unclassified Shares			
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase)	NIL	NIL	NIL
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Total Authorized Capital at the beginning of the year	15,00,00,000	10	150,00,00,000
Total Authorized Capital at the end of the year	17,50,00,000	10	175,00,00,000

b) Issued Share Capital

Class of Shares	No. of shares	Nominal Value per share (Rs.)	Total Nominal value of shares (Rs.)
Equity Share :-			
At the beginning of the year	14,96,03,370	10	1,49,60,33,700
Changes during the year (Increase)	54,16,700	10	5,41,67,000
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	15,50,20,070	10	1,55,02,00,700

Preference Share :-			
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase)	NIL	NIL	NIL
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Total Issued Share Capital at the beginning of the year	14,96,03,370	10	1,49,60,33,700
Changes during the year (Increase)	54,16,700	10	5,41,67,000
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
Total Issued Share Capital at the end of the year	15,50,20,070	10	1,55,02,00,700

c) Subscribed Share Capital

Class of Shares	No. of shares	Nominal Value per share (Rs.)	Total Nominal value of shares (Rs.)
Equity Share :-			
At the beginning of the year	14,96,03,370	10	149,60,33,700
Changes during the year (Increase)	54,16,700	10	5,41,67,000
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	15,50,20,070	10	1,55,02,00,700
Preference Share :-			
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase)	NIL	NIL	NIL
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Total Subscribed Share Capital at the beginning of the year	14,96,03,370	10	149,60,33,700
Changes during the year (Increase)	54,16,700	10	5,41,67,000
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
Total Subscribed Share Capital at the end of the year	15,50,20,070	10	1,55,02,00,700



d) Paid up Share Capital

Class of Shares	No. of shares	Nominal Value per share (Rs.)	Total Nominal value of shares (Rs.)
Equity Share :-			
At the beginning of the year	14,96,03,370	10	149,60,33,700
Changes during the year (Increase)	54,16,700	10	5,41,67,000
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	15,50,20,070	10	1,55,02,00,700
Preference Share :-			
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase)	NIL	NIL	NIL
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Total Subscribed Share Capital at the beginning of the year	14,96,03,370	10	149,60,33,700
Changes during the year (Increase)	54,16,700	10	5,41,67,000
Changes during the year (Decrease)	NIL	NIL	NIL
Total Subscribed Share Capital at the end of the year	15,50,20,070	10	1,55,02,00,700

e) (i) Details of stock split / consolidation during the year (for each class of shares):

Class of shares	Before split /consolidation	After split / Consolidation
Number of shares	NIL	NIL
Face value per share	NIL	NIL

ii) Debentures

Type of Debentures	No. of Debentures	Nominal Value per Debentures (Rs.)	Total Nominal value of Debentures [Rs.]
Non-convertible (for each type):-			
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase/Redemption)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Partly-convertible (for each type)	NIL	NIL	NIL
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase/Redemption)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Fully-convertible (for each type)	NIL	NIL	NIL
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase/Converted)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Total Amount of Debentures	NIL	NIL	NIL
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year (Increase/Redemption/Converted)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL

iii) Other Securities-

Type of Securities	No. of Securities	Nominal Value of each Unit (Rs.)	Total Nominal Value (Rs.)	Paid up Value of each Unit (Rs.)	Total Paid up Value (Rs.)
NIL	NIL	NIL	NIL	NIL	NIL

iv) Securities Premium Account-

Class of Securities on which premium received	No. of Securities	Premium per unit [Rs.]	Total Premium [Rs.]
Premium on Equity [specify for each type]			
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year			
1. Increase	NIL	NIL	NIL
i. Public Issue	NIL	NIL	NIL
ii. Private Placement / Preferential Allotment	NIL	NIL	NIL



iii. ESOS	NIL	NIL	NIL
iv. Conversion – Pref. shares / Debentures	NIL	NIL	NIL
v. Conversion into equity	NIL	NIL	NIL
vi. GDR / ADR	NIL	NIL	NIL
vii. Others please specify.....	NIL	NIL	NIL
2. Decrease	NIL	NIL	NIL
i) Utilization for issue of bonus shares	NIL	NIL	NIL
ii)	NIL	NIL	NIL
iii)	NIL	NIL	NIL
At the end of the year	NIL	NIL	NIL
Premium on Other Securities	NIL	NIL	NIL
At the beginning of the year	NIL	NIL	NIL
Changes during the year	NIL	NIL	NIL
1) Increase –Fresh issue	NIL	NIL	NIL
2) Decrease-Premium on redemption	NIL	NIL	NIL
At end of the year	NIL	NIL	NIL
Total securities premium at the Beginning of the year	NIL	NIL	NIL
Change during the year	NIL	NIL	NIL
Increase	NIL	NIL	NIL
Decrease	NIL	NIL	NIL
Total securities premium at the end of the year	NIL	NIL	NIL

V. TURNOVER AND NET WORTH OF THE COMPANY (AS DEFINED IN THE ACT)

(i) Turnover:

- Turnover at the end of the financial year: **Rs. 457.11 Cr.**

(ii) Net worth of the Company:

- Net worth at the end of the financial year: **Rs. 4761.65 Cr.**

VI. SHARE HOLDING PATTERN (Equity Share Capital Breakup as percentage of Total Equity)

Category-wise Share Holding



VI. SHARE HOLDING PATTERN (Equity Share Capital Breakup as percentage of Total Equity)

i) Category-wise Share Holding

Category of Shareholders	No. of Shares held at the beginning of the year [As on 31-March-2019]				No. of Shares held at the end of the year [As on 31-March-2020]				% Change during the year
	De mat	Physical	Total	% of Total Shares	De mat	Physical	Total	% of Total Shares	
A. Promoters									
(1) Indian									
a) Individual/ HUF	NIL	70	70	NIL	NIL	70	70	NIL	NIL
b) Central Govt	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
c) State Govt(s)	NIL	14,96,03,300	14,96,03,300	100	NIL	15,50,20,000	15,50,20,000	100	NIL
d) Bodies Corp.	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
e) Banks / FI	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
f) Any other	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Total shareholding of Promoter (A)	NIL	14,96,03,370	14,96,03,370	100	NIL	15,50,20,070	15,50,20,070	100	NIL
B. Public Shareholding									
1. Institutions									
a) Mutual Funds	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
b) Banks / FI	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
c) Central Govt	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
d) State Govt(s)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
e) Venture Capital Funds	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
f) Insurance Companies	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
g) FIIs	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
h) Foreign Venture Capital Funds	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL



i) Others (specify)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Sub-total (B)(1):-	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
2. Non-Institutions									
a) Bodies Corp.	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
i) Indian	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
ii) Overseas	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
b) Individuals	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
i) Individual shareholders holding nominal share capital upto Rs. 1 lakh	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
ii) Individual shareholders holding nominal share capital in excess of Rs 1 lakh	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
c) Others (specify)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Non Resident Indians	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Overseas Corporate Bodies	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Foreign Nationals	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Clearing Members	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Trusts	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Foreign Bodies - D R	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Sub-total (B)(2):-	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Total Public Shareholding (B)=(B)(1)+(B)(2)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL

C. Shares held by Custodian for GDRs & ADRs	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Grand Total (A+B+C)	NIL	14,96,03,370	14,96,03,370	100	NIL	15,50,20,070	15,50,20,070	100	NIL

B) Shareholding of Promoter

Sr.	Shareholder's Name	Shareholding At The Beginning Of The Year as on 01.04.2019			Share holding At The End Of The Year as on 31.03.2020			% Change In Shareholding During The Year
		No. Of Shares	% Of Total Shares Of The Company	%Of Shares Pledged / Encumbered To Total Shares	No. Of Shares	% Of Total Shares Of The Company	%Of Shares Pledged / Encumbered To Total Shares	
1	Hon'ble Governor of Gujarat Jointly with Shri Dhananjay Dwivedi, IAS	NIL	NIL	NIL	10	NIL	NIL	NIL
2	Hon'ble Governor of Gujarat Jointly with Smt. K.K. Nirala, IAS	NIL	NIL	NIL	10	NIL	NIL	NIL
3	Hon'ble Governor of Gujarat Jointly with Shri. Nirav Solanki, IAS	NIL	NIL	NIL	10	NIL	NIL	NIL
4	Hon'ble Governor of Gujarat Jointly with Shri J.P Gupta, IAS	10	NIL	NIL	NIL	NIL	NIL	NIL
5	Hon'ble Governor of Gujarat Jointly with Shri H.G. Raj	10	NIL	NIL	10	NIL	NIL	NIL
6	Hon'ble Governor of Gujarat Jointly with Shri. Tushar Dholakia, IAS	10	NIL	NIL	NIL	NIL	NIL	NIL
7	Hon'ble Governor of Gujarat Jointly with Shri Ravi Solanki	10	NIL	NIL	NIL	NIL	NIL	NIL
8	Hon'ble Governor of Gujarat Jointly with Smt. D.B. Vyas	10	NIL	NIL	10	NIL	NIL	NIL
9	Hon'ble Governor of Gujarat Jointly with Shri S.J. Mehta	10	NIL	NIL	10	NIL	NIL	NIL
10	Hon'ble Governor of Gujarat Jointly with Shri J. L. Gohil	10	NIL	NIL	NIL	NIL	NIL	NIL



11	Hon'ble Governor of Gujarat Jointly with Shri G.B. Tadavi	NIL	NIL	NIL	10	NIL	NIL	NIL
12	Hon'ble Governor of Gujarat	14,96,03,300	99.99	NIL	15,50,20,000	99.99	Nil	NIL
	TOTAL	14,96,03,370	100	NIL	15,50,20,070	100	NIL	NIL

Note : All the individual are Government officials and holding shares as nominee of the Government of Gujarat

C) Change in Promoters' Shareholding (please specify, if there is no change)

SN	Particulars	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	No change in promoters shareholding during the year			
	Date wise Increase/ Decrease in Promoters shareholding during the year specifying the reasons for increase/ decrease (e.g. allotment/transfer/ bonus/ sweat equity etc.).				
	At the end of the year				

**D) Shareholding Pattern of top ten Shareholders:
(Other than Directors, Promoters and Holders of GDRs and ADRs):**

SN	For Each of the Top 10 Shareholders	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	NIL	NIL	NIL	NIL
	Date wise Increase/ Decrease in Promoters shareholding during the year specifying the reasons for increase/ decrease (e.g. allotment/transfer/ bonus/ sweat equity etc.).	NIL	NIL	NIL	NIL
	At the end of the year	NIL	NIL	NIL	NIL

E) Shareholding of Directors and Key Managerial Personnel:

SN	Shareholding of each Directors and each Key Managerial Personnel	Shareholding at the beginning/ end of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
1	Shri J.P. Gupta, IAS At the beginning of the year	10	-	-	-
	Increase / Decrease	10	-	-	-
	At the end of the year	-	-	-	-
2	Shri Dhananjay Dwivedi, IAS At the beginning of the year	-	-	-	-
	Increase / Decrease	10	-	-	-
	At the end of the year	10	-	-	-
3	Shri Tushar Dholakia, IAS At the beginning of the year	10	-	-	-
	Increase / Decrease	10	-	-	-
	At the end of the year	-	-	-	-
4	Shri Nirav Solanki At the beginning of the year	-	-	-	-
	Increase / Decrease	10	-	-	-
	At the end of the year	10	-	-	-
5	Shri Ravi Solanki At the beginning of the year	10	-	-	-
	Increase / Decrease	10	-	-	-
	At the end of the year	-	-	-	-

F) INDEBTEDNESS - Indebtedness of the Company including interest outstanding/accrued but not due or payment.

	Secured Loans excluding deposits	Unsecured Loans	Deposits	Total Indebtedness
Indebtedness at the beginning of the financial year				
i) Principal Amount	NIL	NIL	NIL	NIL
ii) Interest due but not paid	NIL	NIL	NIL	NIL
iii) Interest accrued but not due	NIL	NIL	NIL	NIL
Total (i+ii+iii)	NIL	NIL	NIL	NIL
Change in Indebtedness during the financial year				
* Addition	NIL	NIL	NIL	NIL
* Reduction	NIL	NIL	NIL	NIL
Net Change	NIL	NIL	NIL	NIL



Indebtedness at the end of the financial year				
i) Principal Amount	NIL	NIL	NIL	NIL
ii) Interest due but not paid	NIL	NIL	NIL	NIL
iii) Interest accrued but not due	NIL	NIL	NIL	NIL
Total (i+ii+iii)	NIL	NIL	NIL	NIL

XI. REMUNERATION OF DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL-

A. Remuneration to Managing Director, Whole-time Directors and/or Manager:

SN.	Particulars of Remuneration	Name of MD/WTD/ Manager			Total Amount Rs.
		MD	Shri Nirav Solanki CGM (P) & Director From 30/09/2019	Shri Ravi Solanki CGM (P) & Director till 30/06/2019	
1	Gross salary	NIL	8,55,929	5,88,057	14,43,986
	(a) Salary as per provisions contained in section 17(1) of the Incometax Act, 1961	NIL	-	-	NIL
	(b) Value of perquisites u/s 17(2) Income-tax Act, 1961	NIL	-	-	NIL
	(c) Profits in lieu of salary under section 17(3) Income tax Act, 1961	NIL	-	-	NIL
2	Stock Option	NIL	-	-	NIL
3	Sweat Equity	NIL	-	-	NIL
4	Commission - as % of profit - others, specify...	NIL	-	-	NIL
5	Others, please specify	NIL	-	-	NIL
	Total (A)	NIL	8,55,929	5,88,057	14,43,986
	Ceiling as per the Act	-	-	-	-

B. Remuneration to other directors

SN.	Particulars of Remuneration	Name of Directors				Total Amount Rs.
		----	----	----	---	
1	Independent Directors	NIL	NIL	NIL	NIL	NIL
	Fee for attending board committee meetings	NIL	NIL	NIL	NIL	NIL
	Commission	NIL	NIL	NIL	NIL	NIL
	Others, please specify	NIL	NIL	NIL	NIL	NIL
	Total (1)	NIL	NIL	NIL	NIL	NIL

2	Other NonExecutive Directors/ Chairman and Vice Chairman	NIL	NIL	NIL	NIL	NIL
	Fee for attending board committee meetings	NIL	NIL	NIL	NIL	NIL
	Commission	NIL	NIL	NIL	NIL	NIL
	Others, please specify	NIL	NIL	NIL	NIL	NIL
	Total (2)	NIL	NIL	NIL	NIL	NIL
	Total (B)=(1+2)	NIL	NIL	NIL	NIL	NIL
	Total Managerial Remuneration	NIL	NIL	NIL	NIL	NIL
	Overall Ceiling as per the Act	NIL	NIL	NIL	NIL	NIL

C. REMUNERATION TO KEY MANAGERIAL PERSONNEL OTHER THAN MD/MANAGER/WTD

(Rs.)

SN	Particulars of Remuneration	Key Managerial Personnel			
		CEO	CS	CFO	Total
1	Gross salary	NIL	NIL	NIL	NIL
	(a) Salary as per provisions contained in section 17(1) of the Income tax Act, 1961	NIL	NIL	NIL	NIL
	(b) Value of perquisites u/s 17(2) Income tax Act, 1961	NIL	NIL	NIL	NIL
	(c) Profits in lieu of salary under section 17(3) Income tax Act, 1961	NIL	NIL	NIL	NIL
2	Stock Option	NIL	NIL	NIL	NIL
3	Sweat Equity	NIL	NIL	NIL	NIL
4	Commission	NIL	NIL	NIL	NIL
	- as % of profit	NIL	NIL	NIL	NIL
	Others, specify...	NIL	NIL	NIL	NIL
5	Others, please specify	NIL	NIL	NIL	NIL
	Total	NIL	NIL	NIL	NIL



XII. PENALTIES / PUNISHMENT/ COMPOUNDING OF OFFENCES: NIL

(Rs.)

Type	Section of the Companies Act	Brief Description	Details of Penalty / Punishment/ Compounding fees imposed	Authority [RD / NCLT/ COURT]	Appeal made, if any (give Details)
A. COMPANY					
Penalty	NIL	NIL	NIL	NIL	NIL
Punishment	NIL	NIL	NIL	NIL	NIL
Compounding	NIL	NIL	NIL	NIL	NIL
B. DIRECTORS					
Penalty	NIL	NIL	NIL	NIL	NIL
Punishment	NIL	NIL	NIL	NIL	NIL
Compounding	NIL	NIL	NIL	NIL	NIL
C. OTHER OFFICERS IN DEFAULT					
Penalty	NIL	NIL	NIL	NIL	NIL
Punishment	NIL	NIL	NIL	NIL	NIL
Compounding	NIL	NIL	NIL	NIL	NIL

For and on behalf of the Board of Directors of
Gujarat Water Infrastructure Limited

Date:- 06/03/2021

Place:- Gandhinagar

Mayur Mehta, IAS
Managing Director
DIN : 08842155

Nirav Solanki
Director
DIN : 08750494

Annexure- E

Form No. AOC-2

(Pursuant to Clause (h) of sub-section (3) of section 134 of the Act and Rule 8 (2) of the Companies (Accounts) Rules, 2014

Form for Disclosure of particulars of contracts/arrangements entered into by the company with related parties referred to in sub section (1) of section 188 of the Companies Act, 2013 including certain arm's length transaction under third proviso thereto.

1. Details of Contracts or arrangements or transactions not at Arm's Length basis.
 - a) Name (s) of the related party & nature of relationship.
 - b) Nature of contracts/arrangements/transaction
 - c) Duration of the contracts/arrangements/transaction
 - d) Salient terms of the contracts or arrangements or transaction including the value, if any.
 - e) Justification for entering into such contracts or arrangements or transactions
 - f) Date of Approval by the Board
 - g) Amount paid as advances, if any
 - h) Date on Which the special resolution was passed in General meeting as required under First proviso to section 188
2. Details of Contracts or arrangements or transactions at Arm's Length basis.
 - a) Name (s) of the related party & Nature of Relationship:- Remuneration to Key Management Personnel
 - b) Nature of contracts/ arrangements/transaction
 - c) Duration of the contracts/ arrangements/ transaction
 - d) Salient terms of the contracts or arrangements or transaction including the value if any.

Sr. No.	Particulars of Transactions	(Amt. in Rs.)
1	Remuneration to Key Management Personnel: Shri Ravi Solanki, CGM(P) & Director Remuneration Paid till 30/06/2019	5,88,057
2	Remuneration to Key Management Personnel: Shri Nirav Solanki, CGM(P) & Director Remuneration Paid till 30/09/2019	8,55,929
	Total	14,43,986

Form shall be signed by official who have signed the Board's Report.

For and on behalf of the Board of Directors of
Gujarat Water Infrastructure Limited

Date:- 06/03/2021

Place:- Gandhinagar

Mayur Mehta, IAS
Managing Director
DIN : 08842155

Nirav Solanki
Director
DIN : 08750494



Annexure- F Gaudana & Gaudana

(Company Secretaries)

307, Ashirwad Paras, Near, Prahladnagar Garden, Corporate Road, Parahladnagar, Satellite, Ahmedabad-380015.

Ph. + 91 79- 40324567/40324568, E-mail : arvindg_cs@yahoo.com

FORM No. MR-3

SECRETARIAL AUDIT REPORT

FOR THE FINANCIAL YEAR ENDED ON 31st March 2020

{ Pursuant to section 204 (1) of the Companies Act, 2013 and rule No. 9 of the companies
(Appointment and Remuneration Personnel) Rules, 2014 }

To,

The Members,
GUJARAT WATER INFRASTRUCTURE LTD.,
(CIN : U41000GJ1999SGC036777)
Dr. Jivraj Mehta Bhavan, Block No. 1 First floor,
Sector 10, Gandhinagar
Gandhinagar -382010 India.

We have conducted the secretarial audit of the compliance of applicable statutory provisions and the adherence to good corporate practices by **Gujarat Water Infrastructure Limited** (Hereinafter referred to as '**the Company**'). Secretarial Audit was concluded in a manner that provided us a reasonable basis for evaluating the corporate conduct/statutory compliances and expressing our opinion thereon.

Based on our verification of the Company's books, papers, minutes books, forms and returns filed and other records maintained by the Company and also the information provided by the Company, its officers, agents and authorized representatives during the conduct of Secretarial Audit.

We hereby Report that in our opinion, the company has, during the audit period covering the financial year ended on 31st March, 2020 ('Audit Period') complied with the statutory provision listed hereunder and also the Company has proper Board-processes and compliance-mechanism in place to the extent, in the manner and subject to the reporting made hereinafter:

We have examined the books, papers, Minutesbooks, forms and returns filed and other records maintained by the Company for the financial year ended on 31st March, 2020 according to the provisions of.

- (1) The Companies Act, 2013 (the Act) and the rules made thereunder
- (2) The Securities Contracts (Regulation) Act, 1956 ('SCRA') and the rules made thereunder (Not applicable to the Company during the audit period)

- (3) The Depositories Act, 1996 and the Regulations and Bye-laws framed thereunder (Not applicable to the Company during the audit period)
- (4) Foreign Exchange Management Act, 1999 and the rules and regulations made thereunder to the extent of Foreign Direct Investment, Overseas Direct Investment and External Commercial Borrowings (Not applicable to the Company during the audit period);
- (5) The following Regulations and Guidelines prescribed under Securities and Exchange Board of India Act, 1992 ('SEBI Act'):- (Not applicable to the Company during the audit period)
 - I. The Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011;
 - ii. The Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 2015;
 - iii. The Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018;
 - iv. The Securities and Exchange Board of India (Employee Stock Option Scheme and Employee Stock Purchase Scheme) Guidelines, 1999 and the Securities and Exchange Board of India (Share Based Employee Benefits) Regulations, 2014;
 - v. The Securities and Exchange Board of India (Issue and Listing of Debt Securities) Regulations, 2008;
 - vi. The Securities and Exchange Board of India (Registrar to an Issue and Share transfer Agents) Regulations, 1993 regarding the Companies Act and dealing with client;
 - vii. The Securities and Exchange Board of India(Delisting of Equity Shares) Regulation, 2009;
 - viii. The Securities and Exchange Board of India (Buy Back of Securities) Regulations, 2018;
 - ix. Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015.
- (6) Following are some other laws specifically applicable to the Company:
 - (a) The Indian Contract Act, 1872.
 - (b) The Works Contract Act, 1989.
 - (c) The Employees Provident Fund and Miscellaneous Provisions Act, 1952.
 - (d) The Minimum Wages Act, 1948;
 - (e) the Contract Labour (Regulation & Abolition) act 1970.
 - (f) The Employees Provident Fund Scheme, 1952.
 - (g) The Employees State Insurance Act, 1948.



We have also examined compliance with the applicable clauses of the following

- i. Secretarial Standards issued by the Institute of Company Secretaries of India;
- ii. The Listing Agreements entered into by the Company with Stock exchanges.
(Not applicable to the Company during the audit period.)

During the period under review the company has generally complied with the provisions of the Act, Rules, Regulations, Guidelines, Standards, etc. mentioned above.

We further report that

Having regard to the compliance system prevailing in the Company and on examination of the relevant documents and records provided or shown to us in pursuance thereof, on test-check basis, the Company has generally complied with the applicable provisions of the following laws applicable specifically to the Company.

1. The Labour Welfare Fund Act, 1953.
2. The Land Acquisition Act, 1894/ The Right to Fair Compensation and Transparency in Land Acquisition Act, 2013
3. The Building and Other Construction Workers (Regulation of Employment of Service) Act, 1996;
4. The National Environment Policy, 2006
5. The Environment (Prevention & Control of Pollution) Act, 1986. The explosive substances Act, 1908;
6. The Environment (Protection) Act, 1986 and Rules made thereunder;
7. The Water (Prevention and Control of Pollution) Act, 1974

We further suggest that-

Company should engage apprentice under the provision of the Apprentice Act, 1961. During the period under review, the Company has complied with the provisions of the Act Rules, Regulations, Guidelines, Standards, etc. mentioned above subject to the following observations.

Annual general Meeting of F.Y. 18-19 was held on 25/10/2019 which was adjourned due to non-receipt of C&AG comments on financial statements for the year ending on 31st March 2019. Thereafter, an adjourned meeting was held on 19/05/2020 after receipt of final comments of C&AG on the Financial Statements of Company for the F.Y. 18-19.

We further report that

During the period under review the Company has generally complied with the applicable provisions of the Act, Rules, Regulations, Guidelines, standards etc. However, we have observed as below.

The Authorized capital of the Company was increased by the shareholders at 19th Adj. AGM held on 21st June, 2019. thereafter, Company has allotted equity shares against applications money pending for allotment.



Moreover, Company was marked as Active Non-Compliant by the Ministry of Corporate Affairs. However, as on date of the report, upon necessary compliances, Company has filed INC-22A and company has been marked as Active Compliant by the MCA. Thereafter, Company has filed returns of Appointment of directors and increase in authorized capital.

We further report that except as above

The Board of Directors of the Company is duly constituted with proper balance of Executive Directors, Non-Executive Directors and Independent Directors. The change in the composition of the Board of Directors took place during the period under review were carried out in compliance with provisions of the Act.

Adequate notice is generally given to all directors to schedule the Board Meetings, agenda and detailed notes on agenda were sent at least seven days in advance and a system exists for seeking and obtaining further information and clarification on the agenda items before the meeting and for meaningful participation at the meeting.

All decisions of the Board are carried through unanimously. As per the records provided by the Company, none of the members of the Board dissented on any resolution passed in the meeting.

As per provisions of section 173 (1) of the Companies Act, 2013, the Company shall hold a minimum number of four meetings of its Board of Directors every year in such a manner that not more than one hundred and twenty days shall intervene between two consecutive meetings of the Board. We observed that during the year only three meetings of the Board of Directors were held i.e. on 21/06/2019, 25/10/2019 & 22/01/2020.

We further report that

There are adequate systems and processes in the company commensurate with the size and operation of the company to monitor and ensure compliance with applicable laws, rules, regulations and guidelines.

**For Gaudana & Gaudana
(Company Secretaries)**

Sd/-

CS Arvind Gaudana

FCS No. : 2838, C.P. No: 2183

UDIN : F002838B003024362

Place: Ahmedabad

Date:18/02/2021

Note: This report is to be read with our letter of even date which is annexed as 'ANNEXURE A' and forms an integral part of this report



Gaudana & Gaudana

(Company Secretaries)

307, Ashirwad Paras, Near, Prahladnagar Garden, Corporate Road, Parahladnagar, Satellite, Ahmedabad-380015.
Ph. + 91 79- 40324567/40324568, E-mail : arvindg_cs@yahoo.com

ANNEXURE-A

**To,
The Members,
Gujarat Water Infrastructure Limited
(CIN: U41000GJ1999SGC036777)
Dr. Jivraj Mehta Bhavanblock No 1 First Floor,
Sector 10 Gandhinagar
Gujarat-382010 India**

Our report of even date is to be read along with this letter

1. Maintenance of Secretarial record is the responsibility of the management of the Gujarat Water Infrastructure Limited (GWIL). Our responsibility is to express an opinion on these Secretarial records based on our audit.
2. We have followed the audit practices and processes as were appropriate to obtain reasonable assurance about the correctness of the contents of the Secretarial records. The verification was done on test basis to ensure that correct facts are reflected in secretarial records. We believe that the process and practices, we followed to provide a reasonable basis for our Opinion.
3. We have not verified the correctness and appropriateness of financial records and Books of Accounts of the Gujarat Water Infrastructure Limited.
4. Wherever required, we have obtained the Management representation about the compliance of laws, rules and regulations and happening of events etc.
5. The Compliance of the provisions of corporate and other applicable laws, rules, regulation, standards is the responsibility of management. Our examination was limited to the verification of records and procedure on test basis.
6. The Secretarial audit report is neither an assurance to the future viability of Gujarat Water Infrastructure Limited nor of the efficacy or effectiveness with which the management has conducted the affairs of the Gujarat Water Infrastructure Limited.

**For Gaudana & Gaudana
(Company Secretaries)**

**Place: Ahmedabad
Date: 18/02/2021**

**Sd/-
CS Arvind Gaudana
Senior Partner
FCS No. : 2838, C.P. No: 2183
UDIN : F002838B003024362**



Dhanki Pumping Station
NC-30 Project, Surendranagar



Anjar Pumping Station



Navda SPP 3B Pumping Station



Brahmani 2 Dam Intake

100 MLD D-Salination Plant at Mandvi Khatmuhurt





KISHAN M. MEHTA & CO.

Chartered Accountants

Head Office : 6th Floor, Premchand House Annexe, Ashram Road, Ahmedabad-380 009 (India)
Phone: +91-79-26581570, 66055570, 66311570 E-mail : kishanmehta@gmail.com

INDEPENDENT AUDITOR'S REPORT

To,
The Members,
GUJARAT WATER INFRASTRUCTURE LTD.,
Gandhinagar.

Report on Audit of the Financial Statements.

Opinion

We have audited the accompanying financial statements of **Gujarat Water Infrastructure Limited** (the “Company”) which comprise the Balance Sheet as at 31st March, 2020, and the Statement of Profit and Loss and the Cash Flow Statement for the year then ended and notes to the financial statements, including a summary of the significant accounting policies and other explanatory information.

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements give the information required by the Companies Act 2013 (“the act”) in the manner so required and give a true and fair view in conformity with the accounting standards prescribed under section 133 of the act and other accounting principles generally accepted in India, of the state of affairs of the company as at March 31, 2020., the loss and its cash flows for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143 (10) of the Act. Our responsibilities under those Standards are further described in the Auditor’s Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the institute of Chartered Accountants of India (ICAI) together with the ethical requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Act. and the Rules there under and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the ICAI’S Code of Ethics. We



believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion on the financial statements.

Information Other Than The Financial Statements and Auditor's Report Thereon

The Company's Board of Directors is responsible for the preparation of the other information. The other information comprises the information included in the, Board's Report including Annexures to Board's Report, but does not include the financial statements and our auditor's report thereon.

Our opinion on the financial statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the financial statements, our responsibility is to read the other information and, in doing so, consider whether the other information is materially inconsistent with the financial statements or our knowledge obtained during the course of our audit or otherwise appears to be materially misstatement if, based on the work, we have performed, we conclude that there is a material misstatement of this other information, we are required to report that fact. We have nothing to report in this regard.

Management's Responsibility for the Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in Section 134(5) of the Companies Act, with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance and cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards specified under Section 133 of the Act, This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgements and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and

presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

The Board of Directors are responsible for overseeing the company's financial reporting process.

Auditors' Responsibility for the Audit of the financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also :

Identify and assess the risk of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.



Obtain an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(I) of the Act, we are also responsible for expressing our opinion on whether the company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.

Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.

Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.

Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence and where applicable related safeguards.

Emphasis on Matter

We draw attention to following notes to financial statement

Assets forming part of Capital work in Progress already commissioned in earlier years amounting to Rs. 25.37 crore which were not capitalized in earlier years are capitalized during the year. Consequential depreciation not provided in earlier years for the reason as explained in Note No. 24 of Rs. 5.56 crore is provided in current year and shown in exceptional items in profit and loss account. As such prior depreciation is adjusted against deferred grant as the same is on assets under grant and there is no effect on profitability of the company.

The advance given against capital expenditure to certain parties shown under long term loans and advances of Rs.3.86 crore are partly recoverable and the balance amount shall be capitalized to Fixed Assets Accounts on its finality and consequential depreciation shall be provided as explained in detail in Note -25 to the financial statements.

In relation to Trade Receivables, Trade Payables, Other long term liabilities and long term loans and advances which are subject to confirmation, reconciliation and adjustment if any, as explained in detail in Note-27 to the financial statements.

Balances of Project Office appearing as short term loans and advances (current) in Note No. -13 of Rs. 35, 309/- (Total Debit amount Rs. 24,22,970.00 and Total Credit amount Rs.23,87,660.32) are subject to reconciliation and adjustment if any, as explained in detail in Note-28 to the financial statements

The amount of Rs. 0.36 Crore of credit balances for which amount is received by bank and shown as adjustment to debtors, the same will be credited to individual parties accounts at the time of knowing the names of parties as explained in details in Note -30 to the financial statements.

Non Provision of interest and penalty regularly raised in the bills of supply of water by Sardar Sarovar Narmada Nigam Limited (SSNNL) since several years, whose amount will be determined at the time of finalization of the matters as explained in detail in Note -38 to the financial statements.

Our Opinion is not modified in respect of these matters.



Report on Other Legal and Regulatory Requirements :

1. As required by the Companies (Auditor's Report) Order, 2016 ("the Order") issued by the Central Government of India in terms of sub-section (11) of section 143 of the Act, we give in the Annexure 'A' a statement on the matters specified in paragraphs 3 and 4 of the Order.
2. Based on the verification of records of the company and based on the information and explanations given to us, we give below a report on the Directions issued by the Comptroller and Auditor General of India in terms of section 143 (5) of the Companies Act, 2013.
 - i. Whether the company has system in place to process all the accounting transactions through IT system ? If yes, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.

Company has a centralized accounting system, where accounting is done on ERP tally 9.
 - ii. Whether there is any restructuring of an existing loan or cases of waiver/ write off of debts/ loans/ interest etc. made by a lender to the company due to the company's inability to repay the loan? if yes. the financial impact may be stated.

NotApplicable.
 - iii. Whether funds received/ receivable for specific schemes from central State agencies were properly accounted for/ utilised as per its term and conditions? List the cases of such deviation.

There is no such case.
3. As required by Section 143 (3) of the Act, we report that :
 - (a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary of the purposes of our audit.
 - (b) In our opinion, proper books of account as required by law have been kept by the Company so far as it appears from our examination of those books.
 - (c) The balance sheet, the statement of Profit and Loss and cash flow statement dealt with by this Report are in agreement with the books of accounts.



- (d) In our opinion, the aforesaid financial statements comply with the applicable Accounting Standards referred to under section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules 2014.
- (e) Being a Government Company, Pursuant to the Notification No. GSR 463(3) dated 5th June 2015 issued by Ministry of Corporate Affairs, Government of India, Provisions of sub-section (2) of section 164 of the Companies Act, 2013, are not applicable the company.
- (f) With respect to the adequacy of the internal financial controls over the financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our report in “**Annexure-B**” and
- (g) In our opinion and to the best of our information and according to the explanations given to us, we report as under with respect to other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014 :
- (I) The Company has disclosed the impact if any, of pending litigations in its financial statements- Refer Note No. 22 to the financial statement.
- (ii.) The company did not have any long term contracts including derivative contracts.
- (iii) There has not been amounts an occasion in case of the Company during the year under report to transfer any sums to the investor Education and Protection fund.

FOR, KISHAN M. MEHTA & COMPANY.
Chartered Accountants
Firm Reg. No. 105229W

Sd/-
U.P. BHAVSAR
Partner

Place : Ahmedabad
Date : 30 December, 2020
UDIN No : 20043559AAAACS4095



ANNEXURE - A to the Auditors' Report *(Referred to in paragraph-1 of our report of even date)*

- (I) a) The company has maintained records showing particulars including quantitative details and situation of fixed assets but the several particulars are to be completed therein to make them. Proper and complete.
- b) As explained to us, the fixed assets were not physically verified by the management during the year. In view of the same we are not in a position to give our opinion as to material discrepancies, if any.
- c) As the title deed of immovable properties are not made available for our verification, we are unable to give our position as to title of immovable properties in this matter.
- (ii) As explained to us, the company is supplying water in bulk and hence it does not hold any inventory hence paragraphs 3 (ii) of the order is not applicable to the company.
- (iii) The company has not granted any loan, to companies, firms, Limited Liability Partnerships or other parties covered in the register maintained under section 189 of the Act.
- (iv) According to information and explanations given to us, the company has not granted any loans or made investment or provided any guarantees or security pursuant to section 185 and 186 of the Act.
- (v) The Company has not accepted any deposits during the year from the public, within the meaning of provisions of section 73 to 76 and rules made there under.
- (vi) The provisions of sub section (1) of section 148 of the companies Act, 2013 regarding maintenance of cost record is not applicable to the company.
- (vii) (a) According to the information and explanations given to us and the records examined by us, the company is regular in depositing with appropriate authorities the undisputed statutory dues including Provident Fund, Employees' State Insurance, Income-tax, goods and services tax, Duty of Customs, Cess and any other statutory dues applicable to it and there are no such undisputed amount payable which are in arrears as at March 31, 2020 for a period of more than six months except Rs.11,36,925/- of TDS on GST.
- (b) According to the information and explanations given to us, and on the basis of records of the company examined by us, there are no dues of Income Tax, Sales Tax, Service Tax, goods and services tax, Duty of Customs, Duty of Excise, Value Added Tax which have not been deposited on account of dispute.



- (viii) As company has not taken any loan or borrowing from financial institution , bank, government or debenture holder, clause (viii) of paragraph 3 of the Company's (Auditor's Report) order, 2016 is not applicable to the company.
- (ix) As the Company has not raised moneys by way of initial public offer or further public offer (including debt instruments) and term loans during the year clause (ix) of paragraph 3 of the order is not applicable to the company.
- (x) Based upon the audit procedures performed for the purpose of reporting the true and fair view of the financial statement and as per the information and explanations given by the management, we report that no fraud on or by the Company by its officers or employees has been noticed or reported during the course of our audit.
- (xi) Section 197 of the Act regarding managerial remuneration is not applicable to the company by virtue of Notification no. GSR 463 (E) dated 05-06-2015 issued by the ministry of Corporate Affairs, Govt. of India.
- (xii) A Clause (xii) of paragraph 3 of the Company's (Auditor's Report) order, 2016 is not applicable to the Company as the company is not a Nidhi Company.
- (xiii) According to the information and explanation given to us, and based on our examination of the records of the company, transactions with the related parties are in compliance with sections 177 and 188 of the Act where applicable and details of such transactions have been disclosed in the financial statements as required by the applicable accounting standards.
- (xiv) The company has not made any preferential allotment or private` placement of shares or fully or partly convertible debentures during the year under review.
- (xv) Clause (xv) of paragraph 3 of the Company's (Auditor's Report) order, 2016 is not applicable to the Company, as the Company has not entered into any non-cash transactions with directors or persons connected with him.
- (xiv) According to the information and explanations to us, the company is not required to be registered under section 45-IA of the Reserve Bank of India Act, 1934.

FOR, KISHAN M. MEHTA & COMPANY.

Chartered Accountants
Firm Reg. No. 105229W

Sd/-
U.P. BHAVSAR
Partner

Place : Ahmedabad
Date : 30 December, 2020
UDIN No : 20043559AAAACS4095



ANNEXURE - B TO INDEPENDENT AUDITORS' REPORT

Report on the Internal Financial Controls under Clause (I) of Sub-section 3 of Section 143 of the Act, 2013 ("The Act")

We have audited the internal financial controls over financial reporting of **Gujarat Water Infrastructure Limited** ("The Company") as of 31st March, 2020 in conjunction with our audit of the financial statements of the Company for the Year ended on that date.

Management's Responsibility for Internal Financial Controls

The company's management is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India (ICAI). These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditor's Responsibility

Our responsibility is to express an opinion on the Company's internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting (the "Guidance Note") and the Standards on Auditing, issued by ICAI and deemed to be prescribed under section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor's judgement including the assessment of the risk of material misstatement of the financial statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system over financial reporting.

Meaning of Internal Financial Controls over Financial Reporting

A Company's internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A Company's internal financial control over financial reporting includes those policies and procedures that (1) Pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect that transactions and dispositions of the assets of the company; (2) provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorizations of management and directors of the company; and (3) provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

Inherent Limitations of Internal Financial Controls over Financial Reporting

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected.



Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, the Company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at 31st March 2020, based on the internal control over financial reporting criteria established by the company considering the essential components of internal control stated in the Guidance Note on Audit Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

Matter of Emphasis

Certain areas need further improvement in designing the “Documentation on Internal Financial Control” by way of identifying the significant account balances relating to fixed assets accounting, related accounting records and supporting informations. The company requires introductions of proper accounting system for all its branches so that financial reporting process can be further improved especially for compilation of information of data for financial reporting process. However, our opinion is not modified in above respect.

FOR, KISHAN M. MEHTA & COMPANY.
Chartered Accountants
Firm Reg. No. 105229W

Sd/-
U.P. BHAVSAR
Partner

Place : Ahmedabad
Date : 30 December, 2020
UDIN No : 20043559AAAACS4095



GUJARAT WATER INFRASTRUCTURE LIMITED, GANDHINAGAR
BALANCE SHEET AS AT 31st MARCH, 2020

(Rs. in Lacs)

Particulars	Note No.	31.03.2020	31.03.2019
I. EQUITY AND LIABILITIES			
(1) Shareholder's Funds			
(a) Share Capital	2	15,502.01	14,960.34
(b) Reserve and Surplus	3	204,710.15	164,937.63
(2) Share application money pending allotment	4	0.00	541.67
(3) Differed Grant	5	255,952.52	253,029.78
(4) Non-Current Liabilities			
(a) Long Term Borrowing		0.00	0.00
(b) Deferred Tax Liabilities (Net)		2.67	0.00
(C) Other Long Term Liabilities	6	22,523.84	21,317.26
(d) Long Term Provision		0.00	0.00
(5) Current Liabilities			
(a) Short Term Borrowing		0.00	0.00
(b) Trade Payables	7	5,406.48	3,274.10
(c) Other Current Liabilities	8	5,462.82	2,812.43
(d) Short Term Provision		0.00	0.00
Total		509,560.49	460,873.21
II. ASSETS			
(1) Non- Current assets			
(a) Property, Plant and equipment			
(i) Tangible Property, Plant and equipment	9	257,792.52	254,934.59
(ii) Intangible Property		0.00	0.00
(ii) Capital work in progress		26,551.66	34,490.93
(b) non-current investments		0.00	0.00
(c) Deferred tax asseset (net)		0.00	1.29
(d) Long terms loans and advances	10	6,498.61	6,128.23
(e) Other non-current assesets		0.00	0.00
(2) Current Assets			
(a) Current Investment		0.00	0.00
(b) Inventories		0.00	0.00
(c) Trade receivables	11	121,654.46	117,353.40
(d) Cash and cash equivalents	12	96,029.51	43,123.02
(e) Short-term loans and advances	13	130.92	4,530.30
(e) Other current assets	14	902.81	311.45
Total		509,560.49	460,873.21
Significant Accounting Policies and Notes forming part of accounts-See note 1-42			

For and on behalf of Board of Directors,

AS PER OUR REPORT OF EVEN DATE,

Sd/-
Mayur Mehta, IAS
 Managing Director

Sd/-
Jaldeep Dave
 Chief General
 Manager (Finance)

For KISHAN M. MEHTA & CO.
 CHARTERED ACCOUNTANTS
 FIRM REG. NO : 105229W

Sd/-
Nirav Solanki
 Director

(U.P. BHAVSAR)
 PARTNER
 M. No. 043559
 Place : Ahmedabad
 Date : 30.12.2020
 UDIN No : 20043559AAAAACS4095

Place : Gandhinagar
 Date : 30.12.2020



GUJARAT WATER INFRASTRUCTURE LIMITED, GANDHINAGAR
PROFIT AND LOSS STATEMENT FOR THE YEAR ENDED 31ST MARCH, 2020

(Rs. in Lacs)

Particulars	Note No.	31-03-2020	31-03-2019
I. Revenue from operations	15	45,710.60	37,412.86
II. Other Income	16	36,588.51	33,257.58
III. Total Revenue (I+II)		82,299.11	70,670.44
IV. Expenses :			
Materials Cost	17	24,636.56	18,092.33
Power Charges	18	35,896.23	33,451.45
Employee benefits expense	19	1,429.19	1,542.67
Depreciation and amortization expense	9	27,764.84	25,569.82
Other expense	20	2,763.64	2,304.55
Total Expenses		92,490.46	80,960.83
V. Profit/(Loss) before exceptional and extraordinary items and tax (III-IV)		-10,191.36	-10,290.38
VI. Exceptional Items	21	517.42	21.72
VII. Profit/ (Loss) before extraordinary item and tax (V-VI)		-9,673.93	-10,268.67
VIII. Extraordinary Items		0.00	0.00
IX. Profit/(LOSS) before tax (VII-VIII)		-9,673.97	-10,268.67
X. Tax Expense :			
1. Current Tax			
2. Deferred Tax		-3.96	-2.93
XI. Profit/(Loss) from the period from continuing operations (XI+X)		-9,677.90	-10,271.60
XII. Profit / (Loss) for the period		-9,677.90	-10,271.60
Earning per equity share			
(1) Basic & Diluted		-6.43	-6.87
Significant Accounting Policies and Notes forming part of accounts see note 1 to 42			

For and on behalf of Board of Directors,

Sd/-
Mayur Mehta, IAS
 Managing Director

Sd/-
Jaldeep Dave
 Chief General
 Manager (Finance)

AS PER OUR REPORT OF EVEN DATE,

For KISHAN M. MEHTA & CO.
 CHARTERED ACCOUNTANTS
 FIRM REG. NO : 105229W

Sd/-
Nirav Solanki
 Director

(U.P. BHAVSAR)
 PARTNER
 M. No. 043559
 Place : Ahmedabad
 Date : 30.12.2020
 UDIN No : 20043559AAAACS4095

Place : Gandhinagar
 Date : 30.12.2020



NOTES FORMING PART OF THE BALANCE SHEET AS AT 31ST MARCH 2020

(Rs. in Lacs)

Particulars		31-03-2020		31-03-2019
NOTE : 2				
SHARE CAPITAL :				
Authorised :				
Equity Share Capital 17,50,00,000 each of (15,00,00,000)each of Rs. 10/-		17,500.00		15,000.00
Issued, subscribed and paid up :				
Equity Share Capital 155020070 (149603370)Equity Share of Rs. 10/- As per Last Balance Sheet		15,502.01		14,960.34
Total		15,502.01		14,960.34

(a) Reconciliation of the number of shares and amount outstanding at the beginning and at the end of the reporting period.

Particulars	31-03-2020		31-03-2019	
	Nos.	Rs.	Nos.	Rs.
Balance at the beginning of the year	149,603,370	1,49,60,33,700	149,603,370	1,49,60,33,700
Add : shares issued during the year	5,416,700	54,167,000		
Less : Shares bought back during the year				
Balance at the end of the year	155,020,070	1,55,02,00,700	149,603,370	1,49,60,33,700

(b) Details of Shareholders holding more than 5% Shares in The Company :

Name of the Shareholder	% held	31-03-2020 No. of Shares	% held	31-03-2019 No. of Shares
Government of Gujarat	99.99	15,50,20,063	99.99	14,96,03,363

(c) Terms/ Rights attached to Equity Shares:

The company has only one class of equity shares having a par value of Rs. 10 per share. Each equity Shareholder is entitled to one vote per share.

NOTE : 3				
RESERVES & SURPLUS :				
Grant Received from Govt. Of Gujarat				
As per Last Balance Sheet	138,634.49		136,880.25	
Add :- Received During the Year	94,304.00		69,300.00	
	232,938.49		206,180.25	
Less :- Transfer to Deferred Grant	29,639.31	203,299.18	67,545.75	138,634.49
Grant Received From Govt. of Gujarat (Desalination Plant)				
As per Last Balance Sheet	0.00		0.00	
add : Received During the year	6,600.00		0.00	
	6,600.00		0.00	
Less : Transfer to Deferred Grant	0.00	6,600.00	0.00	0.00
Grant Received From Central Government Through GWSSB (Gujarat Water Supply and Sewerage Board)				
As per Last Balance Sheet	10,406.54		10,406.54	
	10,406.54		10,406.54	
Add : Receive During the Year	8,455.00		0.00	
Less : Transfer to Deferred Grant	1,659.57	17,201.97	0.00	10,406.54



(Rs. in Lacs)

Particulars		31-03-2020		31-03-2019
Grant Received from Govt. of Gujarat Through GWSSB				
As per Last Balance Sheet	68,992.71		68,992.71	
Less :- grant adjusted against Supply of water	28,609.70	40,383.01	0.00	68,992.71
Profit & Loss Account				
As per Last Balance Sheet	-53,096.11		-42,824.52	
Add :- Transferred from Profit & Loss Statement	-9,667.90	-62,774.01	-10,271.60	-53,096.11
Total		204,710.15		164,937.64
NOTE : 4				
SHARE APPLICATION MONEY :				
(Pending allotment)				
As per Last Balance Sheet	541.67		541.67	
Less : Amount transferred to Equity Share Capital A/c.	541.67	0.00	0.00	541.67
Total		0.00		541.67
NOTE - 5				
Deferred Grant				
As per Last Balance Sheet	253,029.78		227,462.53	
Add: Transferred for Grant recd. from Govt. of Gujarat from Reserve & Surplus	29,639.31		67,545.75	
Add : Transferred from Grant recd. from Central Govt. from Reserve & Surplus	1,659.57		0.00	
	284,328.67		295,008.29	
Less : Transfer to Prior Period Differed Grant (Shown In Schedule P & L)	685.84		16,500.53	
Less Transfer of deffered Grant to Profit & loss statement equavelent to depreciation on Fixed Assets under Grant	27,690.29	255,952.53	25,477.98	253,029.79
NOTE - 6				
Other Long Term Current Liabilities				
Security Deposits		8,583.16		9,827.63
Work Deposit		642.09		841.64
Deposits against water sales		13,298.59		10,647.98
Total		22,523.84		21,317.26
NOTE - 7				
Trade Payable :				
Micro and Small Enterprise		0.00		0.00
Others		5,406.48		3,274.10
		5,406.48		3,274.10
Note : 7.1 Under the Micro, Small and Medium Enterprise Development Act, 2006: certain disclosures are required to be made relating to Micro, Small and Medium Enterprises. The company is in the process of compiling relevant information from its suppliers about their coverage under the Act. Since the relevant information is not available, no disclosures have been made in the accounts. Auditors have relied upon the same.				
NOTE - 8				
Other Current Liabilities :				
Statutory Liabilities				
Duties and Taxes		155.66		134.63
Labour Cess		57.99		211.35
Other Liabilities				
Other Liabilities		2,232.69		1,624.26
Creditor of CWIP and Fixed Assets		752.68		512.55
Capital Cost Contribution Received for Effluent Project (GPCB)		2,218.00		0.00
Advance to Project Office (Refer Note 28)		0.00		288.38
Crop Compensation Payable		45.80		41.26
		5,462.82		2,812.43

NOTE - 9 FIXED ASSETS

(Rs. in Lacs)

PARTICULARS OF ASSETS	GROSS BLOCK				DEPRECIATION BLOCK				NET BLOCK		
	BALANCE AS ON 01/04/2019	ADDITION DURING THE YEAR	AMOUNT TRANSFERRED FROM CAPITAL ADVANCE	AMOUNT TRANSFERRED	BALANCE AS ON 31/03/2020	PROVIDED UPTO 31/03/2019	PRIOR PERIOD DEPRECIATION	PROVIDED DURING THE YEAR	TOTAL UPTO 31/03/2020	31/03/2020	31/03/2019
ASSETS UNDER GRANT											
Land	2307.19	150.44	0.00	0.00	2457.63	0.00	0.00	0.00	0.00	2457.63	2307.19
Building	8429.86	567.86	0.00	15.45	8982.27	3947.33	0.00	497.80	4445.13	4537.14	4482.53
Electrical Installation	6414.75	0.00	0.00	0.00	6414.75	4812.08	0.00	343.28	5155.36	1259.39	1602.67
Plant & Machinery	22043.05	6645.02	0.00	0.00	28688.07	14488.05	548.80	2475.76	17512.61	11175.46	7554.99
Pipe Line	434530.79	23735.24	215.77	0.00	458481.80	196779.70	137.05	24371.30	221288.05	237193.75	237751.09
Furniture & Fixture	17.91	0.00	0.00	0.00	17.91	17.02	0.00	0.00	17.02	0.90	0.90
Office Equipments	38.56	0.00	0.00	0.00	38.56	36.44	0.00	0.13	36.57	1.99	2.12
Vehicles	26.45	0.00	0.00	0.00	26.45	15.73	0.00	2.03	17.76	8.96	10.72
Total:	473808.55	31098.56	215.77	15.45	505107.43	220096.35	685.84	27690.29	248472.49	256634.94	253712.20
OWN FUND ASSETS											
Land	511.10	0.00	0.00	0.00	511.10	0.00	0.00	0.00	0.00	511.10	511.10
Building	145.63	0.00	0.00	0.00	145.63	93.50	0.00	6.09	99.59	46.05	52.14
Plant & Machinery	512.23	0.00	0.00	0.00	512.23	456.11	0.00	9.51	465.61	46.60	56.11
Pipe Line	3531.70	0.00	0.41	0.00	3532.12	2985.33	0.28	45.61	3031.22	500.90	546.37
Furniture & Fixture	36.81	3.10	0.00	0.00	39.90	28.16	0.00	2.72	30.88	9.02	8.64
Office Equipments	34.48	2.17	0.00	0.00	36.66	28.67	0.00	1.89	30.56	6.10	5.82
Vehicles	142.35	0.00	0.00	0.00	142.35	116.00	0.00	6.15	122.14	20.20	26.35
Library Books	4.74	0.00	0.00	0.00	4.74	4.74	0.00	0.00	4.74	0.00	0.00
Computers	51.21	1.21	0.00	0.00	52.42	45.29	0.00	2.55	47.83	4.58	5.92
Electrical Installation	205.55	0.00	0.00	0.00	205.55	195.61	-3.12	0.04	192.53	13.02	9.93
Total:	5175.80	6.48	0.41	0.00	5182.69	3953.41	-2.85	74.55	4025.12	1157.58	1222.38
Grand Total:	478984.35	31105.04	216.19	15.45	510290.12	224049.77	683.00	27764.84	252497.60	257792.52	254934.58
Capital Work In Progress										26551.66	34490.93
Total :										284344.18	289425.52





(Rs. in Lacs)

Particulars		31-03-2020		31-03-2019
NOTE : 10				
Long Term Loans & Advances :				
(Unsecured, Considered Good Unless otherwise stated				
1. Advances recoverable in cash or Kind or for value to be received		34.46		34.46
2. Capital Advance		386.24		607.16
3. Security Deposit PGVCL, MGVCL, UGVCL		6,049.75		5,458.45
4. Mat Credit Receivable		28.16		28.16
Total		6,498.61		6,128.23
Note : 11				
Trade Receivables :				
(Refer Note 29)				
Outstanding for a period exceeding six months from the date they are due for Payment Unsecured, considered good				
Doubtful	102,900.62		76,701.22	
	198.03		309.05	
	103,098.66		77,010.27	
Less : Provision for Doubtful Debt	-198.03	102,900.62	-309.05	76,701.22
Others (Unsecured, Considered Good)		18,753.84		40,652.17
Total		121,654.46		117,353.40
Note : 12				
CASH & CASH EQUIVALENTS :				
1) Cash on Hand		0.24		0.44
2) Balance with Scheduled Bnaks in Current Accounts		19,045.45		32,249.92
3) Gujarat State Financial Service inter Corporate Deposit exceeding three months		76,937.38		10,828.46
4) Bank Deposit exceeding one year (Against margin money)		46.44		44.19
Total		96,029.51		43,123.02
Note : 13				
SHORT TERM LOANS & ADVANCES: (CURRENT)				
(Unsecured, considered good unless otherwise stated)				
1. Advances to staff		0.00		0.02
2. Advance to Branch Offices (Refer Note 28)		0.35		0.00
3. Other				
TDS Receivable		54.60		60.44
Grant Receivable (2018-19)		0.00		4,317.50
Mobilisation Advance (Desalination Plant)		73.73		150.00
Prepaid Exps.		2.24		2.36
Total		130.92		4,530.30



(Rs. in Lacs)

Particulars		31-03-2020		31-03-2019
NOTE : 14				
Other Current Assets				
Interest Accrued but not due		902.81		311.45
Total		902.81		311.45
Note : 15				
Revenue from operations:				
Sales of water to GWSSB	20,690.44		20,830.53	
Sales of Water to Other	25,020.17	45,710.60	16,582.33	37,412.86
Total		45,710.60		37,412.86
Note : 16				
Other Income :				
a) Deferred Grant Income (Refer Note -24)		27,690.29		25,477.98
b) Other Income				
i) Tender Fees Income	10.19		15.86	
ii) Delay Payment Charges	7,915.98		6,733.32	
iii) Bank Interest	494.04		335.39	
iv) Other Interest	344.32		300.91	
v) Rent Received	7.56		9.41	
vi) Revenue Grant From Govt. of Gujarat	100.00		375.00	
vii) Miscellaneous Income	26.13	8,898.22	9.71	7,779.60
Total		36,588.51		33,257.58
Note : 17				
Material Cost :				
Purchase of Water		24,636.56		18,092.33
Total		24,636.56		18,092.33
Note : 18				
Power Charges :				
Power Charges		35,896.23		33,451.45
Total		35,896.23		33,451.45
Note : 19				
Employee Benefit Expenses :				
Salaries & Other Payments	1,400.95		1,505.56	
Staff Welfare Expenses	0.59		5.59	
Contribution to PF and Other Funds	27.65	1,429.19	31.52	1,542.67
Total		1,429.19		1,542.67



(Rs. in Lacs)

Particulars		31-03-2020		31-03-2019
NOTE : 20				
Other Expenses :				
Rent		4.99		3.39
Printing & Stationery		17.67		18.23
Advertisement Expenses		6.75		9.81
Postage, telegraph & telephones Expenses		8.23		10.96
Electricity & Water Charges		7.43		4.93
Bank Charges		0.10		0.15
Insurance Expenses		3.61		3.75
Travelling & Conveyance Expenses		70.15		80.20
Vehicle Expenses		37.26		54.20
GST Expenses		6.63		10.63
Repairs & Maintenance				
Repairs to Buildings	1.39		0.52	
Repairs to Computers	2.17		2.04	
Repairs to Office Equipments	0.84		0.55	
Repairs & Maintenance to Vehicles	15.77		25.08	
Repairs to Others	3.88	24.05	1.45	29.64
Operation & Maintenses Expense		1,805.36		1,327.35
Security Expenses(task Force)		711.20		629.34
Authorised Capital Increase fees		25.61		0.00
Auditor's Remuneration :				
Audit Fees		1.77		1.41
Out of Pocket Expenses		0.10		0.11
Legal & Professional Expenses		66.24		23.07
Sundry Expenses		77.50		97.38
Provision for Doubtful Debts		-111.01		0.00
Total		2,763.64		2,304.55
Note : 21				
Exceptional Items				
Prior Period Adjustments :				
(Refer Note-39)				
Prior Period Deferred Grant Income		685.84		16,500.53
Prior Period Income A/c				51.63
Prior Period Delay payment Charges		0.00		438.48
Prior Period Power Charges		687.80		0.00
Prior Period Interest Income		2.74		34.37
Prior Period Adjustment	0.01		0.01	
Prior Period Expenses	25.56		88.27	
Prior period Security Task Force Expenses	416.23			
Prior period GST Expenses (2018-19)		15.42		
Prior Period Exps. (2017-18)			416.85	
Prior Period Sales (2012-13)				
Prior Period Sales (2014-15)	29.43			
Prior Period Sales (2015-16)	9.21			
Prior Period Sales (2016-17)	0.86			0.12
Prior Period Sales (2018-19)		215.70		
Prior Period Depreciation (On Government Grant Assets)	685.84		16,500.52	
Prior period Depreciation (On Own Fund Assets)		2.85		2.24
Prior Period O& M Expenses		74.21		
	1,167.14	1,684.56	17,005.65	17,027.37
Total		517.42		21.72



GUJARAT WATER INFRASTRUCTURE LIMITED
CASH FLOW STATEMENT FOR THE YEAR ENDED MARCH 31, 2020

(Rs. in Lacs)

	Particulars	For the Year Ended March 31,2020	For the Year Ended March 31,2019
A	CASH FLOW FROM OPERATING ACTIVITIES		
	Net Profit before Tax & Extra Ordinary Items	-9673.93	-10268.67
	Adjustments for:		
	Add: Depreciation (including Prior Period Dep.)	28447.84	42070.35
	Add: Provision/Woffs	0.00	0.00
	Less: Differred Grant	-28376.14	-41978.51
	Less: Revenue Grant	0.00	0.00
	Add: Interest Exps	0.00	0.00
	Less: Interest Received	-838.36	-636.30
	Less: Prior Period Income Tax Expenses	0.00	0.00
	Less: Increase/ - Decrease in Non Current Liabilities	1206.59	2070.15
	Less: Increase in Long Term Loans and Advances	-370.38	-264.14
		69.55	1261.55
	Operating Profit before working Capital Changes	-9604.38	-9007.12
	Adjustments for:		
	Increase/Decrease in Current Assets	-493.38	-4665.32
	Increase/Decrease in Current Liabilities	4782.77	-1246.70
	Receipt of Capital Grant	109359.00	69300.00
	Amount of Grant adjusted against supply of Water	-28609.70	0.00
	Amount given back to GWSSB	0.00	0.00
	Net Cah flow from Operating Activities	75434.64	54380.86
B	CASH FLOW FROM INVESTING ACTIVITIES		
	Reduction / (Increase) in Long Term Loans	0	0
	Capital Work in Progress	7939.27	45170.05
	Purchase of Fixed Assets	-31305.77	-67561.35
	Interest Received	838.36	636.29
	Net Cash used /raised from Investing Activities	-22528.14	-21755.00
C	CASH FLOW FROM FINANCING ACTIVITIES		
	Secure & Unsecured Loan Borrowed (Non Current Liabilities)		
	Secured & Unsecured Loan Repaid	0.00	0.00
	Interest Exps Paid during the year	0.00	0.00
	Share Capital /Application Money received	0.00	0.00
	Net Cash from Financing Activities	0.00	0.00
	Net Change in cash & Cash Equivalent	52906.50	32625.86
	(A+B+C)		
	Opening Cash & Cash Equivalents	43123.02	10497.16
	Closing Cash & Cash Equivalents	96029.52	43123.02
	Increase/decrease in cash & cash Equivalents	52906.50	32625.86
	Reconciliation of Cash and Cash Equipment the end of the year comprises		
	(a) Cash on Hand	0.24	0.44
	(b) Balances with Bank		
	(i) in current accounts	96,029.27	43,122.58
	Cash and Cash Equilent as per Cash Flow Statement	96029.51	43123.02



Explanatory notes to Cash flow Statements

- 1 The Cash flow Statement is prepared in accordance with Indirect method of Accounting Standard-3 issued by the Institute of Chartered Accountants of India.
- 2 In part A, B & C of the cash flow statement, negative figures indicate Cash outflows while the Positive figures shows Cash Inflows.

AS PER OUR REPORT OF EVEN DATE,

For KISHAN M. MEHTA & CO.
CHARTERED ACCOUNTANTS
FIRM REG. NO : 105229W

(U.P. BHAVSAR)
PARTNER
M. No. 043559
Place : Ahmedabad
Date : 30.12.2020
UDIN No : 20043559AAAACS4095

For and on behalf of Board of Directors,

Sd/-
Mayur Mehta, IAS
Managing Director

Sd/-
Jaldeep Dave
Chief General
Manager (Finance)

Sd/-
Nirav Solanki
Director

Place : Gandhinagar
Date : 30.12.2020



GUJARAT WATER INFRASTRUCTURE LIMITED, GANDHINAGAR

Note :1

Significant Accounting policies and Notes on Financial Statement for the year ended 31st March, 2020

Significant Accounting Policies

A) Basis of preparation of Financial Statement

The Financial Statements Gujarat Water Infrastructure Limited (GWIL) have been prepared under the historical cost convention on accrual and going concern basis and in compliance with, in all material aspects, with the accounting principles in India, the applicable Accounting Statements, notified under Section 133 read with MCA notification vide 15/2013 and other relevant provision of the companies Act, 2013

All assets and liabilities are presented as current or non-current as per the Company's normal operating cycle and other criteria set out in the schedule III as per sec 129 of the Companies Act, 2013. The Company has ascertained its operating cycle as 12 months for the purpose of current/non-current classification of assets and liabilities.

B) Revenue recognition

Revenue for sales is recognized on transfer of risk and rewards.

C) Use of Estimates

The preparation of Financial Statements in conformity with generally accepted accounting principles requires estimates and assumptions to be made that affect the reported amount of assets and liabilities on the date of the Financial Statement and reported amount of revenue and expenses during the reported period. Difference between actual results and estimates are recognized in the period which the result are known or materialize.

D) Property, Plant and equipment

- I. Property, plant and equipments are stated at cost of acquisition/ construction less accumulated depreciation. Cost comprises the purchase price and any attributable cost of bringing the Property, plant and equipments to its working condition for its intended use.



- ii. Capital Work in Progress comprises of (I) Expenditure incurred on assets which are yet to be commissioned (ii) Borrowing cost and expenses incurred relating to project prior to commencement of commercial production are classified as incidental expenditure pending capitalization and disclosed under capital work in progress (net of income earned during development stage.) (iii) capital advances given for procurement of fix property, plant and equipments are treated as non-current Property, Plant and equipments and are classified as Long Term Loans and Advances (iv) Crop compensation and ROU payable to farmers which are directly related to laying of pipelines.

E) Depreciation and Amortization

- i. Depreciation on Property, plants and equipment is provided on Written Down Value Method as per the provisions and in manner prescribed in Schedule II of the Companies Act 2013.
- ii. Pursuant to AS 12, and amount equal to depreciation on Property, plants and equipment procured under grant is debited to “Deferred Grant” and credited to “Deferred Grant income account”.

F) Earnings per Share

The basic earnings per share is computed by dividing the profit/ (Loss) after tax for the year attributable to the equity shareholders by the weighted average number of equity shares outstanding during the year.

G) Taxes on Income

- i. Tax on income for the current period is determined on the basis of estimated taxable income computed in accordance with the provisions of the income Tax Act. 1961.
- ii. Deferred tax is recognized on timing difference between the accounting income and the estimated taxable income for the period and quantified using the tax rates and laws enacted or substantively enacted as on the balance sheet date.
- iii. Deferred tax assets are recognized for timing differences of items other than unabsorbed depreciation and carry forward losses only to the extent that there is reasonably certainty that sufficient future taxable income will

be available against which differed tax asset can be realized. But if there is unabsorbed depreciation and carry forward of losses, deferred tax Property, plants and equipment are recognized if there is virtual certainty that sufficient future taxable income will be available to realize deferred tax assets.

H) Government Grants and Subsidies

- i. The capital grant received from Govt. of Gujarat is treated as capital receipt and classified under the group “Reserves and Surplus” in the Balance sheet.
- ii. The company transfers an amount equal to the amount of Property, plants and equipment acquired out of “Grant Fund” to a separate account called “Deferred Grant” in the Balance sheet.
- iii. Revenue Grant received from Govt. of Gujarat is recognized when there is reasonable assurance that the company will comply with the conditions attached there to.

I) Provisions, Contingent Liabilities and Contingent Assets

Provision involving substantial degree of estimation in measurement are recognized when there is a present obligation as a result of past events and it is probable that there will be an outflow of resources. Contingent liabilities, if any are not recognized but disclosed in the notes. Contingent assets are neither recognized nor disclosed in the Financial Statement.

J) IMPAIRMENT OF ASSETS:

The carrying amount of assets is reviewed at each balance sheet date, if there is any indication of impairment based on internal/ external factors. An asset is treated as impaired when the carrying cost of the asset exceeds its recoverable value. an impairment loss is charged to the Statement of Profit and Loss in the year in which an asset is identified as impaired. The impairment loss recognized in prior accounting periods is reversed if there has been a change in the estimate of recoverable amount.

- K)** Accounting Policies not specifically referred to are consistent with generally accepted accounting practice



GUJARAT WATER INFRASTRUCTURE LIMITED, GANDHINAGAR

NOTES TO ACCOUNTS

22. Contingent Liability Not Provided for :-

Particulars	(Rs. in Lacs)	
	2019-20	2018-19
Arbitrators award for providing consultancy services by Consulting Engineering Services (I) Pvt. Ltd. and MWH India Pvt. Ltd. M/s. Mott McDonald Pvt. Ltd. case has been settled in 2019-20. (Principal and interest thereon are as under : Consulting Engineering services (I) Pvt. Ltd. Principal Rs. 88.54, Interest Rs. 147.41 MWH India Pvt. Ltd. Principal Rs. 196.05, Interest Rs. 311.18 (Company has filed petition against these two awards)	743.18	899.64
The award of arbitration against Maha Shakti Coke has went against the GWIL, however GWIL has challenged this award in the commercial court vide commercial CMA No. 25 of 2016 Dated-13th July 2016. This can give rise to contingent liability for Rs. 291.68/- plus 9% (from 19.10.2010 to 08.12.2011 and other 15%) interest p.a. on Rs.3,49.73/-	641.41 As per Award of Arbitral Tribunal	641.41 As per Award of Arbitral Tribunal

23. Capital Commitment

The estimated amount of contracts remaining to be executed on capital account and not provided for (Net of Advances) as at 31st March, 2020 Rs. 2041.41 crore. (Previous year Rs.355.35 crore)

24. (i) During the Financial Year 2019-20, the company has provided Depreciation of Rs.284.47 crores (Prior Period- Rs. 6.82 crores and Current Year- Rs. 277.65 crores). Out of this Depreciation of Rs. 283.75 crores (Prior Period - Rs 6.85 cores and Current Year- Rs. 276.90 crores) pertains to property, plant and equipment acquired out of Grant Funds and balance of Rs.0.72 crores pertains to property, plant and equipment acquired out of own Funds. As per As-12, the Company has transferred Rs. 283.75 crores (Prior Period- Rs. 6.85 crores and Current Year- Rs. 276.90 crores) of depreciation from Deferred Grant A/c to Deferred Grant Income (276.90 Crore) and Prior period deferred grant income (6.85 crore) Credited as exceptional item in note no. 21 of Profit and Loss Account.

(ii) The prior period depreciation of Rs. 5.56 crore is property, plant and equipment put to use in earlier years amounting Rs. 25.37 crore. These property, plant and equipment were not capitalized due to non submission of final bills from respective contractors. However as the property, plant and equipment were commissioned in earlier years, the same have been capitalized during the current year and depreciation of the earlier year have been shown as prior period depreciation. As the same have been credited to Prior Period Deferred Grant Income as pertaining to property, plant and equipment under grant in note no 21, it does not affect profitability of the company.

(iii) The prior period depreciation of Rs.0.77 crore is on property, plant and equipment put to use in earlier year amounting to Rs. 2.16 crore which pertains to advance given for pipeline crossing for the projects and during the year on verification it has been identified that the relevant projects have already been completed and the advances are no longer refundable.

- 25.** The Advance given against capital expenditure paid to Western Railway and others shown under Long term loans and advances. (Current year Rs. 3.68 crore, Previous Year Rs. 6.07 crore) are partly recoverable and the balance amount shall be capitalized to Fixed Assets accounts on its finality and consequential depreciation will be provided.

During the year 2019-20, Rs. 2.16 crore being such advance which are non-refundable and pertaining to pred has been transferred from advance given against capital expenditure to respective assets account and accordingly depreciation has been changed.

- 26.** During the year, all employees of the company are either on deputation from Gujarat Water Supply Sewerage Board or on contract base employment. There is no employee on direct employment of the company. Retirement Benefits like Provident Fund, Gratuity, Leave Encashment related to contractual employees is paid by the respective contractors. Hence no liability arises as per AS-15. The company's expenditure appearing in note no 19 pertained to PF contribution and Board's insurance contribution in respect of employees deputed from GWSSB.

- 27.** Trade receivables, Trade Payables, other long term liabilities and long term Loan & advances are subject to confirmation and adjustment if any. Non-current property, plant and equipment, Current Assets here in, have a realizable value in the ordinary



course of business approximately of the amount at which they are stated in these financial statements.

- 28.** The total difference in project offices balances appearing as current liability in Note 8 of other Current Liabilities was Rs. 288.38 lacs for 13 office of the Company at the end of previous year. The transactions in case of 06 offices out of 13 offices were reconciled and the total amount of net difference remains Rs. 35,309.68 as on 31.03.2020 (Total Dbit amount Rs. 24,22,970.00 and total Credit amount Rs. 23,87,660.32)
- 29.** Trade Receivable exceeding six months from due dates of payments as on 31 March 2020 are Rs.1029.00 crores. Out of them Rs.1007.69 crore are of Government corporations and bodies and Rs.21.31 crores are receivable from other entities. Out of receivables of Rs. 1215.43 crores, Rs. 567.62 crore (Previous year Rs. 454.65 crore) pertains to different Municipal Corporations and Nagarpalikas of water bills and delayed payment charges dues outstanding since several years for which reminders for recovery are sent to them and company expects to recover the same and therefore the same are considered as good. Provision for Doubtful Debts was made without adjusting Security Deposit which is liable to be adjusted, therefore, the provision to that extent is required to be reduced. However, receivable being doubtful, a sum of Rs. 1,98,03,365.23 has been shown accordingly.
- 30.** The amount of Rs. 0.36 crores (Rs. 0.47 crore previous year) of credit balances for which details of parties from whom such amount is received by bank is not made available by bank to us, therefore the same is shown as adjustment to debtors amount in note no. 11 and the same will be credited to individual parties at the time of knowing the names of parties.
- 31.** Govt. of Gujarat has transferred the following Bulk Water transmission pipelines network from GWSSB to GWIL with an aim to consolidate Bulk Water transmission pipe line network in yearlier years.
- 1) NC-6 Maliya to Morbi
 - 2) NC-7 Morbi to Tankara
 - 3) NC-9 Maliya to Bhachau
 - 4) NC-12 Tankara to Ratan
 - 5) SPP-1 Pariaj to Pipli
 - 6) SPP-2 Pipli to Navda

- 7) SPP-3 Navda Botad Gadhada
- 8) SPP-4 Navda- Vallabhipur

The Assets of the above water transmission pipe line network are yet to be transferred to GWIL by GWSSB. Necessary accounting entries for property, plant and equipment as well as depreciation on Assets will be passed in the books of accounts only after outcome of the matter.

Govt. of Gujarat has transferred the following Bulk Water transmission pipelines from GWIL to GWSSB with an aim to consolidate Bulk Water transmission pipe line network in earlier years.

- 1) NC-14 Nabhoi to Gandhinagar City and GEB
- 2) NC-17 Modhera to Mehsana
- 3) NC-23 Halol-Kalol in Panchmahal District

The Assets of the above water transmission pipe line network are yet to be transferred to GWSSB. At present the Fixed Assets of the above pipeline network and depreciation thereon are accounted in the books of accounts of the company. A committee consisting of officers from both the organization has been set up to resolve the issue relating to proper documentation and accounting in both the organization.

32. Related Party Information:

(1) Relationships :

(a) Where controls exist: Govt. of Gujarat.

(b) Key Management Personnel:

Shri Dhananjay Dwivedi, IAS, Chairman from 30.09.2019.

Shri J.P. Gupta, IAS, Chairman from 14.07.2017 to 30.09.2019

Shri Tushar Dholakiya, IAS, Managing Director From 28.09.2016 to 11.09.2019.

Shri K. K. Nirala, IAS, managing Director from 11.09.2019 to 03.02.2020

Shri R.S. Ninama, IAS, Managing Director From 03.02.2020 to 05.06.2020

Shri Mayur K. Mehta, IAS, Managing Director from 05.06.2020

Shri Ravi Solanki, CGM (P) & Director up to 30.06.2019

Shri Nirav Solanki, CGM (P) & Director from 30.09.2019



(c) Remuneration to Key Management Personnel :

Shri Ravi Solanki, CGM (P) & Director Remuneration paid to Rs. 5,88,057/-
(P.Y. Rs. 23,35,410/-)

Shri Nirav Solanki, CGM (P) & Director Remuneration paid to Rs. 8,55,929/-
(P.Y. Rs. Nil /-) since 30.09.2019

There are no dues from the Directors

33. **Basic and Diluted Earnings per Share :**

Particulars	31.03.2020 Rs.	31.03.2019 Rs.
<u>Numberator</u> Net Profit / Loss Basic	-9,67,789,608.71	-1,027,159,771.04
Denominator Avg. No. of Equity Shares O/s. during the year Basic	1,50,627,350.00	14,96,03,370.00
Nominal Value Per Share Earnings Per Share	Rs. 10 each	Rs. 10 each
- Basic	Rs. -6.43 per share	Rs. -6.87 Per share

34. **Auditors' Remuneration**

(Amount in Rs.)

Particulars	2019 - 2020	2018 - 2019
Audit Fees	1,77,000/-	1,41,600/-
Out of Pocket Expenses	9,936/-	11,511/-

35. The Company is not in to manufacturing activity thus additional information pursuant to the provisions of the Companies Act, 2013 is not applicable.

36. As per Accounting Standard-22, Deferred tax asset should be recognized to the extent it is reasonably certain that there will be sufficient income to recover such deferred tax asset, supported by convincing evidence. During the year provision of Rs 3.96/- lakhs has been provided as Deferred Tax Liability.

(Rs. in Lacs)

Deferred Tax Calculation		
Particulars	2019-2020	2018-2019
Opening Balance of Deferred Tax Asset/(Liability)	1.29	4.22
Depreciation as per Books	71.70	91.83

Depreciation as per income tax	86.95	101.22
Provision for Bad & Doubtful Debts	0.00	0.00
Deferred Tax Asset (Liability)	3.96	2.93
Tax Rate Prevalent for Current Year	26.00	31.20
Balance of Deferred Tax Asset/ (Liability)	(2.67)	1.29

- 37.** The Company primarily operates in a single segment of bulk water transmission through pipeline network in the geographical area of Gujarat and hence Segment reporting as required under Accounting Standard - 17 issued by the Institute of Chartered Accountants of India is not applicable to the company.
- 38.** No provision is made for interest and penalty regularly raised in the bills of supply of water by Sardar Sarovar Narmada Nigam Limited (SSNNL) since several years. A proposal for waiver of penalty and interest etc. has been made to SSNNL under the One Time Settlement Scheme declared by the Government of Gujarat which is under process.

39. Prior Period Adjustments

The details of prior period adjustment account in respect of each transactions of prior period is as follows.

Prior Period Adjustment

Nature of Payment	2012-13	2014-15	2015-16	2016-17	2018-19	Total
Incomes						
Sales	240				21570140	21570380
Power Charges					68780169	68780169
Interest		137292	137192			274484
Deffered Grant Income					68584484	68584484
GST Exp.					1541646	1541646
O & M Exp.					7420700	7420700
Other Income						0.00
Total (A)	240	137292	137192	0	167897139	168171863
Expenses						
Security task force Exp.					41623393	41623393
Depreciation					68299916	68299916
Sales		2942040	921204	85612		3948856
Other Exp.					2557263	2557263
Total (B)	0	2942040	921204	85612	112480572	116429428
GrandTotal(A-B)						51742434



40. The Management is of opinion that as on the Balance Sheet date, there are no indications of material impairment loss on Property, plant and equipment, hence, the need to provide for impairment loss does not arise.
41. The previous year's figures have been regrouped/rearranged wherever necessary to make them comparable with the figures of current year.
42. Gujarat Water Supply and Sewerage Board, (GWSSB) had paid an amount of Rs.1,107 crores as Advance Grant to the Company during the years 2011-12 to 2014-15, During this period the Company had returned to Rs. 250 crores.

The outstanding amount as on 31.03.2019 was Rs. 689.93 crores. During the year 2019-20 an aggregate amount of Rs. 286.10 crores being the amount receivable for water charges billed to them by us as accepted by GWSSB for adjustment against grant was adjusted. Accordingly an amount of Rs. 403.83 crores is appearing under Reserve & Surplus in Balance-Sheet.

For and On Behalf of the Board of Gujarat Water Infrastructure Limited :

AS PER OUR REPORT OF EVEN DATE,

For KISHAN M. MEHTA & CO.
CHARTERED ACCOUNTANTS
FIRM REG. NO : 105229W

(U.P. BHAVSAR)
PARTNER
M. No. 043559

Place : Ahmedabad
Date : 30.12.2020

UDIN No : 20043559AAAACS4095

For and on behalf of Board of Directors,

Sd/-
Mayur Mehta, IAS
Managing Director

Sd/-
Jaldeep Dave
Chief General
Manager (Finance)

Sd/-
Nirav Solanki
Director

Place : Gandhinagar
Date : 30.12.2020



Form No. MGT-11 Proxy form

[Pursuant to section 105(6) of the Companies Act, 2013 and rule 19(3) of the Companies (Management and Administration) Rules, 2014]

Name of the Member(s)		
Registered Address		
E-mail Id	Folio No /Client ID	DP ID

I/We, being the member(s) of _____ shares of the above named company hereby appoint

Name :	E-mail Id:
Address:	
Signature , or failing him	

Name :	E-mail Id:
Address:	
Signature , or failing him	

Name :	E-mail Id:
Address:	
Signature , or failing him	

as my/our proxy to attend and vote (on a poll) for me/us and on my/our behalf at the 21th Annual General Meeting of the company to be held on the 06th day of March, 2021 at 4:30 PM at Board Room, GWSSB, Sector-10/A, Gandhinagar and at any adjournment there of in respect of such resolutions as are indicated below.

Resolution No.

Sl. No.	Resolution(S)	Vote	
		For	Against
1.	Adoption of statement of Profit & Loss, Balance Sheet, report of Director's and Auditor's for the financial year 31st March, 2020		
2.	To fix remuneration of Statutory Auditor of the Company for F.Y. 2020-21		

* Applicable for investors holding shares in Electronic form.

Signed this _____ day of _____ 2021

Affix Revenue Stamps

Signature of Shareholder Signature of Proxy holder

**Signature of the shareholder
Across Revenue Stamp**

Note:

- 1) This form of proxy in order to be effective should be duly completed and deposited at the Registered Office of the Company not less than 48 hours before the commencement of the Meeting.
- 2) The proxy need not be a member of the company



ATTENDANCE SLIP

(To be handed over at the entrance of the meeting hall)

Annual General Meeting on 30th December, 2020

Full name of the members attending _____

(In block capitals)

Ledger Folio No/Client ID No. _____

No. of shares held: _____

Name of Proxy _____

(To be filled in, if the proxy attends on behalf of the member)

I hereby record my presence at the 21th Annual General Meeting of the
GWIL at Board Room, GWSSB Sector-10/A, Gandhinagar on
30th December, 2020 at 1:45 Hrs.

(Member's /Proxy's Signature)

Note:

- 1) Members are requested to bring their copies of the Annual Report to the meeting, since further copies will not be available.
- 2) The Proxy Form in order to be effective should be deposited at the Registered Office of the Company not less than FORTY EIGHT HOURS before the commencement of the meeting.
- 3) A Proxy need not be a member of the Company.
- 4) In the case of joint holders, the vote of the senior who tenders a vote, whether in person or by Proxy, shall be accepted to the exclusion of the vote of the other joint holders. Seniority shall be determined by the order in which the names stand in the Register of Members.
- 5) The submission by a member of this form of proxy will not preclude such member from attending in person and voting at the meeting.



The Companies Act, 2013
Consent by Share Holders for Shorter Notice
[(As per Section 101 (1))]

**To,
The Board of Directors**

Gujarat Water Infrastructure Limited,
Block No. 1, 1st Floor, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar.

I, _____, son/ daughter/ spouse of _____
_____ resident of _____ Holding 10 (ten) Equity Shares of
Rs. 10 each to the company hereby give consent, pursuant to Section 101 (1) of the
Companies Act, 2013, to hold 21st Adjoined Annual General Meeting on
30th December, 2020 at 1:45 Hrs in the Board room, GWSSB, 1st Floor, Sector-10/A,
Gandhinagar or any adjourned thereof at a Shorter Notice.

Signature :

Name :

Date :



Gujarat Water Infrastructure Limited

Govt. of Gujarat Undertaking

Block No. : 1, First Floor, Dr. Jivraj Mehta Bhavan,
Sector-10, Gandhinagar - 382010.

Ph. : 079 - 232 39537, 9978441147 / 48, Fax : 079 232 22396,

E-mail : gwilcompany1@gmail.com